

# પ્રકાશ

અનુકૂળ

જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૬

## પ્રત્યક્ષીય

બન્ધુલ તિપાઈ - હીંચકાનો ઝૂલો અટકતો નથી....૩

## સમીક્ષા

કલિંગ (કવિતા : અશોકપુરી ગોસ્વામી) ધ્વનિલ પારેખ ૫

કર્ણાલોક (નવલકથા : ધ્રુવ ભણ) ધીરેન્દ્ર મહેતા ૭

પ્રવેશદ્વાર (વાર્તા : દીવાન ઠાકોર) પ્રફુલ્લ દેસાઈ ૧૦

ફટફટિયું (વાર્તા : સુમન શાહ) મોહન પરમાર ૧૩

બ્રિટન : આદમકદ અરીસામાં (પ્રવાસ-ચિંતન : અદમ ટેકારવી) રમેશ બી. શાહ ૧૮

સૂતર સ્નેહાં (પ્રવાસ-નિબંધ : પ્રીતિ સેનગુપ્તા) દર્શના ધોળકિયા ૨૩

ગંગલ (વિવેચન : શકીલ કાદરી) હેમંત ધોરડા ૨૫

## અવલોકન

બ્રોમ્બલ બુશ (વાર્તા : પ્રફુલ્લ દેસાઈ) ગુજરાતંત વ્યાસ ૨૮

માતૃ-પ્રદક્ષિણા (ચરિત્ર : સંપા. દીપક મહેતા) ઉર્વી તેવાર ૩૦

બાળઉછેરમાં બાળસાહિત્યનું સ્થાન (ચિંતન : ઈશ્વર પરમાર) ઉર્વી તેવાર ૩૧

બોન્સાઈ : વામનવૃક્ષ (વિજ્ઞાન : બાલકૃષ્ણ જોશી, ઈશ્વર કૃષિકાર) રૂપલ સોની ૩૨

## વરેણ્ય

ઉપટેલા રંગોથી રિસાયેલી ભીંટો (કવિતા : વિપાશા) ચંદ્રકાન્ત ટોપીવાળા ૩૩

## પત્રચર્ચા :

યોસેઝ મેકવાન સુરેશ જવેરી મનોજ રાવલ ૩૬

## સામયિક લેખસૂચિ : ૨૦૦૫

કિશોર વ્યાસ ૩૮

## પરિચય મિતાકશરી

સંકલન ધ્વનિલ પારેખ ૫૦

આ અંકના લેખકો ૪૬

# પ્રત્યક્ષ

વર્ષ ૧૫ અંક ઉ જુલાઈ-સપેન્ટેમ્બર ૨૦૦૬ સુણંગ અંક ૫૮ સંપાદક રમણ સોની

પ્રકાશક અને મુદ્રક શારદા સોની ૧૮, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા ૩૮૦૦૧૫  
ચાઈપસોટિંગ : શારદા મુદ્રણાલય, ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ - ૦૬ ફોન : ૨૬૫૬૪૨૭૮  
મુદ્રણસ્થાન : મધુ પ્રિન્ટરી, કારેલીબાગ, વડોદરા - ૩૮૦ ૦૧૮

'પ્રત્યક્ષ'નું સભ્યપદ ચાર રીતે મેળવી શકાય છે : વાર્ષિક, દ્વિવાર્ષિક, આજીવન અને શુભેચ્છક સભ્ય.  
વાર્ષિક / દ્વિવાર્ષિક સભ્યોએ મુદ્રણ પૂરી થતાં એમનાં સભ્યપદ તાજાં (રિન્યુ) કરાવી લેવાં. સૌ સભ્યોને 'પ્રત્યક્ષ'  
નિયમિત મોકલવામાં આવશે તથા પ્રત્યક્ષનાં પ્રકાશનો પર વળતર આપાશે.

સભ્યપદ અંગેની વિગતો	વાર્ષિક રૂ. ૧૫૦	દ્વિવાર્ષિક રૂ. ૨૫૦
આજીવન સભ્યપદ :	વ્યક્તિ રૂ. ૧૨૦૦	સંસ્થા રૂ. ૧૫૦૦
શુભેચ્છક સભ્યપદ :	વ્યક્તિ રેમજ સંસ્થા	રૂ. ૨૫૦૦
વિદેશ માટે : વાર્ષિક :	ડોલર ૨૦, પાઉંડ ૧૫; આજીવન :	ડોલર ૧૦૦, પાઉંડ ૭૫.

સભ્યપદની રકમ હાથોહાથ, મનીઓર્ડરથી કે ડ્રાફ્ટથી મોકલી શકાશે. બહારગામના ચોક સ્વીકારતા નથી.

ચોક / ડ્રાફ્ટ 'શારદા સોની પ્રકાશક પ્રત્યક્ષ' એ નામે જ લખવા વિનંતી.

મ. ઓ. મોકલનારે સંદેશાની જગાએ પોતાનું પૂરું સરનામું અવશ્ય લખવું.

સભ્યપદની રકમ મોકલવાનાં સરનામાં

વડોદરા : શારદા સોની, ૧૮, હેમદીપ સોસાયટી, ટાગોરનગર પાછળ, જૂના પાદરા રોડ, વડોદરા ૩૮૦૦૧૫

હાથોહાથ સભ્યજી નીચેનાં સરનામે પણ આપી શકાશે : અહીં મ.ઓ. કે ચોક ન મોકલવાં.)

મુંબઈ : નીતિન મહેતા ૪૦૧/બી, શિલ્પા ટેરેસ (ન્યૂ), શિલ્પોલી રોડ બોરિવલી (૪.) મુંબઈ ૪૦૦૦૮૨ ભાવનગર : જ્યંત મેઘાળી પ્રસાર, ૧૮૮૮ આતાભાઈ એવન્યુ ભાવનગર ૩૬૪૦૦૨ રાજકોટ : નીતિન વડગામા 'તાંદુલ' સ્વાતિ સોસાયટી, વિરાણી સાયંસ કોલેજ પાછળ, રાજકોટ ૩૬૦૦૦૫ વલસાડ : જાકળ એજન્સી, ૧૮, મણિબાગ, ધરમપુર રોડ, અબ્રામા, વલસાડ - ૩૮૬૦૦૭ અમદાવાદ : ઈમેજ પલિંકેશન : ૧-૨, અપર લેવલ, સેન્ચ્યુરી માર્કેટ, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૬ (ઇમેજમાંથી છૂટક નકલ પણ મળી શકશે.)

પ્રત્યક્ષનું વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર મુજબ ગણાય છે એટલે અધવચ્ચે ન મોકલતાં ડિસેમ્બર (મોડામાં મોડું ફેબ્રુઆરી) સુધીમાં સભ્ય ઝી મોકલી આપવા વિનંતી

'પ્રત્યક્ષ' વર્ષમાં ચાર વાર - માર્ચ, જૂન, સપેન્ટેમ્બર અને ડિસેમ્બરના અંતે - પ્રકાશિત થાય છે.

## સંપાદકીય પત્રવ્યવહાર

રમણ સોની ૧૮, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂના પાદરા રોડ, વડોદરા ૩૮૦૦૧૫  
ફોન : (૦૨૬ ૫) ૨૭૫૭૧૮૭, ૮૨૨૮૨૧૫૨૭૫ E-mail : ramansoni11@yahoo.com

## પ્રત્યક્ષીય

બકુલ ત્રિપાઠી - હીંચકાનો જૂલો હજુ અટકતો નથી.....

બકુલભાઈની છેલ્લામાં છેલ્લી મુદ્રા - ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની. સાહિત્યકાળને અને મરમાળાપણાને એમણે આવા પણ ઉપર રાખ્યાં, હંમેશાં. પરિષદપ્રમુખ તરીકે તે મૈત્રીભર્યા ઉત્સાહથી જ સતત પ્રવર્તતા રહ્યા. કંઈક નવું કરવું હતું, નવી દિશા ભલે પણથી જે. ઉમંગપૂર્વક એ બધી ફરી વળવા માગતા હતા - નવોદિત સર્જકો વચ્ચે, શિક્ષકોમાં ને વિદ્યાર્થીઓમાં, બહોળા ચાહક વર્ગમાં પણ. 'પરિષદના ઉત્કર્ષ અને પ્રસાર માટે હું મારા હસાવવાના કાર્યક્રમો પણ કરીશા,' એમણે કહેલું, મેં કહેલું, 'બરાબર બકુલભાઈ, પણ પરિષદનું પહેલું કામ વિદ્યાનું છે, વિદ્યાસંવર્ધન અને વિદ્યાપ્રસારનું.' એમનો જવાબ હતો : 'એ ખરું, પણ અંદર વિદ્યાકાર્ય કરીએ, બહાર મૈત્રી, મિત્રતા દ્વારા પરિષદપ્રસાર' અસંમતિની સ્થિતિમાં પણ એ મિત્રતાનો અનુભવ કરાવતા. ૭૮ની વયને પ્રવેશવા ન ઢેંટું તરબાટ બર્યું ગુલાબી હાસ્ય અને એમણે બનાવેલી કોઝી પીતાં પીતાં, હીંચકે જૂલતાં કરેલી કડક-મીઠી વાતો - એમની સાથેના છેલ્લા મેળાપનું કાયમી બનનારું ચિત્ર છે. પરિષદ-પ્રમુખ તરીકે પોતે મધ્યસ્થ આદિ બેઠકો કેવી અ-પૂર્વ અને અસરકારક રીતે ચલાવે છે. ('હું મેનેજમેન્ટનો માણસ ખરો ને !') એનો માફકસરનો ગર્વ પણ એ અનુભવતા હતા. હા, હવે કહેવું પડે છે, '- હતા' !

પરંતુ બકુલભાઈની પહેલામાં પહેલી ઓળખ - બહુ સ્પષ્ટ રીતે બહાર પણ ઊપરી રહેલી મુદ્રા તે હાસ્યસાહિત્યના એક 'સાદાબહાર' સર્જકની. હાસ્યદેખો લખતા ગયેલા ને રોજેરોજ એક (ક્યારેક એક્ષિયક) લેઝ છાપામાં એને પ્રસારતા ગયેલા. પંચાવન જેટાં વર્ષો સુધીની કારકિર્દીમાં, એ બધાનો સરવાળો કરીએ, કે અંદાજુએ તોપણ, 'ઢગલાનંદ' કહેવું પડે એટંબું બધું એમણે લાખ્યું. પરંતુ એ એક વાત. એમણે આ બધાની ગાંસડીઓ બાંધી નહીં - ચોપડીઓ બનાવી નહીં. ચોપડી કરવાની આવી ત્યારે એમણે બહુ કાળજી રાખી, ખરેખર ચુસ્ત ચ્યાન કર્યું - સભાનતાથી, સામયિકીમાં લાભેલું એને પુસ્તકમાં અભિમતા આપી. ક્યારેક એક-વિષય-લક્ષ્ય પણ રાખ્યું જેમકે 'દ્રાષ્ટાચાર્યનું સિહાસન' તો ક્યારેક સ્વરૂપ-વાનગી-વૈવિધ્ય પણ રાખ્યું જેમકે 'ગાંધીજીના બકરીના બકરાનો...', વગેરે. એટલે તે આપણા વ્યાપક હાસ્યદેખક જ નહીં, હાસ્યનિબંધકાર રૂપે વિકસ્યા. વર્તમાનપત્રની વ્યાપકતાએ એમને ઘણું સંપડાવ્યું - લોકપ્રિયતા, પ્રતિષ્ઠા અને સર્વમૈત્રી. પણ નિબંધ લખ્યા ત્યારે એમણે વળી 'મન સાથે મૈત્રી' પણ કરી. હા, એમનો એવો, ભલે ચર્ચાસ્પદ બને પણ, ભારપૂર્વકનો પ્રેમાગ્રહ હતો કે હાસ્યનિબંધ એ લખિત નિબંધ જ છે. એમાં એમનો અભિલાષ પણ પ્રગટ થતો હતો. નિબંધને ક્યારેક લખિત કરતાં કરતાં એ ચિંતનમાં પણ સરી પડતા, જરાક ઊરે ઉંતરી જતા. જુઓ, 'મન સાથે મૈત્રી' (સંગ્રહ)નો છેલ્લો, પ્રીમો, આગલા પ્રથી જુદી પડી આવતો નિબંધ.

હાસ્યનિબંધકાર તરીકેની સર્જકશક્તિ સહજસ્કૂર્ટ વેગવાળી હતી, છાપામાં પણ એવી અજસ્તતાનો અનુભવ તો થતો. વળી સજ્જતા પણ ઘણી. એટલે એમના નિબંધોમાંનું હાસ્ય-આલેખન બહુઆયામી હતું. ઉછળી આવતી, ક્યારેક ઝરણાની જેમ મનને પખાળી જતી નર્મશક્તિ તો સતત વહેતી હતી, ઉપરાંત માર્મિકતાનાં ધાર ને ચમક પણ એવાં સબળ. અલખત, ધાર કરતાં ચમક જ વધારે; કટક પણ રક્તરંગી નહીં, ગુલાબી બની રહે. રમણભાઈ નીલકંઠના કટક જેવો કાતિલ નહીં. મનુષ્ય-વર્તનની ઝીણી ઝીણી ખાસિયતો, જાતભાતનાં લક્ષણો-અપલક્ષણો પકડવાની ઘણી સૂઝ, એટલે પરિસ્થિતિનું કે વ્યક્તિનું વિ-ચિત્રીકરણ કરે ત્યારે એમનો દસ્તિકોણ જ વિશેષ સ્પૃહણીય બની જાય. બકુલભાઈની હાસ્ય-ભાષાનાં (વંગેજ ઓફ લ્યુમરનાં) આયામો પણ ઘણાં - કોઈએ સ્વતંત્ર અત્યાસ કરવા જેવાં. નાગરી મરમાળાપણાથી લઈને બોલચાલની ઘરેળુ (કોલોકિયલ) વાતચીતની લક્ષણ-વિશિષ્ટતાઓ એમનાં આલેખનોમાં ઝડપાઈ છે, છિલાઈ છે. અને નિરૂપણમાં, દાવકા વર્ણનથી ગુંથાતા નર્મથી લઈને નાટકની વિરસ્ટોટકતા, આણા હડદોલા ને પંચમાં વ્યક્ત થતા વક-મર્મો ધ્યાનાર્હ છે.

શ્રેષ્ઠો અને વર્ણવૈચિત્ર્યો, વિ-રૂપીકરણ ને વિ-સ્થિતિ-નિરૂપણની સાથેસાથે એમની પાસે વિ-સંદર્ભીકરણનું સજજતાભર્યું ઉપકરણ પણ હતું. ‘મારી મીઠડી શાલ’ નામના નિબંધમાં ઉપયોગી વસ્તુ માટેનું મમતવ-વળગણ હાસ્ય-કારણ બને છે. શિયાળો પૂરો થયો એટલે શાલનો ત્રિયોગ. હવે ક્યારે ? એક આચાસન છે – ઉનાળો ને પછી ચોમાસુ જ્શો એટલે વળી પાછી શિયાળો આવશે જ. કેમકે ‘ઈફ રિઝિંગ કમ્સ, કેન વિન્ટર બી ફાર બિહાઈન્ડ ?’ વિસંદર્ભીકરણની આ પ્રયુક્તિ હાસ્યકારની અને અભ્યાસીની ઉભયની શક્તિઓએ આપેલી છે. ઉત્તમ કવિ માટે તેમ ઉત્તમ હાસ્યકાર માટે સર્ગશક્તિ ઉપરાંત ચિંતન-વાચન-અભ્યાસે ઘૂંઠી આપેલી બુન્ધત્તિ – સજજતા પણ એટલી જ આવશ્યક.

હાસ્યલેખો-નિબંધો ઉપરાંત બકુલભાઈને નાટકો લખવાનું પણ ગમેલું. ‘વીર નદેશકુમાર’ જેવું એકાંક્ષી; ‘લીલા’ નામે લાંબું નાટક અને હમજાં, ૨૦૦૪માં, મોલિયેરના ‘દ મલાદે ઈમેજનેર’ના ભાવાનુવાદ રૂપાંતર જેવું ‘પરણું તો એને જ પરણું’ ક્યારેક હાસ્યવાર્તા, ને વળી હાસ્યકવિતા લખવા સુધી પણ એ ગયેલા ! લખ્યું એટલે બધું જ લખ્યું – આંગળીઓ ટેવાપેલી હતી.

બકુલભાઈ હાસ્યચિંતક પણ ખરા. એમના સંગ્રહોની પ્રસ્તાવના આદિરૂપે એમણે એમના વિચારો લખ્યા છે. એ વિશે અંગત વાત કે જાહેર વક્તવ્ય કરતી વખતે એ ગંભીર થતા જતા, ઊંડા ઉિતરતા જતા. હાસ્ય વિશેનો એક, કોઈને અધરો લાગે એવો, લાંબો લેખ એમજો કરેલો. એ ક્રાંત્ય છાપાયો કે ડેમ, ખબર નથી. પણ એની હસ્તપ્રતની એક નકલ મને વાંચવા આપેલી, ત્રણેક વરસ પહેલાં. એમના અક્ષરોમાંથી પસાર થવા માટે પણ બીજીવાર વાંચવાની થયેલી.

હા, એમના હસ્તાક્ષરોનું ફલક દુર્વાચયથી માંડીને અવાચ્ય સુધીનું. પત્રો સિવાયનાં, છપાવવા માટેનાં લખાશોમાં એમના હસ્તાક્ષરો ઓછા દુર્વાચય હરો.

પરિષદમાં એમના પ્રમુખ-કાળને આઠેક મહિના થયા હશે. સ્વતંત્ર નિર્ણયો, બધાને સાથે રાખીને પણ, ઉપસાવવાની એમની મથામજા હતી. એમાં એમને બાંધવા મથનારની સામે એમને બીજ પણ હતી. પરિષદ વિશેના ‘પ્રત્યક્ષીયાથી એ પ્રસન્ન હતા બલકે એમનું વલણ સ્વીકાર-સમર્થનનું હતું. ફીનથી, રૂબરૂ મળતા તારે એ રાજ્યો વ્યક્ત કરતા. ૨૦૮૫ જુલાઈએ એમણે મને લખેલા પોસ્ટકાર્ડમાં એ સ્પષ્ટપણે પ્રગટ થયું હતું. એ પત્ર અર્થી મુક્કું –

બકુલ ત્રિપાઈ, અમદાવાદ ૨૦-૭-૨૦૦૬

#### સ્નેહી રમણભાઈ

અંગત કૌટુંબિક શુભપ્રસંગે થોડાં અઠવાડિયાં USAમાં આનંદમાં ગાળ્યાં. રથી જુલાઈએ આવીને તમને રાજ્યભૂષણીનો ફોન કરેલો. ખરી (સાહિત્યિક) પ્રવૃત્તિઓને ત્યાં આ વખતે અવકાશ નહોતો. ફીન પર મિત્રો મળ્યા.

ખરી સાહિત્ય સંસ્થા (કોઈપણ)ના સ્વરૂપ-કાર્યો-હેતુઓ-દિશા અંગે સર્વત્ર સૌ મંથનકાળમાંથી પસાર થઈ રહ્યા દેખાય છે. સપ્ટેમ્બર ૭-૮ એ વોંશિંગન્ટમાં સંમેલન છે. ઓહાયોમાં (અવાચ્ય) સંસ્થાએ પણ પહેલી જ વાર સાહિત્યિક કાર્યક્રમો યોજ્યા. ત્યાં ડિસેમ્બરમાં અકાદમી (સરકારી નહીં)ની ચૂંટણી (કે જે થાય તે) છે. સર્વત્ર મનોમંથનો ચાલુ હોવાના અષ્ટસાર મળ્યા.

તમે પ્રત્યક્ષમાં તો ચર્ચા-વિચારણાને વેગ આપવાનું અદ્ભુત કાર્ય કર્યું. આ અંકમાં ભાઈ સિતાંશુએ વાતને ‘કંડામેન્ટલ્સ’ સુધી પહોંચાડી. તમને – એમને બેઠુને અભિનંદન.

ક્યારે મળીશું ? (સપ્ટે. માં મધ્યસ્થ બોલાવવાનો નિશ્ચય છે....). પ્રત્યક્ષની મજા એ છે કે પરિષદ-ચર્ચાઓ ઉપરાંત અન્ય બધાય વિભાગો સમૂહ-રસમય રહ્યા છે – રહે છે.

મિત્રને વાદ કહેશો.

– બકુલ ત્રિપાઈનાં વંદન

હજુ તો ઘણો કડવો-તીખો ને મધુર સંવાદ કરવાનો હતો એમની સાથે. ત્યાં જ, અચાનક, આ શ્રદ્ધાંજલિ એમને મોકલવાની આવી.....પણ હીંચકાનો જૂલો અંદર હજુ અટકતો નથી..

૧૨ સપ્ટેમ્બર ૨૦૦૬

– રમણ સોની

## કલિંગ - અશોકપુરી ગોસ્વામી

## સ્વરૂપ-શિસ્ત જાળવવી પડે

આર. આર. શેડ, અમદાવાદ-મુંબઈ, ૨૦૦૫, કા. ૧૨૦ રૂ. ૬૦

## ધ્વનિલ પારેખ

‘કુંવો’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત થયેલા અશોકપુરી ગોસ્વામીનો ‘અર્થાત્’ પછીનો આ બીજો સંગ્રહ છે. ‘કલિંગ’માં ૧૦૮ ગઝલોનો સમાવેશ છે.

સંગ્રહની મોટા ભાગની ગઝલોનો મિજાજ પરંપરાગત છે. કાફિયા, રદીફ કે અભિવ્યક્તિ અંગે પણ પ્રયોગશીલ વલણ કવિને અભિપ્રેત નથી. સંગ્રહના શીર્ષક ‘કલિંગ’ સંદર્ભ કવિ નોંધે છે, “અહીં પેલા... અશોક, સપ્રાટ અશોક અને કલિંગની વાત ન હોવા છતાં તલવાર લઈ કલિંગમાં પ્રવેશતા અને ભિક્ષાપાત્ર લઈ કલિંગની બહાર નીકળતા અશોકને હું મારામાં અનુભવી રહ્યો છું” (‘હું અને મારી ગજલ’, પૃ. ૮) અશોકપુરીની ભીતર રહેલા આ બંને અશોકની મનઃસ્થિતિનું પ્રતિબિંબ સંગ્રહમાં ડિલાતું નથી. કવિની વાતને પોતાના નામ, સંગ્રહના શીર્ષક કે આવરણચિત્ર સાથે જ નિસબ્ધત છે, સંગ્રહમાંની રચનાઓ સાથે નથી.

સૂર્ય, અંધકાર, દરિયો, નદી, દર્પણ કવિનાં પ્રિય કલ્યાણો છે. અહીં ઢૂકી બહેરમાં લાખાયેલી ગઝલોમાંથી નોંધપાત્ર શો’રો મળી આવે છે. જેમ કે-

લોક એવી જ રીતે જરે છે,  
સાવ અંધાર તોય સીવે છે. (પૃ. ૧૧)

નાવમાં જળ નર્યુ  
કોઈ પણ ક્યાં ડર્યુ? (પૃ. ૧૦૧)

ગઝલનું સ્વરૂપ છેતરામણું છે. શો’રનું તરત થતું પ્રત્યાયન એની લાક્ષણિકતા હોવાને કારણે સરળતા એને અપેક્ષિત છે તો ગહનતા પણ એને સરળતાની સાથે જ અપેક્ષિત છે. સરળતા અને ગહનતા એક સાથે તાગી ન શકનારા ગઝલકારોને ગઝલ હાથતાણી આપી જાય છે. કાં તો સપાટ અભિવ્યક્તિ જોવા મળે છે કાં તો ગહનતાના નામે દુર્ભોધતા જોવા મળે છે, જે કોઈ પણ રીતે ગઝલને

અનુકૂળ નથી. ‘કલિંગ’માં ગઝલનો મિજાજ જળવાયો હોય એવા કેટલાક શો’ર –

મને તો એમ લાગે સૂર્યને પણ છે ગરજ જેવું,  
સતત અંધારને કરતો રહ્યો એ પણ અરજ જેવું. (પૃ. ૨૦)

છે ગજુ એના સ્મરણનું એટલું,  
સાવ ખાતી ઓરડો ભરચક કરે. (પૃ. ૧૬)  
જેને કહો છો બેજ હકીકતમાં થાક છે,  
ઘરની ભીતોને દોસ્ત પસીનો વળેવ છે. (પૃ. ૫૧)

એમણે રસ્તો કર્યો  
આપણે ભીતો ચણી (પૃ. ૭૬)

પૃ.૨૮ અને પૃ.૮૬ ઉપરની બંને રચનાઓમાં ગઝલનો મિજાજ સાંદ્રેત જળવાયો છે. બંને ગઝલના એકએક શો’ર ઉદાહરણરૂપે જોઈએ –

હાસ્ય એનું પણ પૂરી બાતમી,  
કેટલું અંદર રડે છે આદમી. (પૃ. ૨૮)  
બધાનું જ માનીને રોકાયો છું પણ,  
સતત યાદ રાખ્યું નીચરવાનું પણ છે. (પૃ. ૮૬)

કવિની ભીતર રહેલો ભગવો રંગ પણ ગઝલના મિજાજમાં અહીં અભિવ્યક્ત થયો છે –

ભીતર નવા જ રંગને ભાળી લીધા પછી,  
છાંટે બીજો ન જોઈએ મનગમતા રંગને. (પૃ. ૪૩)  
થીગાંથી ઓળખાશું,  
થીગાંથું ભગવું જડવું છે. (પૃ. ૭૮)

ઈશ્વર સાથેનો કવિનો સંબંધ ભક્તનો રહ્યો છે. કોઈ પણ મુશ્કેલીમાંથી ઈશ્વર જ ઉગારશે એવી કવિશ્રદ્ધા શો’રોમાં આ રીતે બ્યક્ત થઈ છે –

ખાતરી છે એટલે તો સ્વસ્થ છું હું,  
એ જ હુબાડી પણીથી તારવાનો. (પૃ. ૩૦)

પ્રાયો

દુલાલાંસંહ.૨૦૦૬

૨

જોઈને ખાતાવહી એણે કર્યું,  
જા, કર્યું બાકી નથી એણે કર્યું. (પૃ. ૬૩)

તો દંભી અને ધુતારા એવા ખુદાના બંદાઓ સામે  
કવિને ફરિયાદ પણ છે -

‘ખુદા હેગા’ કહીને ય માર્ગી રહ્યો છે,  
ફકીર આખરે આદમી નિકળ્યો છે. (પૃ. ૭૫)

‘છે રહેમ રાહે’ (પૃ. ૫૭), ‘માંડીને વાત કરુ’ (પૃ. ૫૮), ‘સાહેબ મેરો’ (પૃ. ૭૮), ‘પરોક્ષા’ (પૃ. ૮૮) ચીલાચાલુ રદીજીણી દૂર હઠીને કવિએ અહીં જુદી રદીજીના વિનિયોગથી પોતાની અભિવ્યક્તિ સાથી છે. પૃ. ૪૨ ઉપરની નદી-વિષયક ગાઝલ પણ આસ્વાદુ છે.

ગજલસંગ્રહના અંતે મુકાયેલા લેખ ‘ગુજરાતી  
ગજલ વિશે થોડી વિચારણા’માં કવિ જગ્જાવે છે,  
“આધુનિકતાના કુર્મભાવે માત્ર કાણ્દ્યા-રદીફ પ્રયોગને,  
છંદ-બહેર જાળવીને બાલીશ ગજલ જોડનારા ઉત્સુકોએ  
વાપસીમાં લીટા કરવા જેવી રમત કરીને ગજલો રચી, કહી,  
મુશાયરામાં ગજવી. આમ કરી ગજલને ઘણી હાનિ  
પહોંચાડી છે, ગજલની ગતિને અવરોધી છે એ તો સૌને  
હવે સમજમાં આવ્યું છે. દોઢં-બે ડઝન અનુશાસનહીન  
કવિઓ એકસરખાં પ્રતીક, કલ્પના, થોડી ચૃતુરાઈ, થોડી  
શબ્દરમત, અનુકૂળ પડે તેવી પદાવલીમાં યોજ્યપોજી  
બીબાદાળ ગજવો ઊંધું ઘાલી ભાળવામાં વસ્ત છે, મસ્ત  
છે. હજુયે છે !” (પૃ. ૧૦૮) ગજલને આત્મસાત્ર કરનારા  
સર્જકો જાણે છે, કે કાણ્દ્યા રદીફ જાળવીને છંદમાં બે  
મિસરા રચી દેવાથી શે’ર સિદ્ધ થતો નથી. કાણ્દ્યા, રદીફ  
અને છંદ ઉપરાંત ચમત્કૃતિ મહત્વની છે, જેને આપણે  
ગજલ સંદર્ભે મિજાજ તરીકે ઓળખીએ છીએ. મિજાજ  
જાળવવાનો અર્થ એ પણ નથી થતો કે સ્વરૂપની સાથે  
સર્જક પોતાને મનજ્ઞાવે તેવી છૂટ લઈ શકે. કાણ્દ્યા, રદીફ,  
છંદ અને મિજાજ જાળવીને ગજલ સિદ્ધ કરવી અધરી છે.

‘કવિંગ’માં ગુજરાતનો મિજાજ તો જળવાયો છે પણ કવિએ સ્વરૂપ સાથે ઘણાં બધાં ચેડાં કર્યા છે અને એ રીતે એમણે પણ ગુજરાતના સ્વરૂપને તો ‘હાનિ’ જ પહોંચાડી છે. પૃ. ૨૫ ઉપરની ગુજરાતમાં કવિએ ‘ગ્રંથસ્થ’, ‘કંઠસ્થ’, ‘ગર્ભસ્થ’, ‘તટસ્થ’, ‘સ્વસ્થ’ કાણ્ણિયા પ્રયોજયા છે. આ ગુજરાતના એક શે’રમાં ‘અદરશ’ કાણ્ણિયા પ્રયોજયો છે જે કાણ્ણિયાની અનિયમિતતા દર્શાવે છે. પૃ. ૨૦, પૃ. ૬૧, પૃ.

૮૪, પૃ. ૧૦૫ ઉપરની ગજલોમાં પણ કાણ્ણિયાની અનિયમિતતા જોવા મળે છે. હવે, પૃ. ૧૩ ઉપરની ગજલનો આ અંતિમ શેરુ જુયો -

અજવાસનો શં અર્થ? જે કેવળ મને મળે!

દશ દશ દિશાઓ તેજથી ઝળહળ સ્વયં બને.

આ ગુણલમાં ‘વમળા’, ‘કુમળા’, ‘સરળા’, ‘સફળા’, ‘છળા’ કાફિયા છે. ‘બને’ રહીએ છે. ઉપરોક્ત શે’રમાં કાફિયા અને રહીએ વચ્ચે ‘સ્વયં’ પ્રતેશી ગયો છે, જેને પ્રયોગ ગણવો, પ્રયોગખોરી કે અભાનતા ?

ઇંદ-વૈવિધ્ય અર્ડી આજું નથી. ગજલના અતિ-  
પ્રચલિત ચાર-પાંચ ઇંદોમાં જ મોટા ભાગની ગજલોની  
રચના થયેલી છે. નીચેના બે શેરે જુઓ -

કેમ હું હરખાઉ? છું કાગળની હોડી,  
આ હયાતી કેવળ જળના બોધમાં છે.

પ્રથમ મિસરાનું બંધારણ ‘ગાલગાગા ગાલગાગા ગાલગાગા’ છે. જ્યારે બીજા મિસરાનું બંધારણ ‘ગાલગાગા ગાગાગાગા ગાલગાગા’ છે. ત્યાં છંદદોષ જોવા મળે છે.

આપણાં હસ્તધૂનન ક્યાંથી સાર્થક બને ?  
હથનું હેત હૈયે પ્રસરતું નથી. (૫. ૮)

અહીં પ્રથમ ભિસરાનું બંધારણ ‘ગાલગા ગાલગા ગાગાગા ગાગાગા’ છે જ્યારે બીજા ભિસરાનું બંધારણ ‘ગાલગા ગાલગા ગાલગા ગાલગા’ છે. એટલે, પ્રથમ ભિસરામાં એક ગુરુ વધારે છે અને છંદદોષ પણ જોવા મળે છે. હવે, આ શે’ર જુઓ –

આવ ચાલી આવ સૌ સરહદ વટાવી,  
આ ગજલ તો આપણી જગ્યાર છે. (પૃ. ૧૮)

અહીં પ્રથમ મિસરાનું બંધારણ ‘ગાલગાગા’ ગાલગાગા ગાલગાગા’ છે જ્યારે બીજા મિસરાનું બંધારણ ‘ગાલગાગા ગાલગાગા ગાલગા’ છે. એટલે, બીજા મિસરામાં એક ગુરુ ઓછો છે. આમ, મિસરામાં ક્યાંક ગુરુ વધી જાય છે તો ક્યાંક ગુરુ ઘટી જાય છે, જે મોટી મર્યાદા બની રહે છે.

ગજલના બંધારણ મુજબ મતલાનો શે'ર કમમાં  
પ્રથમ આવે છે. પુ. ૪૬ ઉપરની ગજલમાં 'પડે', 'આભડે',

‘આથડે’, ‘સાંપડે’, ‘નડે’, ‘આવડે’ કાફિયા કવિએ પ્રયોજ્યા છે. ગજલના ચોથા શે’રના બંને મિસરામાં કાફિયા-રદીફ છે અને એ મત્તાનો શે’ર હોવા છતાં કવિએ એને ચોથા ક્રમે મૂક્ખો છે. એ જ રીતે પૃ. ૫૮ ઉપરની ગજલમાં છણા ક્રમે મુકાયેલો શે’ર પણ મત્તા છે જ્યાં પણ ક્રમ જળવાયો નથી. આમ, કવિએ ગજલના આંતર અને બાધ્ય સ્વરૂપ સાથે પોતાને ફાવે એ રીતે ઠીક ઠીક છૂટ લીધી છે.

એ અકેલી જ પામી શકી એમને,  
કાખઘોડી ત્યજને જે દોડી હતી. (પૃ. ૩૮)

અહીં ‘અકેલી’ શબ્દ આખા શે’રમાં આગંતુક લાગે છે. કવિને અભિપ્રેત ‘એકેલી’ છે. તો પૃ. ૮ ઉપરની ગજલના મત્તાના બીજા મિસરામાં ‘ઉછરતું’ શબ્દ આગંતુક લાગે છે. કવિને ‘ઉંગતું’ શબ્દ અભિપ્રેત છે પણ

એ પ્રયોજવાથી છંદદોષ આવે ! એટલે, કવિએ અહીં ભાષાકીય છૂટછાટ પણ લીધી છે. ગજલ સ્વરૂપની શિસ્ત ન જાળવનાર આ કવિ અન્યને ‘અનુશાસનહીન’ કહે છે ત્યારે એમની સામે એકથી વધુ આંગળી શિંધાય એમ છે ! અભિવ્યક્તિને સ્વરૂપનાં બંધનો જરૂરી નથી એવી વાત આગળ કરીને સ્વરૂપ સાથે ચેડાં કરવામાં આવે છે અને દોષ ગજલ સ્વરૂપનો કાઢવામાં આવે છે. સોનેટ લખતી વખતે એનું છંદ-બંધારણ જાળવવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી ગજલ લખતી વખતે પણ છે, એનું જ્યારે ગજલકારો સમજશે ત્યારે ગજલને ઓછી હાનિ થશે અને સ્વરૂપની ગરિમા પણ જળવાશે. બાકી, ‘કલિગ’ની ગજલોમાં અભિવ્યક્તિની સચ્ચાઈ જરૂર છે. એ સચ્ચાઈ સ્વરૂપ-શિસ્ત જાળવીને પ્રગટી હોત તો કદાચ પરિણામ જુદું હોત !

## કર્ણલોક - ધ્રુવ ભણુ

## કથાની તાત્ત્વિક ભૂમિકા અને સ્વરૂપની તપાસ

ગુજરાત, અમદાવાદ, ૨૦૦૫, કા. ૨૫૬, રૂ. ૧૧૦

ધીરેન્દ્ર મહેતા

આપણો એક વાત સમજ લઈએ. બાપ ગમે તે હોય, આપણો નથી જાણતા; પણ ગોમતી તેના પોતાના છોકરાની મા થવાની છે. એના છોકરાને કોઈ કર્ણ નહીં કહે. એ પાંડવ ગણ્ણાશે, કારણ કે તે જન્મે તેવી ઈચ્છા ગોમતીની પોતાની છે; બીજા કોઈની નથી. જરા બરાબર સમજ, પાંડવોના જન્મ માટે કુંતીની સંમતિ હતી અને કર્ણનો જન્મ કુંતીની સ્પષ્ટ ના હોવા છતાં થયો હતો. માટે જ કર્ણને પાંડવો કરતાં જુદું જીવન જીવતું પડ્યું. (પૃ. ૨૧૦)

આ ગોમતી પતિની ક્ષતિને કારણે માતા બની શકે એમ નથી એટલે પતિની સંમતિથી એ ફૂત્રિમ ગર્ભધાન કરાવે છે. પતિનું મૃત્યુ થાય છે અને પિયર કે સાસરાને આ સ્થિતિ સ્વીકાર્ય નથી.. ગોમતી સમાજસેવારત નિમુબહેનને આશ્રયે છે. નિમુબહેન ગોમતીની માતાને સમજાવતી વખતે ઉપર પ્રમાણે કહે છે.

વાર્તા અનાથાલયનાં બાળકોની છે, જેને લેખકે ‘કર્ણલોક’ એવું નામ આપ્યું છે પરંતુ એ ભૂલવું ન જોઈએ કે કર્ણને વેઠવા પડેલા અન્યાયોનું કારણ તેની અનાથ સ્થિતિ નથી, ‘હીન’ કુળ છે. આ અર્થમાં આ કર્ણલોક નથી. બીજું, અનાથાલયમાં ઊછરતાં બધાં જ બાળકો એમની માતાની ઈચ્છાવિસુદ્ધ જન્યાં હોતાં નથી; કથામાં પણ કહેવાયું છે તેમ, પાલનપોષણનો પ્રબંધ ન થઈ શકવાને કારણે કે એ ભાર વહન ન કરી શકવાને કારણે પણ કોઈ વાર એ તજી દેવાયેલાં હોય છે. આ સંદર્ભમાં પણ આ કર્ણલોક નથી. આથી પુસ્તકના આરંભે કર્ણના રથના જમીનમાં ખૂંપેલા પૈડા દ્વારા લેખક શું સૂચવવા માગે છે તે સમજવું મુશ્કેલ છે.

કર્ણના સંદર્ભમાં કુલાભિમાનની વાત પણ આમાં આવે તો છે. સાત પેઢીનાં નામ મોઢે રાખતો કથાનાયક છેવટે સૂર્યને અર્દ્ધ આપાને કહે છે :

પ્રાયઃ

જીવાણસુસ્પે. ૨૦૦૬

૭

હે સૂર્ય, તમે જગત્તિત્તા ગણવ છો. માટે હું તમને કહું છું કે હું વંશ, જ્ઞાતિ, સમાજ કે પેઢીના ગર્વરહિત મારી માતાનો જ પુત્ર રહેવાનું પસંદ કરું છું. (પૃ. ૨૭૪)

વંશની વાત કેટલી મિથ્યા છે એ અંગે તાર્કિક દલીલ કરતી દુર્ગા પણ કથાનાયકને પ્રશ્ન કરે છે :

મને એ કહે કે તારી પૂર્વજ હજર કે લાખ પેઢી સદાકાલ એક જ વંશમાં આગળ ચાલી છે એવું તું છાતી પર હાથ મૂકીને કહી શકતો ? (પૃ. ૨૨૬)

(આવો જ પ્રશ્ન ‘તુલસીક્યારો’માં જ્યેષ્ઠારમે સોમેશ્વરને કરેલો, યાદ છે ?) નિમુબહેન (ગોમતીની માબબીને) આવો પ્રશ્ન પણ કર્યો છે :

મેં તો કહું કે લગનની કે વંશની વાતો કરતા હોય એને મારી પાસે મોકલ. દુનિયા બની ત્યારે પહેલવેલી માનું લગન કરાવવા કયો બ્રાહ્મણ હજર હતો તે મને સમજાવે ! (પૃ. ૨૦૮)

આ પ્રશ્ન એ દોહરાવે પણ છે. કથાના અંતે નિશાળીયાઓની ગંમતનો પ્રસંગ પણ આવા સૂચન માટે જ ખાસ તો મૂક્યો છે. લેખકે કૃતિ ‘માનવજાતની પ્રથમ માતાનો’ અર્પણ કરી છે એ પણ અહીં નોંધવું જોઈએ.

બીજી બાજુ હોસ્પિટલમાં તજાયેલી નવજાત બાળકી(સૌમ્યા)ને પોતાનું દૂધ પાઈને ઉછેરનાર (એક પુત્રી હોવા છતાં) હુસનાની એને દત્તક લેવા માટેની તાલવેલી, મંદબુદ્ધ બાળકને અપનાવનાર અને પછી અપંગ મોહિંદરને પણ ઉછેરનાર મહેરાનું વાત્સલ્ય, ટ્રેનમાં વાતકીથકનાં સહપ્રવાસી માજાનું દસ્તિબિંદુ, આ બધી વસ્તુસામગ્રી પણ માતાની કરુણા અને સમર્પણભાવનો મહિમા કરે છે. એમ કરતી વખતે સ્ત્રીનું જનની હોવું જરૂરી નથી, માતૃત્વ એના બંધારણનો જ અંશ છે એમ લેખકને અભિપ્રેત હોવાનું જણાય છે પરંતુ પ્રશ્ન એ છે કે એથી આ કૃતિના કથાવસ્તુની કોઈ તાત્ત્વિક ભૂમિકા ઊભી થાય છે ખરી ?

પ્રશ્ન એ પણ છે કે સંતાન સાથેના સંબંધમાંથી પિતા એટલે કે પુરુષની ભૂમિકાનો આ રીતે છે ઉડાડી નાખી શકાશે ? જીવિજ્ઞાનને અવગણીને વંશીય લક્ષણોને નકારી શકાશે ? માનવજાતનો સાંસ્કૃતિક વિકાસ, મૂલ્યપ્રતિષ્ઠા, સામાજિક સ્વાસ્થ્ય સામે આ રીતે પ્રશ્નાર્થ

ખડો કરી શકાશે ? એમ કરવામાં ભાવાવેશ એટલો છે કે અનાથાલયમાં રહેતી દુર્ગાના મુખે લેખકે આવાં વેણ કથાવ્યાં છે :

મારી માઝે મને હુંકી નથી દીધી. એ કામ જરૂર મારા બાપનું કે એના કોઈ સગાનું. (પૃ. ૧૩૭)

આ દુર્ગાની પાત્રપરિકલ્પના પણ સ્ત્રીના માતૃસ્વરૂપનો મહિમા થાય એ પ્રકારની છે. અનાથાલયનાં બાળકો માટે જાતને જોગમાં મૂક્તાં પણ એ અચકાતી નથી; એ પ્રસંગોનું નિરૂપણ બહુધા અતિરંજિત થઈ જાય છે. નંદુ તો એને ‘જગજજનની’, ‘સ્વયંજાતા’, ‘પરમમોહિની’ કહ્યા જ કરે છે. એમ લાગે કે એમાં લેખકનો મત પણ ભગેલો છે.

અહીં એક બીજા મુદ્દાને લઈને પણ વિચારમાં પડી જવાય છે. ભડે બાળકો પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને પણ દુર્ગા ચોરી કરે, કબાટનું તાર્ણ તોડે, સંસ્થાને દાનયાં મળેલાં કપડાં સણગાવી મૂકે, ગૃહમાતાને સોટીથી ફટકારે, તેમની આશાઓનું ધરાર ઉલ્લંઘન કરે, ઉદ્ધત જવાબો આપે, બેઝીમ બોલેચાલે, અનું સમર્થન શી રીતે કરી શકાય ? લેખકનો દસ્તિકોણ – દુર્ગામાં આ બધાં કરતૂતોનું નિરૂપણ, એનો પ્રભાવ, નંદુના એને વિશેના પ્રતિભાવો, નિમુબહેન અને નેહાબહેનની એને પ્રાપ્ત સહાનુભૂતિ – લેખક એના પક્ષે હોય એવી છાપ ઊભી કરે છે. ગેરરીતિનો સામનો ગેરરીતિથી તો કરવાનો ન હોય. વળી વહીવટનાં નીતિ-નિયમો વિશે દુર્ગાની જાણકારી, કાનૂની સમજ, એની છટકબારીઓની અને વ્યૂહરચનાઓની સૂજ પણ એની બાર-તેર વરસની ઉમર અને અનુભવ જોતાં વધારે પડતાં લાગે છે. એવું જ એની વિચારસરણીની પરિપક્વતા, વાણીની પ્રશિષ્ઠતાની બાબતમાં કહેવાનું છે. કથામાં દુર્ગાનો ચરિત્રવિકાસ દર્શાવાયો હોત, એના આલેખનમાં તાત્ત્વ્ય જળવાયું હોત તો આ બધું નભી જાત.

અલબત્ત, આ પાત્રનું એનું પોતાનું આકર્ષણ છે. ગૃહમાતા નલિનીબહેનને મારવાના અને કપડાંની ચોરીના પ્રસંગે એની આત્મવિશ્વાસપૂર્ણ, પ્રતીતિનિષ્ઠ, નિર્ભિક કબૂલાત; દઢ વલણ અને સંયત વર્તન એવાં સ્થાનો છે, જ્યાં એનું ચરિત્રાલેખન પ્રભાવોત્પાદક બન્યું છે. કૃતિના આરંભે ટ્રેનમાં જોવા મળતી એના વ્યક્તિત્વની છબી ધ્યાન

ખેંચે છે. અનાથાલયમાં પહેલવહેલી વાર એ વાર્તાકથકની નજરે પડે છે એ દશ્યનું, વાર્તાકથકના ચિત્ર પર પડતી એની અસર સાથેનું, આલોખન જુઓ :

ઉધારના ગુલાબી રંગના ફોકમાં સજજ દુર્ગાને જોતાં જ હું અવાક બનીને જોઈ રહ્યો... આ પૃથ્વી પર જન્મીને મેં અનેક સૌંદર્યો જોયા છે. હું તેનાથી અભિભૂત પણ થયો છું તેની ના નહીં પાડું. પરોઢના ગુલાબી રંગોથી માંડીને ચાતના તારામદ્દ્યા આકાશની મોહિની, ફૂલોના રંગ, પક્ષીઓની ઉડાન, કે વછેરા-વાછરડાની આંખોનું આશર્ય. આ બધાં સૌંદર્યોથી ક્યારેક તો હિંમૂઢ પણ થયો છું. પરંતુ આ ! એક અનાથ-આશ્રમમાં ! આવી છોકરી ! શાંત, શીતળ, જુદી !... હું તેને જોઈ જ રહ્યો... મારા પર નજર પડતાં દુર્ગાને તેને ઉમરના પ્રમાણમાં સહેજ ટૂંકું પડતું ફોક નીચે તરફ ખેંચ્યું. (પૃ. ૨૩)

વાર્તાકથકના ચિત્રમાં લિલાપેલા આ સૌંદર્યની શક્તિ એતી છે કે પોતે જ્યાં આવ્યો છે એ જગા અનાથ-આશ્રમ છે એવી ખબર પડતાંવેંત અણગમાથી ત્યાંથી ચાલ્યા જવા માટે તત્ત્વર વાર્તાકથક રોકાઈ જાય છે એ અસ્વાભાવિક નથી લાગતું.

દુર્ગાનું ચરિત્રાલોખન સંવેદનાત્મક અને સંકેતાત્મક થયું છે એવાં સ્મરણીય સ્થાનોમાં પોતાની ઘૃણાજનક રીતે ત્યક્ત, અને પછી અસીકૃત સ્થિતિ, એનું દુઃખદ ભાન કરાવતાં અને બદનક્ષીભર્યા કટુવચનો, એ વાસ્તવિકતાનો મૌન નિર્મમ સ્વીકાર, એની અવ્યક્ત વ્યથા અત્યંત હદ્યસ્પર્શી છે. એ નિરૂપણ એમ ને એમ રહ્યું હોત, નંદુના મુખે એનું ભાષ્ય થયા કર્યું ન હોત તો રસાસ્વાદમાં વિક્ષેપ ન પડત. દુર્ગાના પૂર્વવૃત્તાંત વિશેની કથકપાત્રની જિજ્ઞાસાને સંતોષાવાની તકને અનેકવાર નિઝળ કરીને, એને માટે યોગ્ય ક્ષાળ પસંદ કરીને લેખકે રસસ્થાન પારખવાની સૂજ દાખવી છે, એની નોંધ પણ લેવી જોઈએ.

આ નંદુ રસોયાની પાત્રપરિકલ્યના ફિલમ્સ્ટાર જેવી ન હોત અને એણે માત્ર પ્રસંગ અને પરિસ્થિતિના નિર્વાહ પૂરતું પ્રાપ્તકર્તવ્ય અદા કર્યું હોત તો ઉચિત થાત, જેવું નવિનીબહેનની બાબતમાં થયું છે. એ પાત્ર કંઈક ખલ બનવા જાય છે પરંતુ લેખકે એને દુર્ગાના દાખમાં રાખ્યું છે. આ નવિનીબહેનના ચરિત્રની થોડી બિન્ન રેખાઓ પણ

દેખાઈ આવે છે – નજર સામે ભડથું થઈ ગયેલાં માબાપ અને ભાઈના મોતથી સતત ભયગ્રસ્ત રહેતી રેખાની એ ખાસ કાળજી લે છે, બીજાં બાળકો – ક્યારેક દુર્ગા સુધ્યાં – માટે એમનું વલણ હમદર્દીભર્યું હોવાનાં. દણ્ણાં છે. એમના અજુગતા વ્યવહાર માટે એમની પરિસ્થિતિ જવાબદાર હોવાનું ખુદ દુર્ગાને કદ્યું છે. માધ્યો અને લક્ષ્મીને લેખકે પોતાની અપેક્ષાનુસાર ચીતર્યા છે.

કથમાં દુર્ગાની ભૂમિકા મોતી છે પરંતુ કથા છે કથકની, એ કથા કહે છે એ કારણે જ નહિ, વાર્તામાં એના આંતરૂભાવ વિકાસનો આલોખ અભિપ્રેત છે એ કારણે પણ. દરેક પ્રસંગ એનો અનુભવ બનીને એનામાં કંઈ ને કંઈ ઉમેરતો રહે છે. એના ગૃહભૂત્યાગની ઘટના; પોતે ઘરેથી ભાગ્યો નથી, પોતે સકારણ ઘર છોડ્યું છે અથવા પોતાને ઘર હતું જ નહિ એ હકીકતની સ્થાપના માટેની એની મથામજ અને એમાંથી જન્મતી દેફના; જેમનું ઘર એણે છોડ્યું છે એ મામા-મામી પ્રત્યેની ન્યાયોચિત દસ્તિ; સ્વમાનની આળી લાગણી; દુર્ગા, શોકાલી, રાહુલ, કરમી માટેનો એનો મનોભાવ, આ બધું એની સંવેદનશીલતા અને એની સમજણ, બંનેને વ્યક્ત કરે છે. એનું નિરૂપણ પણ પ્રભાવક રીતે થયું છે. પોતે અનાથ-આશ્રમમાં છે એનું ભાન થતાંવેંત એના મનમાં જાગતી તીવ્ર પ્રતિક્ષિયા, એ પછી પણ એનાથી અળગા રહેવાના પ્રયત્નો, મુંબઈની ટિકિટ લઈને અધવર્યે ઊતરી જવાનો નિર્ણય, અજાણી જગાએ ટ્રેન ઊભી રહેતાં એમાંથી છાનામાના ઊતરી જવાનો બીજો પ્રસંગ, એની આ તમામ ગતિવિધિ એના ચરિત્રને પ્રગટ થવા દે છે. એનું નામ અધ્રગટ રાખવામાં લેખક છેક સુધી સફળ રહ્યા છે. કુળ-ગોત્ર કે જ્ઞાતિનું સૂચન કરે એવું નામ કે અટક પણ શા માટે ? એક અનામ વ્યક્તિત્વરૂપે એની જે ઓળખ મળવાની હોય તે મળે.

પણ જે ક્ષતિ દુર્ગાના પાત્રનિરૂપણમાં છે તે આ પાત્રના નિરૂપણમાં પણ છે. બનેની ઉમર સરખી – બારતેર વરસની છે, આ ઉમર અને એમના ઉછેરની સાથે એમની વૈચારિક પરિપક્વતા અને પ્રશિષ્ટ વાણીનો મેળ બેસતો નથી. ઘણી વાર તો એ કેવી કેવી અર્થગત સૂક્ષ્મિત્રો પણ કહે છે ! કાનૂની આંટીઘૂંઠીઓ પણ એ જાણે છે ! એની ભૌતિક પ્રગતિ પણ માન્યામાં ન આવે એટલી

બધી અને ઝડપી છે. કથારંભે ટ્રેનમાં દુર્ગા, નિમુબહેન, જીભાઈ, નંદુ સાથેનો એનો મેળાપ તાલમેલિયો લાગતો નથી એટલો અંતે મોહિંદર-કરમી સાથેનો મેળાપ, નિમુબહેનની જમીન પર પ્રવૃત્તિનું આયોજન લાગે છે. એવી જ આકસ્મિકતા મહેશભાઈના વલણના બદલાવમાં; નિમુબહેન, ગોમતી, દુર્ગા વગેરેના મૃત્યુની ઘટનામાં, નહાબહેનના વિદેશગમન અને મોહિંદર-કરમીના લગ્નની ઘટનામાં છે. બહુસંખ્ય પાત્રસૃષ્ટિ ઊભી કર્યા પછી એના નિર્વાહ અને વિરામનો પ્રશ્ન પણ નવલકથાકાર સામે આવીને ઊભો રહેતો હોય છે.

એવું જ કથાવટકોની પ્રસ્તુતિનું પણ છે. રોજમાના પૂર્વજીવનવૃત્તાંતનો સંબંધ મુખ્ય કથાનક સાથે આયાસ વિના ભાંયે જ જોડી શકાશે. એવું જ કોમી રમખાણ અને મુન્નાને લગતા ડિસ્સાનું પણ છે. દુર્ગાને પાલિતાણા મોકલવાનો પ્રસંગ પણ કેવો લટકતો રહી જાય છે ! માત્ર નિમુબહેન પાસેથી એકવાર જાણવા મળ્યું કે એ અઢાર વરસની ન થાય ત્યાં સુધી એને પાલિતાણા ન મોકલી શકાય. તપાસ-અધિકારીઓ પણ આ નિયમથી વાકેફ નહિ હોય ! એની કશી ચર્ચા કે ઉલ્લેખ પણ નહિ, વિકલ્પનો વિચાર પણ નહિ ! પાંચેક વરસ રાહ જોઈને, અઢાર વરસની થતાં, તરત મોકલી દેવાય છે તે પણ ભારે

ગેરશિસ્તની શિક્ષારૂપે નહિ, વયસ્ક થવાને કારણે નિયમાનુસાર.

અનાથાશ્રમનો પરિસર, મધી, એની પાસે નિમુબહેનની વાડી, નજીકમાં શહેર, એવી કંઈક આ કથાસ્થળની ભૂગોળ છે. પાત્રોના સાઈકલપ્રવાસ રૂપે એનું ચલાયિત્તામંક આખ્લાદક વર્ણન મળે છે પરંતુ સ્થળ-સ્થળ વરચેના અંતરની ચોકસાઈ જળવાવી જરૂરી હતી. એવો જ પ્રશ્ન વ્યતીત થતા સમય, અને સમયગાળાનો છે. એમ લાગે છે કે લેખક જ્યાં કથા પૂરી કરી છે ત્યાંથી શરૂ કરી હોત તો સ્ફૂર્તિમાં વહી આવવાથી સમયના પરિમાળને લગતા પ્રશ્નો ઉકેલી શકાય હોત, પરંતુ આ કથાના વસ્તુની જરૂરિયાત કદાચ આત્મકથનાત્મક એટલે કે પ્રથમ પુરુષ નહિ પરંતુ સર્વજ્ઞ કથકની એટલે કે ત્રીજો પુરુષપ્રયોગની નિરૂપણરીતિ છે. એમ થયું હોત તો સામાન્ય રીતે આપણને જેનો જો પરિચય નથી એવા જગતના મર્મવૈધક કંઈક વાસ્તવનું આવું મહદેશી ભાવનારંગી નહિ પરંતુ સીધુંસૌસંસું દર્શન થાત.

દ્રુત ભાવે આ પૂર્વે આપેલી ત્રણ કથાત્મક કૃતિઓ પછી પહેલી વાર આ કૃતિને નવલકથા સંશોભિધાન કરવામાં આવ્યું છે ત્યારે સ્વરૂપ સાથે સંકળાયેલા આ અને આવા બધા પ્રશ્નો વિચારવાના આવે છે.

### પ્રવેશદ્વાર - દીવાન ઠાકોર

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૬. રી. ૧૪૦, રી. ૮૦.

### એક સફળ વાર્તાપ્રવેશ

### પ્રકુલ્પ દેસાઈ

પાઠ્ય

૨૦૦૨.૨૩.૦૩  
જુલાઈ, ૦

લેખક વાર્તાવેખનની નૂતન સાહિત્યવિભાવનાઓથી સારા એવા પરિચિત છે, એની પ્રતીતિ તો થાય જ છે પણ તેઓ એમની વાર્તાઓ દ્વારા જીવનલક્ષી વિચારો – ચિંતનોને અને સામાજિક સંદર્ભને પણ ઉજાગર કરે છે. આમ કરવામાં લેખક ક્યારેક પરંપરાગત તો ક્યારેક સુંજો. જ્યાત 'આધુનિક' ગણ્ણાતી વિભાવનાઓની મદદ પણ લેતા હોય તેવું જગ્ણાય છે, તો ક્યારેક એ સૌને અતિકમીને અનુઆધુનિકતા તરફ પણ વળી જતા જગ્ણાય છે. આને

પરિણામે ક્યારેક તેઓ વાર્તાવેખનમાં સફળ તો ક્યારેક અર્ધસફળ પણ થાય છે.

તેમની વીસ વાર્તાઓમાંથી ઘણીખરી વાર્તાઓ ઉત્તમ વાર્તારસવાળી અને સફળ ટેકનિકવાળી છે.

એમની વાર્તાઓમાં મોટેભાગે નાગરી પરિવેશ છે તો થોડી – પાંચેક વાર્તાઓમાં ગ્રામ પરિવેશ પણ છે. વાર્તાઓમાં ક્યાંક વસ્તુ-વિચાર કે ઘટનાનું તિરોધાન છે, ક્યાંક નિર્હેતુક શબ્દલીલા પણ છે, ક્યાંક સૂક્ષ્મતર સંયોજન

અને દુષ્કર રચનારીતિનું વધુ પડતું વળગણ પણ દેખાય છે, ક્યાંક પ્રતીક - સંકેતાલંકારાઈનો સુંદર વિનિયોગ પણ દેખાય છે, ક્યાંક ઉકેલ વિનાની સમસ્યાઓના સંદર્ભ પણ આવ્યા છે, ક્યાંક સૂક્ષ્મ અને ઊંડા મનશ્વલનો પણ છે. ક્યાંક શૈલી કાચ્યાત્મક, નાટકીય કે ચિત્રાત્મક પણ છે તો ક્યાંક ફિસ્સી, સપાટ બાની પણ લાગે છે, ક્યાંક ફેન્ટસી છે, ક્યાંક કેરિકેચર જેવાં પાત્રો છે. આ બધાંની સાથે પ્રયોગશીલતાની મથામણ પણ છે. લેખક પોતે કહે છે તેમ 'એમની વાર્તા એટલે વેદના અને પ્રેમના બે કાંઈઓ વચ્ચે વહેતી નદી.' એમની વાર્તાઓમાં પ્રમુખપણે બે રસો છે : કરુણ અને અદ્ભુત.

લેખક ઉત્તર ગુજરાતના ગ્રામપદેશની બાળપણ અને કિશોરાવસ્થામાં પેઢેલી અનેક ધાપોને જાળવી શક્યા છે, એટલું જ નહીં તેમને યથાવતું કોઈ પણ પ્રકારના રંગદર્શન વિના વાર્તા દ્વારા કાગળ પર ઉતારી શક્યા છે.

ગ્રામપરિવેશની જે પાંચ વાર્તાઓ અહીં સંગ્રહાઈ છે, એમાં 'કનૈયો' અને 'બાયડી' ખાસ ધ્યાન જેંચે છે.

'કનૈયો' બે રીતે ધ્યાન જેંચે છે. એક, વીસ વર્ષથી ખોવાયેલા પુત્રના એકાદ પત્ર માટે તરફડતા કેશવલાલની મૂક વેદનાથી તો બીજી બાજુ, એમાંના સુંદર, શાંત અને અસ્થાલિત વહેતી જિંદગી જેવા વાતાવરણથી. કેશવલાલ આપણને 'ધૂમકેતુ'ની 'પોસ્ટઓફિસ' વાર્તાના કોચમેન અલી ડોસાની પણ યાદ આપે છે તો બીજી બાજુ ર. વિ. પાઠકની વાર્તા 'મુકુદરાય'માં વર્ણવાયેલા પરિવેશ સાથે સાખ્ય ધરાવતા લાગે છે. 'પોસ્ટઓફિસ'ની જેમ અહીં પણ ખોવાયેલી વ્યક્તિનો - વ્યક્તિ વિશેનો પત્ર આવે છે. ખોવાયેલી વ્યક્તિ હવે સદાને માટે ખોવાઈ ગઈ છે. લેખક કેશવલાલની એ વેદનાને બહુ ઘૂંઠવા દેવા માગતા નથી. ખબર પડે છે કે પાડોશીને ત્યાં મોટી ઉમરે જન્મેલા પુત્રના ગાલે મૃત કનૈયાના ગાલે હતું તેવું જ લાખું છે ! કેશવલાલને નહું જીવન મળે છે. અહીં લેખકનો 'આશાવાદ' જીતે છે. 'કનૈયો' સાથે છેલ્લી વાર્તા 'ખુશખબર' પણ સાખ્ય ધરાવે છે. અહીં પણ જુવાન પુત્રને ખોઈ બેઠેલા બચુકાકાને મૃત મનુ સામે મળે છે અને સમજાવે છે કે 'દુઃખ જેવું કાંઈ નથી, બધી મનની આડાઈ છે.' પછી બચુકાકા સંગાંસંબંધીઓના દુઃખોની યાદી

બનાવવા બેસે છે પણ તેમને પ્રશ્ન થાય છે કે 'મારા દુઃખની માત્રા ઘટાડવા બીજાંનાં 'દુઃખો જોવાનાં ?' એમને ખાતરી થાય છે કે ખરેખર તેઓ દુઃખી નથી. આ સમજણ એમને માટે ખુશખબર જેવી જ છે !

ઉત્તર ગુજરાતની બોલીથી સમૃદ્ધ અને સરસ ગ્રામચિત્રો ધરાવતી 'બાયડી' વાર્તા નાયિકા ચંપાના પાત્રાલેખનથી ખાસ ધ્યાન જેંચે છે. નાનામોટા જઘડાથી રિસામજો ગયેલી પત્ની ચંપા પતિની બીમારી વિશે જાહી હોસ્પિટલમાં આવી પતિની શુશ્રાષામાં લાગી જાય છે. એમ એમ છે કે 'જમરાજા આવશે તો ય હું ઈમને પાછ વાળીશ.' મૃત્યુના ભયે પીડાતો પતિ અકળામણમાં બોલી ઉઠે છે, 'તું તો સત્તી સાવિત્રી ખરી નથી ?' ત્યારે 'ભલે હું સત્તી સાવિત્રી નથી પણ તમારી બાયડી સું' એમ ગર્વપૂર્વક કહેતી ચંપા આપણને સાવિત્રીથી કમ લાગતી નથી. ચંપાને છેવટે લાગે છે કે 'બાયડામાંથી કોઈ આઈના પાછું વળી જયુંતું.' અહીં સાસુ સાથે જઘડતી, પતિ સામે જવાબ આપતી છતાં ઘરકામ કે ખેતરનાં કામોમાં 'હાથ બટાવતી' અને પતિની બીમારી જાણતાં જ રીસને વિસારી દોડતી અને પતિને સંભાળતી ગર્વિલી નારીનું ચિત્ર તાદશ થાય છે.

'મહાકાલી' વારંવાર બદલાતા કથનકેન્દ્રની પ્રયોગશીલતાથી ધ્યાન જેંચે છે, જોકે સરવાળે એ વાર્તાને ઉપકારક બનતી દેખાતી નથી. પહેલાં દાસભાઈ નામના કથક 'પૈસાનું ઝડ' વાવવા મથતા કિશોર 'બાબુ'ની વાત કરે છે. વચ્ચે લેખક જ કથક બની બતાવવા પ્રયત્ન કરે છે કે બાબુ કેવી રીતે ટૂંકે રસ્તે પૈસા મેળવે છે. છેલ્લે બાબુ પોતે જ કથક બની જાય છે અને પોતાની નિઝળતાની વાત કરે છે. બદલાતાં કથનકેન્દ્રથી વાર્તાને શોષ્ણું પડે છે. અહીં વાર્તાનું શીર્ષક પણ સાર્થક થતું અનુભવાતું નથી.

'પેઢી' વાર્તામાં ધંધાદારી, બંધા વેપારી એવા હીરાલાલનું પાત્ર બહુ 'જીવંત' રીતે ઉપસે છે. માણસની જરૂરિયાતોનો ગેરલાભ લેવા ટેવાયેલો આ માણસ કોઈને છોડતો નથી. મનુભાઈ સાહેબ, રૂખી ભરવાડણ, વજેસંગ બાપુ કે નારણ પટાવાળો - બધાં જ એનાં શિકાર છે. છેવટે જ્યાં એને આશ્રય મળ્યો છે, એ વૃદ્ધાશ્રમને પણ તે પોતાની 'પેઢી' બનાવવાનું ચૂક્યો નથી.

‘કથાકરની કથા’ ભવાતવિમાં ખોવાયેલી માનો અણસાર પામવા માંગતા પુત્રની વેદના ઉજાગર કરતી હોવા છતાં અસ્પષ્ટ અંતને કારણે જાણે વાસ્તવિકતાના રણમાં ખોવાઈ જતી સરસ્વતી જેવી લાગે છે. અંત વિનાની કે અસ્પષ્ટ અંતવાળી વાર્તા ક્યાંય પહોંચતી નથી.

વાર્તામાં આદિ, મધ્ય અને સમસ્યા સાથે તેનો ઉકેલ હોવાં જરૂરી નથી છતાં ક્યાંક ટાર્કિક અંત પણ આવતો ન હોય, ત્યાં શું ? એવી જ રીતે થોડું ગોપિત ભાવકને ઉત્સેજિત કરે પણ અધૂરુપ કે અસ્પષ્ટતા ભાવકની રસાનુભૂતિને બાધક ન બને ?

નાગરી પરિવેશની વાર્તાઓમાં ‘અમદાવાદના દરિયા કાંઠે’, ‘ભૂખ’, ‘પ્રવેશદ્વાર’, ‘વિઝન’ અને ‘આવરણ’ સફળ વાર્તાઓ છે.

‘અમદાવાદના દરિયાકાંઠે’નું શીર્ષક ચોંકી જવાય એટલી હું સૂચક છે. વાર્તાના ઉઘાડ સાથે લાગે છે કે લેખક આપણને પરીક્થાના દેશમાં લઈ જવાના છે. સુચારુ કલ્યન અને વાસ્તવિકતાના સહ-સંબંધમાંથી વાર્તારસ વધતો જાય છે. ધીમે ધીમે એમાંથી કારૂષ્ય ઊભરવા માટે છે અને આપણને સમજાય છે કે સર્જકે પોતાની કોઈ છાની વથાને અહીં સંકાંત કરી છે. એ વેદના લ્યૂસીના રહસ્યોદઘાટક વાક્ય દ્વારા પૂરેપૂરી સમજાય છે, ત્યારે થાય છે કે આ તો મૂળમાંથી ઊખડી ગયાની વથા છે, જે અમદાવાદના દરિયાકાંઠના ઝાંઝવાં જેવી જ પુરવાર થવાની છે. જે વતનને પોતે છોડી ગયો છે, એ હવે ભૂતકાળના જડબામાં વિલીન થઈ ગયું છે – એ પાછું અનુભવવા મળવાનું નથી. નાયકે આગોત્રા ભવિષ્યદર્શન કરી લીધું છે. જે આટલાંટિક ડિનારે પોતે રહ્યો છે, તે છોડી જ્યાં દરિયો તો શું, વહેતી નદી પણ નથી, તેવા અમદાવાદમાં જવાનું છે, એ નાયકથી જરવાતું નથી અને એ આભાસી દુનિયામાં જીવા મથે છે. લ્યૂસી અને એમાંથી બહાર લાવે છે કે કેમ, એ સવાલ અનુત્તર જ રહી જાય છે. લેખકે લ્યૂસીના એ વાક્ય સાથે જ વાતાને પૂરી કરી હોત તો ? એ પણીનો આખો પ્રસ્તાર ભાવકને ગૂચવે, એ તદ્દન શક્ય છે. વાર્તાની શૈલીમાં લય છે. આ વાર્તા મોટેથી પઠન કરતાં વધારે પ્રભાવી લાગી શકે. એમાં આવર્તનો અને હીંચ સાથે શબ્દોના રણકા અને ટહુકા છે,

જે આંખ સાથે કાનને પણ મધુર લાગે છે. વર્ણનો શુતિસંવેદ્ય હોવા સાથે રૂપસંવેદ્ય અને રસસંવેદ્ય પણ છે.

જુઓ : પાન ૩૦ ‘ઉનીઊની ખારીખારી હવા...’, ‘ઘઉવર્ણી ચામડી પર લીલી લીલી આંગળીઓ...’, ‘ટહુકા કરતાં ઘડિયાળો’, ‘ઈ...ડા તાજા રસ જેવું’, ‘ફરફરતા કેશ જેવી સવાર’, ‘ઓનેરી ઝાંયવાળાં ગુલાબી મોજાં’ વગેરે. ‘ભૂખ’ અને ‘વિઝન’ માણસમાત્રમાં પ્રબળપણે રહેલા જીની તત્ત્વની વાત તદ્દન સ્વાભાવિકતાથી છતાં ઊંડાણથી કરે છે. ‘ભૂખ’માં પુસ્તકો પ્રતીક છે તો ‘વિઝન’માં સ્કૂટર.

જીવલેણ વ્યાવિથી પીડાતા શાખાગ્રસ્ત પતિને સંભાગતી અને લાઈબ્રેરીમાં નોકરી કરતી નિઃસંતાન પત્નીની વાકુળતા માટે પુસ્તકો જ બાળક જેવો સધિયારો છે છતાં ‘ભૂખ’ પીડતી રહે છે. પુરુષમિત્ર હોવા છતાં પુસ્તકનો સ્પર્શ જ એનું વ્યસન બની ગયું છે. પતિના મૃત્યુ પછી પણ એમાં ફેર પડતો નથી. પુરુષમિત્રને માટે એ વાત અગમ્ય છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેની માનસિકતાનો તીવ્ર વિરોધ અહીં સરસ રીતે આવેખાયો છે, તો ‘વિઝન’માં સ્ત્રોજ પ્રકૃતિના પુરુષનું સ્કૂટર વારંવાર ‘અટકી’ પડે છે. એને પણ ગેરેજના મિકેનિકનું વ્યસન છે. કિશોરાવસ્થાથી છોકરીઓથી દૂર ભાગતા અમિત સાથે પહેલી પત્ની અમિતાને ‘ફાવતું’ નથી. અમિતા માને છે કે ‘છોડ સુકાઈ જાય ત્યારે તેને કાપીને ફેંકી ઢેવો જોઈએ’ અને ‘બાગ તો સુંદર જ રહેવો જોઈએ.’ બન્ને સમજૂતીથી છૂટાં પડે છે. મનીષા સાથે લગ્ન કરવા છતાં અમિતા ભુલાતી નથી જોકે મનીષાને એની સાથે કોઈ ‘સમસ્યા’ નથી. જીનસનું પેન્ટ અને શર્ટ પહેરતી અને છોકરા જેવા વાળ રાખતી એની બહેનપણી શેતા સાથે મનીષાને ફાંબે છે. સંબંધો ટકી રહ્યા છે અને કદાચ હંમેશા માટે ટકી રહેશે પણ વિઝન સ્કૂટરથી છુટકારો પણ શક્ય નથી.

‘પ્રવેશદ્વાર’માં લગ્નનાં વર્ષો બાદ માનસીને પતિના જીવનમાં રહેલી બીજી સ્ત્રીની જાણ થાય છે. આધાતથી બીમાર એને કોઈ ઉકેલ મળતો નથી. તેને નાનપણાની વાત યાદ આવે છે : ‘વરસાદ આવે તે પહેલાં નળિયાવાળું છાપું સંચાવવું પડે.’ માનસી પોતાના ઘરનું છાપું ફરી સંચાવે છે – પતિ સાથેના બધા સંબંધોને નકારીને સંચાવેલા નવા

ઘરનું પ્રવેશદ્વાર તેને સોહામણું લાગે છે. આપણાને ખબર પડતી નથી કે એ એનું આચ્છાસનમાત્ર છે કે કેમ? વળી એના પતિનો પક્ષ પણ જાણવા મળતો નથી. તેથી થયેલી ‘સજા’ યોગ્ય છે કે કેમ, તેની પણ આપણાને ખબર પડતી નથી.

‘આવરણ’માં મનમાં એક ખટકો રાખીને જીવતા પતિની વાત છે, જેને પત્ની ભારતીના જૂના કોંક્રેજમિન હિંમતલાલ માટે શંકા છે. ધીમે ધીમે એ પડદો હતો જાય છે અને નાયકને એમની વચ્ચેના સંબંધની સ્પષ્ટતા થાય છે છતાં પત્નીની માર્ગી નિખાલસત્તાથી મંગતી નથી. આ એક એવા આવરણની વાત છે, જે મનમાંથી ક્યારેય હતવાનું નથી.

આ ઉપરાંત ‘જૂ’, ‘જહાજ’, ‘ધોડો’, ‘બહુરૂપી’, ‘અંધકાર’ વગેરે જુદાં જુદાં પ્રતીકને લઈને આવતી આધુનિક વાર્તાઓ છે. એમાં ક્યાંક ઘટનાની અલ્પતા કે ઘટનાલોપ છે, ક્યાંક શબ્દાળુતા છે, ક્યાંક અસ્પષ્ટતા છે. ‘જૂ’માં છેલ્લે ખાલી પાંજરું શાનું પ્રતીક છે, એ મને સમજાયું નથી. વાર્તામાં ક્યાંય એવું હંગિત આવતું નથી તો ‘જહાજ’માં એટલી હુદે ઘટનાલોપ છે કે જાણે એનો ભાર

લાગે છે. ‘ધોડો’માં મનોરૂગણતાની વાત મનોવૈજ્ઞાનિક રીતે કહેવા પ્રયત્ન થયો છે પણ તે અસરકારક નથી. ‘બહુરૂપી’ મનની માયાજાળ બધે વિસ્તરતી લાગે છે.

વાર્તાઓમાં વસ્તુવિષયની વિવિધતા છે. સંયોજનમાં નવીનતા અને તાજગી સાથે અલગપણું વર્તાય છે. પાત્રાલેખન પણ ક્યાંક ઊરીને અંઝે વળ્ગે તેવાં થયાં છે. વાર્તાના આવરણમાં અનોખાપણું છે. ભાષાકર્મ ક્યાંક સબજન અને અસરકારક છે તો ક્યાંક શબ્દાળુતા પણ પ્રેશે ગઈ લાગે છે, ક્યાંક કાચ્યતવને પણ પામે છે અને વાંચતાં, પઠન કરતાં સરળ, પ્રવાહી અને મધુર પણ લાગે છે. વાર્તામાંના વિષયવસ્તુ, શબ્દકર્મ અને સંયોજન – તરે મહત્વનાં ઘટકોમાં નવીનતા, મૌલિકતા લાવી સાચવી લેવાના પ્રયાસો પણ થયા છે પણ દરેક વખતે એક સરખી સફળતા મળી નથી.

સફળ અને સુંદર નવલિકાઓ અહીં ઘણી છે અને વાર્તારસ સારો જગાવાઈ રહે છે. લેખક પાસે શક્તિ છે. વાર્તાત્ત્વને પામતા રહેવાની અભ્યાસવૃત્તિ છે તેથી ભવિષ્યમાં તેઓ કેટલીક ઊંઘપોને અતિક્રમી જશો, એવી શક્તા બેસે છે.

## ફટફટિયું - સુમન શાહ

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, ૨૦૦૬, ફેબ્રુઆરી, ૧૦૦

## ગુજરાતી વાર્તાનો આગામો ચહેરો

મોહન પરમાર

સુમન શાહનો આ ત્રીજો વાર્તાસંગ્રહ છે. એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘અવરણુંક્લુબ’ ૧૯૭૬માં પ્રગટ થયેલો. તે વખતે આધુનિક વાર્તા એના પૂરા રૂપરંગમાં ખીલેલી હતી. ને આમેય સુમન શાહ સુરેશ જોખીની વાર્તાવિચારણામાં પહેલેથી આકર્ષયેલા, એટલે ‘અવરણુંક્લુબ’માં આધુનિક વાર્તાનાં તમામ લક્ષણો દેખા દે છે. ૧૯૮૦ પછી આપણે ત્યાં અનુઆધુનિક વાર્તાનાં મંડાણ થયાં. આધુનિક વાર્તા કરતાં આ વાર્તા વાસ્તવના વિવિધ આયામોને તાગી જોવાની દર્શિને કારણે વધુ ને વધુ જીવનલક્ષી બની. આ ગાળામાં સુમન શાહનું વાર્તાખેડાણ ચાલુ રહ્યું. ૧૯૯૨માં

તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘જેન્ટી-હંસા-સિમ્ફની’ પ્રગટ થયો. આ વાર્તાઓમાં સુમન શાહ આધુનિક વાર્તાથી પાસાફેર થતા ભળાય છે. એ અનુઆધુનિક વાર્તાની વધુ ને વધુ નજીક આવતા જણાય છે. ‘જેન્ટી-હંસા-સિમ્ફની’ પછી લખાયેલી તેમની વાર્તાઓએ ગુજરાતી સાહિત્યમાં જુદી ઓળખ ઊભી કરી છે તેમ નિઃસંકોચ કહી શકાય. એમની આ વાર્તાઓ અનુઆધુનિક વાર્તાને વધુ ને વધુ સમર્થન આપતી જણાય છે. અનુઆધુનિક વાર્તાના મહત્વના વાર્તાકારોમાં સુમન શાહનું નામ મૂકી શકાય. કેમ કે મહત્વના અન્ય વાર્તાકારોની જેમ ગુજરાતી

સાહિત્યના વિજ્ઞાને આગવી રીતે વાર્તામાં કંડારવામાં એ પૂરેપૂરા સક્ષમ છે.

‘ફટફટિયુ’ વાર્તાસંગ્રહમાં ૧૪ વાર્તાઓ અને ૫ બોધકથાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંગ્રહના અનુવચનમાં પોતાની વાર્તાઓ મિશે એમણે ૨૪૭ કરેલી વાતાવિચારણાના થોડા મુક્કા જોઈ લેવા જેવા છે : (૧) દેખાવે બધી સરખી લાગે છે છતાં દરેકનું એનું પોતાનું સંયોજન હોય છે. (૨) મને ઘટનાઓ મળતી નથી કે હું તેમને ઓળખાય નથી જતો (૩) પરકાયપ્રવેશ બનાવટ છે અને સ્વમાં પ્રવેશય વિનાનો કોઈપણ પ્રવેશ, નરી બનાવટ છે. કલાએ બનાવટથી બચીને એવી તો બનાવટ પ્રગટાવવાની છે જ્યાં જીવન અને કલા બંને એકમેકમાં ઓગળીને એક થઈ ગયાં હોય, સ્વ અને પર એક થઈ ગયાં હોય (૪) બાધ્ય ઘટનાની વાર્તા, ઘટના પત્યે, પત્યી જતી હોય છે. અહીં એવું શક્ય નથી હોતું – કેમ કે હું સંયોજનનિયમોને તેમ જ રૂપશરતોને વશ રહેતો હોઉં રેથી, મારે સંયોજન માગે એટલી જગ્યા હંમેશાં આપવી પડતી હોય છે. (૫) મને વિકસાવેલા ટૂચ્કા જેવી, રૂચિર પ્રસંગ જેવી, સર્જક નિંબંધ જેવી કે સામાજિક પ્રશ્નનિવારણના પ્રેરણ જેવી વાર્તા-નામી વસ્તુઓ સર્જવામાં રસ નથી. (૬) મારા ૪૫ વર્ષના અનુભવ પછી, મને લાગે છે, મારામાંના વાર્તાકારને બે વસ્તુઓએ ખાસ છેતર્યો છે : એક તો પ્રેમ અને બીજી વસ્તુ તે ભાષા. પ્રેમ આપણને જિવાડે છે, ભાષા વ્યક્ત કરે છે. (૭) વકોક્ષિત અને સ્વભાવોક્ષિત બેયના ગુણવિશેષો છે પણ એમના મર્યાદાવિશેષોય છે. બંનેને ઓળખ્યા કરવાની મજા આવે છે. અનુવચનમાં સુમન શાહે પોતાની વાર્તાકળા નિમિત્તે કરેલાં વિધાનોની, એમની આ વાર્તાઓ જોતાં આપણને તરત પ્રતીત થાય છે. એમની વાર્તાઓની બે વિશેષતાઓ છે. એક, તેઓ વાર્તાને વધુ ને વધુ સંઘન બનાવવા માટે વાતને દીર્ଘસૂત્રી બનાવે છે. બે, તેઓ વાર્તાનાં પાત્રો અને પરિવેશ પાસેથી ભાષા દ્વારા વાર્તાના અર્થને વ્યંજિત કરવા માટે જેટલો કસ કઢાય તેટલો કાઢે છે. આ બધી રચનાઓ પ્રેમવિષયક છે તેવું કહી શકાશે નહિ, કેમ કે સમગ્ર રચનાત્મકમાં અનુસ્યૂત સંવેદન જુદું જ વિશ્વ રચી આપે છે. અહીં મુખ્ય ઘટનાની સાથે અનેક વાર સ્ત્રી-પુરુષના

અવૈધ સંબંધોની વાત આવે જાય છે. આ પ્રકારની આડવાતોનો વિનિયોગ મુખ્ય ઘટનાના સહવર્તી અધ્યાસ તરીકે થયો હોઈ ખાસ કરતો નથી. ‘લેમન ટી અને બિસ્કુટ’, ‘હશે, જે હશે તે-’ ‘લેટ્સ મિક્સઅપ’, ‘ફટફટિયુ’ – આ પ્રકારની રચનાઓ છે. ‘લેમન ટી અને બિસ્કુટ’માં લખી અને મીઠી સાથેના જોખી જનાર્દન સાથેના સંબંધો, ‘લેટ્સ મિક્સઅપ’માં સીમા-શોભિત, સીમા-મનીષ અને સીમા-પ્રવીષા વચ્ચેના સંબંધો, તો ‘ફટફટિયુ’માં પ્રવીષા-શોભના વચ્ચેના સંબંધો – વાર્તામાં કશુક રહસ્યમય વિશ્વ ઉપસાવવામાં સહાયભૂત બને છે.

‘લેમન ટી અને બિસ્કુટ’માં વાર્તાનાયકના આંતરમનની ચોષાઓ સુક્ષમ સ્તરે અભિવ્યક્ત થઈ છે. વાર્તાનાયક જાણે બસમાં મુસાફરી કરી રહ્યો છે. તેની બાજુની સીટમાં બીજો પુરુષ બેઠો છે. વાર્તાનાયકના બાધ્ય અને આંતરમનના આટાપાટા બસની ગતિ સાથે સંધાન રચે છે. જે બીજો પુરુષ મંગેશભાઈ છે તે નાયકની જ પ્રતિકૃતિ છે. એટલે વાર્તામાં બન્ને વચ્ચે સંવાદો રચાય છે તે પોતાની જાત સાથેના છે. સમતાપુરની મીઠી અને અધમપુરની લખી સાથેના પ્રશયસંબંધોમાં સામ્ય છે. નાયકની પત્નીનું નામ રમા છે. લખી અને મીઠી સાથેના સંબંધો તેનો અતીત છે. અહીં સાંપ્રત અને અતીતનું સંયોજન લેખકે રચેલી કળપત્મક સૃષ્ટિમાં રહેલું છે. પ્રેમથી થાકીને હતાશ થયેલા કથાનાયકની હતપ્રભ ક્ષણો સુંદર રીતે શાબ્દસ્થ થઈ છે.

‘હશે, જે હશે તે-’ ભવિષ્યકથન દ્વારા ડરી ગયેલા કથાનાયક પી. જી.ની જીવનચર્ચાની વિગતો રસપ્રદ છે. જનાર્દન જોખી ભવિષ્ય ભાખે છે કે અમુક સમયે પી. જી.નું મોત થશે. મોતની ચિંતામાં ને ચિંતામાં પી. જી.ની બદલાતી રીતરસમ ધ્યાન ખેંચે છે. આ સમય દરમિયાન પત્ની સાથેના સંબંધોમાં ઊભો થતો વિક્ષેપ મહત્વનું અંગ છે. છેલ્લે જોખી ખોરો પડે છે. પત્ની અને જનાર્દન વચ્ચેના વ્યવહારોમાં પી. જી.નું શંકાશીલ માનસ કાંઈક જુદી ધારા પર ચાલે છે. મોતના ડરને કારણે પત્ની પ્રત્યેની વિમુખતા, મોતનો ડર ગયા પછી પણ યથાવત્તુ રહે છે. પી. જી. અંદરથી જાણે ખાલી થઈ ગયો છે. મોતનો ડર નથી રહ્યો છીતાં મરેલું મરેલું બોલતા પી. જી.ની સ્થિતિ હાલકડોલક

છે. એકબીજાને તાકી રહેલાં જગૃતિ અને જનાર્દન વચ્ચેના સંબંધોમાં હવે એ ખાસ ઊંડો ઉત્તરવા માગતો નથી. ‘હશે, જે હશે તે—’ જેવી સમધારણ સ્થિતિ રચાયા પછી પણ અંતર વેદનાગ્રસ્ત હોય તેવી સ્થિતિ વાર્તામાં નવું સંવેદન ઉમેરે છે. લેખકે અહીં ખપમાં લીધેલી ભાષાશૈલી વાર્તાના સૂક્ષ્મ સ્તરો પામવાને સ્પર્શક્ષભ બની છે.

‘ફટફટિયું’માં વાર્તાનાયક પ્રવીષે પોતાને ત્યાં પાર્ટી રાખી છે. બધાંની એ રહ જોઈ રહ્યો છે. ત્યાં એક અજાહ્યો માણસ પ્રવીષાભાઈનું ઘર પૂછતો આવે છે. પરંતુ વાર્તાનાયક પ્રવીષાને બદલે એને બીજા પ્રવીષાનું કામ છે. પ્રવીષા એને બ્લેક કલરની બાઈક ઉપર જતો જુએ છે. પ્રવીષા નીચે આવે છે. વોચમેન સાથે પૂછતાછ કરે છે. વોચમેન કહે છે કે હમણાં જ એક ભાઈને તમારે ત્યાં મૂકી આવ્યો. વોચમેન એનું ફટફટિયું બતાવે છે. એથ બ્લેક કલરનું હોય છે. ઘેર આવીને જુએ છે તો પત્ની રમાના કહેવા મુજબ હમણાં જ અહીં કોઈક આવ્યું છે. ટિપોય પર પાણીનો અર્ધો ગ્લાસ પડેલો. કોઈ જણાયું નહિ. રમા અને પ્રવીષા શોધખોળ કરી મેલે છે. તે દરમિયાન મહેશની વિગતો આવે છે. મહેશની પત્ની શોભા મહેશની સાથે લગ્ન થયાં તે પહેલાં પ્રવીષાથી પ્રેગનન્ટ હતી. શોભાની એ દીકરી તે મીતા. પાર્ટીમાં મહેશને ખાસ આમંત્રણ આપેલું છે. પાર્ટી રાખવાનું ખરું કારણ મીતાને ઊંચ્યકી લઈને ચૂમ્યું છે. પોતાની દીકરીને ફ્રિલ કરવી છે. પણ મહેશથી આવી શકતું નથી. કેમ કે એનું બાઈક ચોરાઈ ગયું છે. ફટફટિયાના રહસ્ય સાથે મહેશ-પ્રવીષા-શોભાના સંબંધોનું રહસ્ય કલાત્મકતાથી ગુંથાયું છે. પ્રવીષાની પત્ની રમાની વેયક્ટિક ચેતના સૂક્ષ્મસ્તરીય છે.

‘દુઃખાંડ ટ્રેન્ટી (૨૦૨૦) લગી’, ‘વર્ચ્યુઅલિ રીયલ સૂટકેસ’, ‘જામફણિયામાં છોકરી’ ઈ. ઈ. ડબલ્યુ યાને સંકટ સમયની બારી’ અને ‘ખંજર’માં રહેલાં સાંકેતિક રહસ્યો આ રચનાઓનું અલગ અસ્તિત્વ ટકાવી રાખવામાં કારણભૂત બને છે. જીવનના મર્મો અહીં વધુ ઘેરા બનીને ઊપરી આવ્યા છે. ‘વર્ચ્યુઅલિ રીયલ સૂટકેસ’ સિવાયની રચનાઓમાં પેલા જાતીય સંબંધોની અલપજલપ અંય વરતાય છે ખરી, પરંતુ સમગ્ર કૃતિમાં રસાયેલો અર્થસંદર્ભ જુદાં જ સમીકરણો રચી આપે છે.

‘દુઃખાંડ ટ્રેન્ટી (૨૦૨૦) લગી –’ વાર્તામાં ચંદહાસ દવે અને સિમતા વાણિયાના વાર્તાલાપમાં વાર્તાનાં બીજ પડેલાં છે. ચંદહાસ અને સિમતા આઠેક વર્ષથી સાથે રહે છે. મૈત્રીકરાર જેવું સંતાન ન થઈ જાય તેની કાળજી લીધી છે. ચંદહાસ દવે પહેલાં લલિતા પાઠકને પરણેલો. પણ લલિતા એને નાપસંદ કરીને ભાગી ગયેલી. ભાગી ગયા પછી એને એક પુત્રી રંજના જન્મે છે. ચંદહાસ એને પોતાની પુત્રી માનતો નથી. ચોપન વર્ષના ચંદહાસનો કમ્પ્યુટરમાં લાઈફલાઈનનો ટેસ્ટ રિપોર્ટ આવે છે, તે ૨૦૨૦ સુધી જીવવાનો છે. સિમતા ચંદહાસની સાથે રહેવા માંડી તે પહેલાં ત્રણેક જજાના પ્રેમમાં પડેલી. ચંદહાસ ફ્યુચરિસ્ટ છે. માનવજાતના ભાવિ અંગે બહુ વિચારે છે. પરાની ‘વિજ્ઞાન-આનંદ’ નામની નાનકડી મંડળી સમક્ષ ચંદહાસ ઘણી વાર ટોક આપતો હોય છે. આજેય જવાનું છે. રાતે રંજનાનો ફોન આવવાનો છે. સલીમ સાથે મેરેજથી એ જોડાવા ઠચ્છે છે. આ અંગેનો નિર્ણય ચંદહાસે કરવો તેવો તેનો આગ્રહ છે. ચંદહાસનું વ્યાખ્યાન મુલતવી રહે છે. બધું પતાવીને બન્ને ઘેર આવે છે. ઘેર ભૂલી ગયેલા મોબાઇલ પર રંજનાએ ત્રણેક વાર ફોન કરેલો. ચંદહાસ તે જુએ છે. સિમતા એને સમજાવે છે કે રંજના તમારાથી થયેલી દીકરી હશે કદાચ. ચંદહાસ માનતો નથી. એ સલીમ સાથે રંજનાના મેરેજ કરવા માટેનો નિર્ણય કરવાની ના પાડે છે. સિમતા સાથે રક્જક થાય છે. ધક્કો વાગતાં સિમતા નીચે પડી જાય છે. તે દરમિયાન કોઈનો ફોન આવે છે. ચંદહાસ ઉપાડતો નથી. મોબાઇલની ઘંટી રણકી ઊઠે છે. ક્યાંય સુધી રણક્યા જ કરે છે. અહીં સિમતાની માનસિકતા પ્રગટ કરવામાં લેખકનો કસબ વરતાઈ આવે છે. જે સિમતા રંજનાને દીકરી તરીકે સ્વીકારવાનું ચંદહાસને દબાશ કરતી હતી, એ જ સિમતા ચંદહાસ રંજનાનો ફોન નથી ઉપાડતો એથી ખુશ થાય છે. એને છેલ્લે થઈ આવે છે કે ક્યારે ‘ચન્દુ પોતાને સાહીને બાહુમાં લે... ને કદાચ ચૂમે... તે શરૂ કરે જે આજ રાતથી કદાચ શરૂ કરવાનો હોય...’ સિમતાની આ તીવ્રેચ્છા આગંતુક નથી. તે માટેનાં નિમિત્તો વાર્તાકારે વાર્તામાં પ્રયોજયાં છે. વાર્તામાં આવતી વિગતો અર્થહીન ન હોવાને કારણે વાર્તાનું લંબાણ જાંયું કર્યું નથી. બીજ રિતે એમ કહી શકાય કે વાર્તામાં

ભાષાભિવ્યક્તિ એવી સબળ છે કે વાર્તારસમાં કશું બાધક નીવડતું નથી.

નિરૂપણની કોઈ ને કોઈ વિશેષતા દરેક વાર્તાનો વિશેષ બને છે. જેમ કે 'વર્ચ્યુઅવિ રીયલ સ્ટૂડેસ' વાર્તામાં કપોળકલ્યિત તત્ત્વનો વિનિયોગ વાસ્તવનાં રહસ્યો સ્કુટ કરવા સંદર્ભે થયો છે. 'ઈ. ઈ. ડબલ્યુ યાને સંકટ સમયની બારી' વાર્તામાં સંકટ સમયની બારી દ્વારા શંકરની ચેતનાને છિન્નાભિન્ન કરી મૂકતી ઘટના રસપ્રદ છે. કાલ્યનિક સંદેહને કારણે સુખદ પણ કેવી દુઃખદ બની રહે છે, તેના સંકેતો વાર્તામાં કલાત્મકતાથી ગ્રંથાયા છે. 'જ્ઞામફણિયામાં છોકરી'માં જ્ઞામફણિયામાં ભેટી ગયેલી છોકરી નિમિત્તે કથાનાયકની આંતર અને બાહ્ય સ્થિતિનું સુંદર વર્ણન છે. એક નાની સરખી ઘટના દ્વારા માનવીના મનના ઊંડાણમાં ડોકિયું કરતી આ રચનામાં લેખક ગંભીરતાપૂર્વક વાર્તા સિદ્ધ કરવા મથ્યા છે.

આ સંગ્રહની સૌથી વધારે સુંદર અને ઉત્તમ વાર્તાઓ 'ગાબું', 'સિમેન્ટ' અને 'એ જરાક જેટલું છેટું' છે. આ વાર્તાઓમાં વાર્તાકારનું સર્જનકર્મ પૂર્ણકળાએ ઝીલી ઊઠેલું જોઈ શકાશે. વાર્તાકાર અહીં જીવનનાં અસ્કુટ તત્ત્વોને પૂરી સજગતા અને ગાંભીર્યથી નિરૂપી શક્યા છે. વાસ્તવનાં રહસ્યો કૃતિના સમગ્ર સંયોજનમાંથી ઊભી થયેલી અર્થનિષ્પત્તિના સમર્થન રૂપે છે. એટલે સંયોજન એ પ્રકારે થયું છે કે અપરિચિત તત્ત્વની ખોજ અવાંતરે કૃતિમાં થતી રહે છે. આ વાર્તાઓની રચનારીતિમાં અદ્ઘપણે એક અપરિચિત બળ કૃતિનાં સંઘળાં ઘટકતત્ત્વોમાં એક જુદ્દો રણકો ઊભો કરે છે. આ રણકાને આપણે અર્થ લેબે ગણાવી શકીએ. અહીં કૃતિમાં ગોપિત રાખેલો અર્થસંદર્ભ નિર્ણાયક બળ તરીકે આવતો હોઈ, વાર્તા સંપૂર્ણ અને સજજ લાગે છે.

'ગાબું'માં કથાનાયકના મનમાં સતત એક જ પ્રશ્ન ઘુમરાયા કરે છે, શું કરવું હવે ? આ પ્રશ્ન એના જીવનના અભાવમાંથી જન્મ્યો છે. આ પ્રશ્નથી નાયકનું ટેન્શન પણ વધ્યું છે. વડોદરાનિવાસી કથાનાયક મગનલાલ શંકરલાલ મહેતાની આ આત્મકેન્દ્રી અભિવ્યક્તિ છે. વચ્ચે વચ્ચે એ ભાવકને વિશ્વાસમાં લઈને ઉપસ્થિત થયેલા પ્રશ્નને એક નક્કર રૂપ આપવા પણ મથે છે. 'હવે શું કરવું ?' એવી

સતત થતી લાગણીને કૃતિમાંથી જ સમર્થન મળ્યા કરે છે. એટલે આછા-પાતળા કથાવસ્તુમાં નાયક જે વિગતો રજૂ કરે છે તે એના માનસમાં ચાલતી ઘટના છે. હર્ષિંગૌરી એટલે કથાનાયકની મા પર સદાય બાપુજીનું વહેમાંબું, કથાનાયક જન્મ્યો ત્યારે જાણી જોઈને બાપુજીનું બહારગામ જતા રહેલું, નાયક પ્રત્યે સદાય તિરસ્કાર - આ શું સૂચયે છે ? થાળીવાળા ભૂંગળાની અને કૂતરાની વાતમાં પણ આ જાતના નિર્દેશો મળે છે. કોઈ બંગાળી સાથે માને અવૈધ સંબંધો છે તેવો બાપુજીને વહેમ છે. આ સંબંધને એ 'પાલવમાં છિદ્ર' એવું કહેતા. મામાને કથાનાયકે છિદ્ર વિષે પૂછાપરછ કરેલી. મામાએ છિદ્રનો અર્થ બાકોદું-ગાબડું એવો કરેલો. તો આ છિદ્ર કયું ? બા કોઈની સાથે હળેલી હતી ? અથવા તો બાપુજીનો શક તદ્દન સાચો હતો ? - આ બધી લપછપમાં લેખકને રસ નથી. એ તો નાયકના મુજે આ બધી વાતોને તૂટક તૂટક રજૂ કરે છે. જરેખર તો ગાબડું કથાનાયકના મનમાં પડેલું છે. સક્ષિયતામાંથી નિર્જિયતા તરફ જઈ રહેલા તેના અર્ધદંધ માનસની ડામાડોળ સ્થિતિની આ કથા છે. એમાં ઉપસ્થિત કાકુઓ, સંકેતસૂત્રો લેખકે જે દાખિલન્દુથી મૂક્યાં છે તેમાં તેની ડામાડોળ સ્થિતિ સાધાર પુરવાર થાય છે. બાપુજીનો કથાનાયક પ્રત્યેનો તિરસ્કાર પ્રચ્છન છે. પણ જે ગોપિત તત્ત્વ છે તે તો કથાનાયકના ભીતરમાં છે. તેના ઈંગિતો મૂક્યીને ભાવકને ગુંચવાડામાં નાખવાનો સહેજે પ્રયત્ન નથી. વાસ્તવના મર્મો જેમ જેમ ખૂલતા જાય છે તેમ તેમ આપણને કલાત્મક આનંદ પ્રાપ્ત થાય છે.

'સિમેન્ટ' વાર્તામાં ગંધની સૂક્ષ્મ તરાણો પ્રગાચાવવામાં લેખકને જબરજસ્ત યારી મળી છે. અહીં સર્વશક્થનની સમાન્તરે પ્રથમ પુરુષ એકવચનની કથનશૈલીનો સમન્વય સાધીને સાહજિકતાથી વાર્તાની સંવેદનાને સંઘન બનાવી છે. કથાનાયકના આંતરજગત અને બાહ્યજગતની વિગતપ્રચ્ચરતા કઠતી નથી તેનું કારણ એ છે કે કથાનાયક જગતના જીવનવ્યવહારમાં એની અનિવાર્યતા છે. ધરતીકુપ થયા પણી બિલ્ડિંગો પર સિમેન્ટરંગની પડેલી તિરાગોની જેમ જગતના જીવનમાં પણ તિરાગો પડેલી છે. જગતની સ્મૃતિમાં અને બાહ્યવ્યવહારમાં એના અતીતની અને વર્તમાનની કાણો ખૂલતી આવે છે.

એના જીવનમાં પડેલી તિરાડો સિમેન્ટથી સાંધવામાં આવેલી હોવા છતાં ચોખ્ખી વર્તાય છે. લેખકના શબ્દોમાં કહીએ તો ‘કેટલીક પાતળી કેટલીક આઈ’ તો, કેટલીક ઘણું પણ બધી જ મૂળ રંગમાં ભેણવા વિનાની.... લેખકે વાર્તામાં આવા તો કેંક જગ્યાએ સંદર્ભો આપીને વાર્તાને સંધન બનાવી છે. કાનખજૂરા અને પાટલાઘોના આવતા સંદર્ભો વાર્તાના કથાવસ્તુને પુષ્ટ કરવામાં અગત્યની કડી બની રહે છે. કથાનાયકની પીડાગ્રસ્ત સ્થિતિમાં આચાસક બાબત હોય તો ભૂખરીનો પરિયય. દરરોજ સાંજે ફરવા જતાં એ ભૂખરીને જુઓ છે. ભૂખરીનું વર્ણન પણ પૂરી સજજતાથી થયેલું છે. ભૂખરી સાથેના વાર્તાલાપ અને ભૂખરી સંદર્ભે કથાનાયકના મનમાં જગતાં સંવેદનો ઉપસાવવામાં લેખકે સર્જનાત્મક ગંધની નવી દિશાઓ ખોલી આપી છે. કથાનાયક ભૂખરી વિશે જાણવા માગે છે ત્યારે ભૂખરી પાટલાઘોની વાત કરીને નાયકની જિજ્ઞાસાને હળવાશથી વે છે. લેખકે અહીં કરેલી કમાલ અંતમાં ખપમાં આવી છે. જગતને ભૂખરી સાથેની મુલાકાત વખતે જાણે કશુંક તો સાંનું નથી થયું - નો અહેસાસ થાય છે. એના જીવનમાં પડેલી તિરાડોનું ધીરે ધીરે બિહિંગમાં થયું રૂપાંતર વાર્તાનો નવો અધ્યાસ પૂરો પાડે છે.

‘એ જરાક જેટલું છેટું’માં કથાનાયક મોહિતભાઈ - શોભનાબહેનની વાત છે. પ્રારંભમાં આપણાને હકીકત લાગે. પણ પછી કથાનાયક જ ઘટસ્ટોર કરી દે છે કે આ મોહિતભાઈ-બોહિતભાઈ કોઈ છે જ નહિ. શોભનાબહેનઝોભનાબેન કશું નહિ - હા, આખેઆપું ગય્યું છે ! કલ્યાણી ઉપજાવી કાઢેલું છે માટે કલ્યુ પણ કહેવાય. જોકે મારી પાસે એક, પણ એક, નરદમ હકીકત પણ છે. જેને હકુ કહેવાય. તો કલ્યુ અને હકુ દ્વારા એ મોહિતભાઈ-શોભનાબહેનના અધભૂતી મૂઠી જેવડા છેયાની વાત કરે છે. મોહિતભાઈ-શોભનાબહેનનાં કાલ્યનિક પાત્રો કથાનાયકના સંસારમાં પડેલા છેયાની પૂર્તતા રૂપે છે. શોભનાબહેન-મોહિતભાઈ કે સોહિણી-રમણકુમારનાં પાત્રો દ્વારા હકુ-કલ્યુની મદદથી પણી સુભદ્રા અને પોતાના વર્ચ્યે પડેલા છેયાની વિગતો ખરેખર રસપ્રદ છે. વાર્તા નિતાંત સુંદર છે. આ પ્રકારના

વિષયવસ્તુને લઈને વાર્તાને સાંધીંત પાર પાડવી ખૂબ અધરી બાબત છે. એક જુદી રચનાપ્રયુક્તિ વડે વાર્તાને સૂક્ષ્મસ્તરીય બનાવવામાં સર્જનનું કર્તૃત્વ દાઢ માગ્યો વે તેવું છે. ગુજરાતી સાહિત્યની ગણનાપાત્ર વાર્તાઓમાં સ્થાન પામે તેવું આ રચનાનું સર્જનકર્મ છે.

‘તે પછી તો કંઈ પણ કશું શકે’, ‘જૂમખું’ અને ‘પાંચ બોધકથાઓ’ આ સંગ્રહની નબળામાં નબળી રચનાઓ છે. આ રચનાઓનો સંગ્રહમાં સમાવેશ કરવાનો લેખકે લોભ કરવા જેવો નહોતો. પ્રારંભમાં કપોળકલ્યિત તત્ત્વનો સહારો લઈને રચેલી ‘તે પછી તો...’ રચનામાં વાસ્તવ સાથે સૂક્ષ્મતંતુઓ સંધારા ન હોવાથી બધું પાંખું-પાંખું - તૂટક તૂટક લાગે છે. આ લખાજાને વાર્તા કહેવી કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ‘જૂમખું’ જિંદગીમાં ઘેરી હતાશા લઈને ફરતા કથાનાયકને ‘મજા’ નથી આવતી. એકલાઅટૂલા જીવાની જાણે આદત પડી ગઈ છે. નિર્ધારિત એટ્રેસે પહોંચાતું નથી. પહોંચવાની ઉત્તાવળ પણ નથી. અહીં સુમન શાહની આધુનિક છલ્લી દેખાય... પણ સાવ ધૂંધળી... મોં માથા વિનાની. ‘પાંચ બોધકથાઓ’ને માત્ર ગવરૂપે વાંચવી ગમે તેવી છે. વાર્તાની દસ્તિએ બહુ મજા પડતી નથી. ‘ધર’ નામની બોધકથા તેના સંવેદનાત્મક આવેગોને કારણે ગમે તેવી રચના છે. ‘તે પછી તો...’, ‘જૂમખું’ અને પાંચ બોધકથાઓ બેત્રાણ વાચને પામી શકાતી નથી, તેને હું વાર્તાની મોટી મર્યાદા ગણું છું, તાકાતૂસીને અર્થ તારવવાનું મોટા વિવેચકો પર છોડી દઈએ. ‘તે પછી તો...’ અને ‘જૂમખું’ આ સંગ્રહની ટૂંકામાં ટૂંકી વાર્તાઓ છે. બન્ને નબળી વાર્તાઓ છે. ટૂંકાણ આ લેખકની મર્યાદા પણ છે. મોટા ભાગની વાર્તાઓમાં, નાયક-નાયિકા બેવજ્ઞા બન્યાં હોય અથવા કોઈની બેવજ્ઞાઈનો બોગ બનેલાં હોય તેવું નિરૂપણ છે. આથી પાત્રો જાણે એક જ ફબનાં - એક જ રીતિથી જીવાં હોય તેવું લાગે છે. પણ આ મર્યાદા એમની વિશેપત્તા પણ બની રહે છે. આ પ્રકારનાં પાત્રોનું એક જુદું જ ભાવવિશ્વ રચવામાં લેખક સામે પડકાર હતો, જે એમણે પૂરી તટસ્થતાથી ઝીલી બતાવ્યો છે. આ સંગ્રહની વાર્તાઓનાં પાત્રો સરેરાશ માણસની જેમ સમરેખ નથી. પાત્રોના જીવનમાં અદદ્ધ

રહેલાં મૂલ્યોને ઉપસાવવામાં લેખકને રસ છે. અહીં મહિમા દશ્યમાન જગતમાં જે છે તેનો નથી. અહીં પાત્રોની

આંતરખોજ જે નથી તે મેળવવાની છે. એ અર્થમાં પણ આ એક વિશિષ્ટ વાર્તાસંગ્રહ બની રહે છે.

### બિટન : આદમકં અરીસામાં – અદમ ટંકારવી

### બિટનને ખોજવાની મથામણ

આર. આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૫, ડ. ૨૬૪, રૂ. ૧૫૦

રમેશ બી. શાહ

બિદેશપ્રવાસનું વર્ણન કરતાં ઘણાં પુસ્તકો ગુજરાતીમાં લખાયાં છે. આ પુસ્તક એ બધાં પુસ્તકોથી નોંધું પડે છે. પુસ્તકના લેખક ૧૯૮૧માં હંગેન્ડમાં આવેલા બોલ્ટનની ગર્સી હાઇસ્કૂલમાં આચાર્યપદે નિમાયા ત્યારથી તેઓ બિટનવાસી બનેલા છે. તે અગાઉ ૧૯૮૧માં બિટનની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાં તેમણે એક વર્ષ અભ્યાસ કરેલો. બિટનના લાંબા ગાળાના વસવાટ દરમિયાન તેમણે બિટનને સમજવાનો પ્રયાસ કર્યો છે અને છતાં લેખકે તેમના ‘નિરેદન : ભાવ-અભાવ’માં લખ્યું છે : આટલું જોયા, જાણ્યા, લખ્યા પછી પણ મનમાં બિટન વિશેની અસમંજસ કાયમ છે. વોટ ઈજ બિટન ઓલ અબાઉટ ? બિટન શું છે ? એ પ્રશ્નનો કોઈ સાફ્સ્ક્રૂથરો કે ગળે ઊતરે એવો જવાબ મળ્યો નથી. આ પુસ્તક બિટન વિશેનું વિધાન નથી. આ છે માત્ર બિટનને ખોજવાની મથામણ. આ મથામણ વર્ણનાત્મક સ્વરૂપની છે, વિશેષજ્ઞાત્મક સ્વરૂપની નથી કેમ કે લેખો લોકભોગ્ય સામયિકો માટે લખાયેલા છે. તેમાં ચોક્કસ દસ્તિ રાખીને બિટનની કોઈ આકૃતિ ઉપસાવવાનો પ્રયાસ નથી. લેખો જુદા જુદા સમયે લખાયેલા છે તેથી એવી અપેક્ષા પણ રાખવાની નથી.

સમયના લાંબા ગાળામાં લખાયેલા આ લેખોમાં વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં બિટનની શિક્ષણપ્રથાનાં કેટલાંક પાસાંનું વર્ણન છે, હંગેન્ડમાં વિદેશી મૂળના નાગરિકો પરતે બિટનની સરકાર તથા નાગરિક સમાજ જે સમભાવપૂર્ણ વ્યવહાર કરે છે અને તેમની સાથે સમાન અધિકારો ધરાવતા નાગરિકો તરીકે જે વર્તાવ કરે છે તેની ઉદાહરણો સહિતની માહિતી છે. હંગેન્ડમાં જાહેર સેવાઓના કર્મચારીઓ નાગરિકો સાથે

જે સૌજન્યપૂર્ણ અને સદ્ગ્રાવપૂર્ણ વ્યવહાર કરે છે તેનાં આપણા માટે સાવ અકલ્ય ઉદાહરણો આ લેખોમાં વાંચવા મળે છે. એક વિકસિત દેશ તરીકે બિટનનું રજ્ય તેના નાગરિકોને જે સામાજિક સલામતી પૂરી પાડે છે તે તે ભારતના નાગરિકો માટે આજે સ્વભાવત્ત છે. સર્વ વાતે સુખી જાણતા બિટનના નાગરિકો સારી રીતે જીવન ગુજરવાની બાબતમાં સુનિશ્ચિત છે અને છતાં તેઓ તેમના જીવનમાં ખાતીપો અને બોર્ડમ અનુભવે છે તેની અહીં વાત છે. હંગેન્ડના સમાજમાંથી ભગવાને અને નીતિમૂલ્યોએ વિદ્યાય લીધી છે તેનો લેખકને વસવસો છે. હંગેન્ડમાં જ ઊછરેલી ભારતીય મૂળની બે વિદ્યાર્થીઓના ગુજરાત વિશેના અનુભવો અહીં આવેખાયા છે. હંગેન્ડનાં એક શિક્ષણવિદે શૈક્ષણિક કાર્યક્રમ નિમિત્તે ગુજરાતમાં થોડો સમય ગાળેલો, ગુજરાતના લોકો વિશેની તેમની છાપ અહીં વાંચવા મળે છે. સંખ્યાબંધ પ્રસંગોનું વર્ણન રસપ્રદ વાચન પૂરું પાડે છે.

n

બિટનની શિક્ષણ-પરંપરાનાં જે કેટલાંક પાસાં લેખકે વર્ણિયાં છે તેમને ભારતના સંદર્ભમાં તપાસવા જોવાં છે. લેખકે નોંધ્યું છે તેમ એ શિક્ષણપ્રથામાં વિદ્યાર્થીના ચારિત્રયધારતર પર ભાર મૂકવામાં આવતો નથી, પરંતુ વિદ્યાર્થીઓને સ્વાધ્યાય દ્વારા સ્વતંત્ર રીતે વિચાર કરતા કરવા પર ભાર મૂકવામાં આવે છે. ભારતમાં શાનનો અર્થ શાસ્ત્રગ્રંથોની જાણકારી છે. જુદા જુદા આચાર્યો કે વિદ્ધાનો તે તે વિષયમાં શું કહી ગયા છે તેની જાણકારી આપણે ત્યાં વિદ્ધાનમાં ખપે છે. તેથી આપણે ત્યાં બધું કંદસ્થ કરવા પર ભાર મૂકવામાં આવે છે. બિટનમાં બીજા વિદ્ધાનોને

વાંચ્યા સમજ્યા પણી તમારે તમારું પોતાનું શું કહેવું છે એના પર જ, એટલે કે તમારી મૌલિકતા પર ભાર મૂકવામાં આવે છે. લેખકે લેન્કાસ્ટરનો પોતાનો અનુભવ આના સંદર્ભમાં નોંધ્યો છે. તેમના પ્રોફેસર ડર્મોટે પ્રથમ વ્યાખ્યાનમાં પ્રશ્ન પૂછ્યો : વોટ ઈઝ લેન્જિવજ .... જવાબમાં લેખક એમ. એડ હાઇલિશના કોર્સ માટે ગોખેલી બ્લુમઝીલ્ડ, કેરલ અને ચોમ્સકિની વ્યાખ્યાઓ કંડકડાટ બોલી ગયા પણ ડર્મોટે સહેજે પ્રભાવિત થયા વિના એટલું જ કહ્યું, યસ બટ્ટ... વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારતા કરવાની આ પરંપરા શાળા-શિક્ષણ સુધી વિસ્તરેલી છે.

બ્રિટનની શાળાઓમાં નૈતિક મૂલ્યોનું શિક્ષણ નથી અપારું એનો વસવસો લેખકે વ્યક્ત કર્યો છે, પરંતુ ‘ધેટ એકસ્ટ્રા સમયિંગ’ પ્રકરણમાંથી કાઈક જુદું ચિત્ર ઉપસે છે. ‘બોલ્ટન હાઈસ્કૂલ ફોર ગર્લ્સ’ ૧૯૭૦માં તેની શતાબ્દીની ઉજવાણીના ભાગ રૂપે તેની પૂર્વ-વિદ્યાર્થીનીઓને એક પ્રશ્ન પૂછેલો : આ શાળાએ જીવન માટેનું શું ભાયું બંધાવ્યું ? – ‘મોટા ભાગની મહિલાઓએ કહ્યું કે કોમ્પ્યુનિટી કન્સર્ન અને પ્રામાણિકતા... આમાં સ્વતંત્ર વિચારશક્તિ પણ આવી જાય, ડરથી, દંબથી કે સમજભીરુતાથી કશું સ્વીકારાય નહિયે.’

લેખકનું એક અવલોકન યથાર્થ છે. બ્રિટનની શિક્ષણપ્રથમાં પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે, નીપજ પર નહિ. આ શિક્ષણપ્રક્રિયામાંથી પસાર થયેલો વિદ્યાર્થી શું ગ્રહણ કરેશે તેનો આધાર છેવટે તો વિદ્યાર્થી પર જ રહેલો છે. ઉક્ત શાળાએ તેની વિદ્યાર્થીનીઓને એક પ્રશ્ન આ પ્રમાણે પૂછ્યો હતો : ભણતરની કઈ બાબત જીવનમાં વધુ ખપ લાગી ? એના જવાબમાં અપાર વૈવિધ્ય હતું. દા. ત., મિસ હિંગિંગ બોટમે શીખવેલું સંગીત, સમાજને ખપ લાગવાની ઈચ્છા, ટોયાંશાહીથી બચવાની હિંમત, મૂલ્યવાનની પ્રાપ્તિ માટે મહેનત કરવી પડે એવી સમજ, પુરુષક્રોમ... એ સ્પષ્ટ છે કે આ બધું કાઈ શાળાના અભ્યાસક્રમનું શિખવવામાં આવતું નથી. તેથી નૈતિક મૂલ્યોનું શિક્ષણ તેનાં અપેક્ષિત પરિણામો આપશે એવી આશા રાખવા જેવી નથી.

જેને યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે તેનું

એક કાર્ય સંશોધન દ્વારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનું છે. આ જ્ઞાન કેવળ ઓક્ટેમ્બર ન રહેવું જોઈએ. સંશોધનો સમાજની કોઈ ચોક્કસ સમર્થાને સમજવાના અને ઉકેલવાના હેતુથી હાથ ધરવાં જોઈએ. બ્રિટનની યુનિવર્સિટીઓની એ પરંપરા છે. બ્રિટનની યુનિવર્સિટીઓ આવાં સંશોધનો કેટલા મોટા પ્રમાણમાં કરે છે અને સમાજના કેવા કેવા પ્રશ્નો આ સંશોધકોની નજરે ચેડ છે તેનું વિગતવાર વર્જિન ‘ડાઉન ટુ અર્થ’ પ્રકરણમાં વાંચ્યવા મળે છે. (અલબત્ત, અહીં શારતીય સ્વરૂપના સંશોધનોનો નિષેધ નથી. એની ભૂમિકા વિના વ્યવહારપથોળી સંશોધનો ભાગે ફળદાયી નીવડી શકે.) બ્રિટનની સરકાર અને લોકો એ સંશોધનમૂલક જ્ઞાનનું કેવું ઊંચું મૂલ્ય આંકે છે તેનાં પણ કેટલાંક ઉદાહરણો લેખકે નોંધ્યાં છે. બ્રિટનની આ પરંપરાના સંદર્ભમાં આપણી યુનિવર્સિટીઓ કેવળ વીચિંગ યુનિવર્સિટીઓ એટલે કે ઉછીના લીધીલા જ્ઞાનનું રિપોર્ટિંગ કરતી સંસ્થાઓ જ રહી છે, અને સંશોધનને નામે બહુધા, મગનાબાઈ દેસાઈ કહેતા તેમ, ‘સંશોધનવેડા’ જ ચાલે છે.

બ્રિટનને સમજવા માટે જાહેર સેવાઓના કર્મચારીઓની સેવાપરાયણતા અને તેમનો નાગરિકો માટેનો આદર દર્શાવતાં બે ઉદાહરણો નોંધીએ. એક ઉદાહરણ ગુજરાતમાંથી બ્રિટન ગયેલા યાકૂબ ભૂતાનું છે. ૧૯૬૦માં લંડન ઉિતર્યા ત્યારે ખીસામાં ત્રણ પાઉન્ડ અને પ્રેસ્ટનમાં રહેતા તેમના મિત્ર ઐયુબભાઈ કરીમનું કાર્ડ. એરપોર્ટથી કોઈ ટેક્સીવાળાને પ્રેસ્ટનનું સરનામું વંચાવ્યું, એણે રેલવે સ્ટેશન સુધી પહોંચાડ્યા અને ત્રણ પાઉન્ડ લીધા. ત્યાં ફરતા સ્ટેશનમાસ્તરને ભૂતાની સોંપણી કરી. સ્ટેશનમાસ્તરે તેમને ટિકિટ માટે પૈસાનું પૂછ્યું. ભૂતાને જાવી ખીસું બતાવ્યું. સ્ટેશનમાસ્તરે એમની પાસેથી અયુબભાઈનું કાર્ડ લીધું. એ લઈને તેઓ ઓફિસમાં ગયા અને થોડી વારમાં ભૂતાની પાસે આવ્યા. હસીને ભૂતાના હાથમાં ટિકિટ મૂકી અને પ્રેસ્ટનની ગાડીમાં બેસાડ્યા અને ઘડિયાળ બતાવી કહ્યું, ‘પ્રેસ્ટન એટ ફાઈવ.’ વધારામાં ડબામાં બેઠેલાં એક અંગેજ બાનુને તેમની ભલામજા કરી. વચ્ચગાળામાં સ્ટેશનમાસ્તરે શું કહેલું તેનું વર્જિન લેખકે ટંકેલા ભૂતાના શબ્દોમાં નોંધીએ :

ઘેર પહોંચ્યા પછી ઐયુબભાઈને પૂછ્યું કે આ બધું શું બન્યું. એમણે ચા પીતાં પીતાં સમજ પાડી કે, લંડનવાળા સ્ટેશનમાસ્તરે પ્રેસ્ટનવાળાને ફોન કરી મારો નંબર અને ઠકાણું આપેલાં, અને જણાવેલું કે ઐયુબને ફોન કરીને જણાવ કે તારો ફેન્ડ યાકૂબ ઇન્ડિયાથી આવ્યો છે. તેની પાસે પૈસા નથી. પણ હું પ્રેસ્ટનની ટિકિટ આપું છું. તું પાંચ વાગ્યે આવજે અને ત્યારે ભાડાના પૈસા પ્રેસ્ટનના સ્ટેશનમાસ્તરને ચૂકવી દેજે. આ રીતે બધું ગોઠવાયેલું અને તમે સુખરૂપ પહોંચી ગયા.

બીજું ઉદાહરણ. લેખક એમના ભિત્ર રહેમતુલ્લાહભાઈની સાથે કારમાં જતા હતા. ચાર રસ્તા પર ગ્રીન સિઝનલ હતો એટલે ગાડી આગળ વધી હતી. એ દરમિયાન એક અંગેજ છોકરીએ ટ્રાફિક લાઈટ પાસે રસ્તો ઓંંગવા દોટ મૂકી અને ગાડી સાથે ટકરાઈને ફુંગોળાઈ ગઈ. બધી ગાડીઓ થોભી ગઈ. પાછળની ગાડીમાં બેઢેલા અંગેજ બહાર આવીને પોતાના નામ-સરનામાવણું કાર્ડ આપતાં કંધું કે ગ્રીન સિઝનલ હતો અને રસ્તો ઓંંગવામાં છોકરીએ ભૂલ કરેલી. કેસ થાય તો હું જુબાની આપવા આવીશ. પોલીસે શાંતિથી વિવેકી ભાષામાં રહેમતુલ્લાહભાઈને લાયસન્સ વગેરે અંગે પૂછ્યું. રહેમતુલ્લાહભાઈએ કંધું કે લાયસન્સ ઘેર પડ્યું છે, એટલે પોલીસે કંધું કે બોલ્ટન પોલીસ ચોકી પર બતાવી આવજો અને મારો આ નંબર આપજો, તેઓ જાણ કરી દેશે. હવે હું હોસ્પિટલ જાઉં છું. બાળકીને કેટલી ઈજા થઈ છે તેના પર કેસનો આધાર છે. તમારો ફોન નંબર લખાવો. હું તમને કલાકેકમાં જાણ કરીશ. કલાકમાં ફોન આવી ગયો. પોલીસે કંધું કે ચિંતા ન કરશો. બાળકીને આધાર પહોંચેલો અને સાધારણ ઉઝરડા થયેલા. કશું ગંભીર નથી. તમારે આટલી માથાકૂટ વેઠવી પડી તે બદલ હિલગેર છું.

બિટનમાં સામાજિક સલામતીની જે સાઈટ જેટલી યોજનાઓ છે તેનાં કેટલાંક ઉદાહરણો નોંધીએ. સગભિને અઠવાડિયાં સુધી અઠવાડિયે ૨૩ પાઉન્ડની સહાય, પ્રસૂતિ માટે ૨૫ પાઉન્ડની સહાય, બાળક જન્મે ત્યારથી શાળાએ જતું થાય ત્યાં સુધી ઘેર બેઠાં મહિત દૂધ, સોળ વરસની વય સુધી બાળક દીઠ અઠવાડિયે ૫.૨૫ (સવા પાંચ) પાઉન્ડનું ભથ્યું, કોલેજ હોસ્પિટમાં રહી પ્રથમ ડિગ્રી

માટે અભ્યાસ કરતાં વિદ્યાર્થીને વાર્ષિક ૧૪૩૦ પાઉન્ડની સહાય ઉપરોત મહિત સ્વાસ્થ્ય સેવા, ઓછી આવક મેળવતા લોકોને ભથ્યું... ટૂકમાં બિટનની સરકાર વિવિધ સ્વરૂપે કલ્યાણશોજનાઓ ચલાવી જરૂરિયાતવાળા નાગરિકોને નાણાંની સહાય કરે છે. આ નાણાં મેળવવાની વિધિ અટપી નથી અને બિટનના નાગરિકો પણ અયોગ્ય રીતે નાણાં મેળવવાની દાનત રાખતા નથી..

અંગેજો 'ફેર પ્લે'ને પોતાનો પ્રજાકીય ગુણ ગણે છે. ફેર પ્લે એટલે બધાની સાથે નિયમસરનો એકસરાઓ વર્તાવ. રમતના નિયમોનું પાલન. શાળાનાં બાળકો વાતચીત કરે તેમાં ફેર ઇનફ (વાજબી છે) અને ઇટ્ટસ નોટ ફેર - એવા શાબ્દો વારંવાર સાંભળવા મળે. બિટનની વંશીય સમાનતામાં ફેર પ્લેનું એક ઉદાહરણ નોંધીએ. રૂઢિચુસ્ત પક્ષના એક ધારાસભ્ય અને રોડો કેબિનેટના સર્વ્યે એક સભામાં મજાક કરતાં કંધું, પાડીઓ મારા દેશમાં પેનીના દસ મળે છે. પાકી દક્ષિણ એશિયાના દેશોમાંથી આવેલા લોકો માટે વપરાતો તુચ્છકારવાચયક શબ્દ છે.) આ વંશદ્વેષી મજાક સામે તરત જ હોબાળો થયો. વક્તાએ માર્જી માર્જી, પણ બનાવ બન્યાના અઠવાર કલાકમાં જ રૂઢિચુસ્ત પક્ષના નેતાએ મજાક કરનાર ધારાસભ્યને રોડો કેબિનેટમાંથી તગેડી મૂક્યા અને જાહેર કર્યું કે મારે બિટનની પ્રજાને મારા પક્ષ વિશે ખાતરી આપવી છે કે અમે અસહિષ્ણુતા પત્યે અસહિષ્ણુ છીએ. આવા સ્ટ્ર્યુપીડ જોક માટે કેવળ ક્ષમાયાચના ન ચાલે. અલબત્ત, લોકોના વ્યવહારમાં વંશીય દ્રેષ્ણા કિસ્સા નથી બનતા એવું નથી, પરંતુ તેનો ભોગ બનેલા લોકો અદાલતમાં જઈને ન્યાય મેળવી શકે છે.

લેખક નોંધ્યું છે તેમ અંગેજની પ્રામાણિકતા, વિવેકબુદ્ધિ, પ્રમાણભાન, કર્તવ્યનિષ્ઠા, વિનયશીલતા અને ઔચિત્યભાનના ઢગલેબંધ કિસ્સા આવેખાયા છે. આ પ્રજામાં આટલી મર્યાદિતી આવે છે ક્યાંથી? મને લાગે છે કે એમની શિક્ષણપ્રક્રિયા દ્વારા જ ઘડાય છે. શાળામાં નિરીક્ષણ કરવું, વિચારવું, પ્રશ્નો પૂછવા, અભિપ્રાય બાંધવો વગેરે પર ભાર મુક્યા છે. નીપજ નહિ, પણ ભાજવાની પ્રક્રિયા જ અગત્યની બાબત ગણાય છે.

બ્રિટનની પ્રજા વિશે લેખકને અને બ્રિટનના કેટલાક ચિંતકોને જે ફરિયાદ છે તે ‘ધ્યાન ઠંડાન્ડ, બદ્દ’, ‘બોરડમ’, ‘સત્યાનાશ’ : ઠંડાન્ડની આંતરકથા’, ‘નૈતિક આંખ મીંચામણાં’ વગેરે લેખોમાં વાંચવા મળે છે. વિવિધ લેખોમાંથી એનો કેટલીક વિગતો લેખકના જ શબ્દોમાં નોંધીએ :

૧ પણ આ સમૃદ્ધિ મેળવવાની પ્રક્રિયામાં આ પ્રજા એટલી બહિરૂંની થઈ ગઈ છે કે શરીરસુખ એ જ ધર્મ બન્યો છે. વરસ રહ્યો તે દરમિયાન વાતચીતમાં મેં કોઈના મોઢેથી ગોડ શબ્દ સાંભળ્યો નહિએ... ધર્મમાં શ્રદ્ધા ન રહે તે એક વાત થઈ, પણ આ સમાજમાં ધર્મની, ઈશ્વરની, ઈસ્લામની વિંબના છાડેયોક થાય છે... અહીં પત્યેકની આગ્રહ એવો કે પોતાના જીવનને પોતે જ અર્થ આપે. મેઠક યોર ઓન મિનિંગ અપ એટલે માલિક, બાઇબલ, ઈસા, ધર્મગુરુ, સંત, ફકીર, માબાપ, વડીલ કોઈની સત્તા સ્વીકારાતી નથી. સમાજમાં સર્વસ્વીકૃત નીતિનો મુદ્દો જ જાણે અપ્રસ્તુત થઈ ગયો છે. ‘ગાર્ડિઅન’માં હુંગો ધંગ જાહેર કરે છે કે ધ મારોલ ઈસ્યુ ઈજ ડેડ. સારા મેઠક લેન્ડ વધામણાં ખાય છે કે કુટુંબસંસ્થાના બાર વાગી ગયા છે. સાઈમન જેનકિન્સ સલાહ આપે છે કે કુટુંબસંસ્થાની આ મુડદાલ પ્રથાને જીવતી રખવાનાં હવાતિયાં નિરાશી છે. ‘ટાઈમ્સ’માં વાનીઆ કિન્ડર્ઝુલ્લી લગ્નપ્રથા વિશે કહે છે કે, કોઈ તો મને સમજાવે કે હજુ આપણે લગ્ન કરવાનું કેમ ચાલુ રાખ્યું છે ?

૧ પાનખરના સત્ર સાથે કોલેજેનું નવું વર્ષ શરૂ થયું ત્યારે માન્યેસ્ટર એરિયા નેશનલ યુનિયન ઔંબ્ર સ્ટ્રીડન્ડસ તરફથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે હેન્ડબુક નામે ‘માનુસ’ બહાર પાડીએ... એક આખું પાનું સેઈફ સેક્સ પર છે જેમાં ગર્ભનિરોધક સાધનો મહિત ક્યાંથી મળે અને કેમ વાપરવાં તેની માહિતી છે. તે પછીનાં પાનાં સાજાતીય સંબંધ રાખતાં છોકરા-છોકરીઓ માટે છે... માન્યેસ્ટર એન્ડ ઈટ્સ સરાઉન્ડિંગ કન્ટ્રી ઈજ પ્રોબેલ્ટી ધ લાઈવલી-એસ્ટ પ્લેસ કું બી ઈન્ ઈફ યુ આર અ લેસ્લીઅન ઔર અ ગે. વળી ત્રણચાર પાનાં દારુ અને ગાંઝાચરસ વિશે છે. એની શરૂઆતમાં જ એલાન કર્યું છે કે, ડ્રગ એન્ડ

આલ્કોહોલ આર અને એવરીટે ફેફ્ટ ઔંબ્ર લાઈફ.

૧ ૨૩ ટકા કુટુંબો ઘરભંગ થયેલાં છે, ૪૦ ટકા લગ્નો છૂટાંડામાં પરિષ્ણમે છે, ૩૭ ટકા બાળકો લગ્નેતર સંબંધોથી જરૂરોલાં છે, કિશોરવયના ગુનેગારો વરસે સિતેર વાખ ગુના આચરે છે... ડૉ. નિકોલસ ટેઈટ બ્રિટનમાં શાળા-અભ્યાસક્રમો અને મૂલ્યાંકનના વડા નિયામક છે. તેમજે હમણાં બાપોકાર જાહેર કર્યું છે, ઠંડાન્ડની વર્તમાન શિક્ષણપ્રથામાં બાળકો રાઈટ અને રોંગ વચ્ચે ભેટ કરવાનું, સારા અને નરસા વચ્ચે પસંદગી કે વિવેક કરવાનું શીખતાં નથી.... શિક્ષકો પોતે જ રાઈટ અને રોંગ વચ્ચે ગૂંચવાડામાં છે... વિજ્ઞાનની એક શિક્ષિકાએ કલ્યું આઈ હિલ અન્ન એમ્ટીનેસ ઇન મી ઓલ ધ ટાઈમ... જીવનમાં કઈ બાબતમાં સૌથી વધુ ડર છે ? એના જીવાબમાં સૌથી ટોચે એકલતા આવે છે... આ પ્રજા બોરડમનો ભોગ બની છે અને તેથી જ કદાચ અનેક રીતબાતે જીવનમાં કિક શોધ્યા કરે છે...

ઠંડાન્ડની બે બાજુઓના આ ટૂંકા વર્ણન પરથી લેખકની ઠંડાન્ડ વિશેની અસમંજસ સમજાય તેવી છે. બ્રિટનના લોકો તેમનો નાગરિકધર્મ બરાબર પામે છે. લોકોના જે આચરણથી સમાજનું ધારણ અને પોષણ થાય તેને જો આપણે ધર્મ ગણીએ તો આ પ્રજા સંપ્રદાયનાં બોધવચનો સંભળ્યા વિના અને સંપ્રદાયિક કર્મકાંડ આચર્યા વિના પણ ધાર્મિક છે. આ પ્રજાને ફેર પે માટે સંપ્રદાય, ભગવાન અને ગુરુના પીઠબળની જરૂર પડતી નથી. એ રીતે જોઈએ તો બ્રિટનના સમાજમાંથી ભગવાન અને સંપ્રદાયિક મૂલ્યોની વિદ્યાય વસવસો કરવા જેવી બાબત જણાતી નથી.

પ્રશ્નો લગ્નપ્રથા પર આધારિત કુટુંબપ્રથાની પડતી અને સેક્સની બાબતમાં મુક્તાચારમાંથી ઊભા થયા છે. આર્થિક વિકાસે સમૃદ્ધિ સર્જને રાજ્યને ‘કલ્યાણ રાજ્ય’ બનવાની ક્ષમતા આપી છે. આ કલ્યાણ રાજ્યે ઘણીબધી કૌટુંબિક જવાબદારીઓ (કામગીરીઓ) પોતાના શિરે લઈ લીધી છે. બાળકોને ઉછેરવાનું અને શિક્ષણ આપવાનું નાણાકીય ખર્ચ કુટુંબે ભોગવચનાં નથી, વૃદ્ધોની જવાબદારી કુટુંબના સભ્યોની રહી નથી, માંદગીમાં સારવાર હોસ્પિટલમાં જ મેળવવાની છે અને તેમાં કુટુંબના સભ્યોએ

કોઈ કામગીરી બજાવવાની નથી. આમ વ્યક્તિના જીવનમાં કુટુંબ ઘણીબધી બાબતોમાં આવશ્યક રહ્યું નથી. તેથી કુટુંબ અને લગ્નની સંસ્થાને જ અનાવશ્યક ગણનારા સમાજમાં મુખ્યિત બને તે સહજ છે. અલબત્ત, આમાંથી સમાજજીવન માટે એક પાયાનો પ્રશ્ન તો ઊભો થાય છે જે : કુટુંબની બુનિયાદ વિનાનો સમાજ હોય તો તે કેવો હોય ? બિટનના નાગરિકો આજે મહંદ્શો નાગરિક ધર્મ પાગતા જણાય છે, પરંતુ બિટનના કિશોરોમાં જે ગુનાહિત માનસ કેળવાતું જાય છે એ જોતાં ભવિષ્યમાં એ દેશના નાગરિકો તેમનો નાગરિક ધર્મ અદ્દા કરતા રહેશે કે કેમ એવો પ્રશ્ન જરૂર ઊભો થાય.

કુટુંબસંસ્થાની પડતી અને સ્વકેન્દ્રી જીવન જીવવાની પરંપરાનો વિકાસ પરસ્પર સંકળાયેલી બાબતો છે. આર્થિક સમૃદ્ધિ અને સલામતીએ વ્યક્તિની સ્વતંત્રતામાં, તેને ઉપલબ્ધ તકોમાં-વિકલ્પોમાં વધારો કર્યો છે. વ્યક્તિ પોતાની રીતે અંગત જીવન જીવવા માટે મુક્ત બની છે. જીવન ગુજારવાની બાબતમાં તે ‘પરાવલંબી’ રહી નથી. તેથી જ તે એકલવાયું જીવન જીવે છે, અને બોર્ડમ અનુભવે છે. સમાજની વિશાળ બહુમતી પાસે ઐહિક સુખ સિવાયનો કોઈ ઉદ્દેશ જ નથી. આપણો હિંદુઓ ઐહિક સુખને સહેજે ગૌણ ગણ્યા વિના જે રીતે આત્મકલ્યાણ, તે માટે સાંપ્રદાયિક કર્મકાંડો અને દયાદાન દ્વારા પુણ્ય ક્રમાવાના ઉદ્દેશો નજર સમક્ષ રાખીએ છીએ એ રીતે બિટનની પ્રજા પાસે જીવનના કોઈ ‘આધ્યાત્મિક’ ઉદ્દેશો નથી. આર્થિક સમૃદ્ધિએ મોટા ભાગના લોકો માટે ઐહિક સુખને એટલું બધું સહજ બનાવી દીધું છે કે તે એક વ્યસન બની ગયું છે, મતલબ કે એનો અભાવ કષ્ટદાયક અને અજ્ઞ્યો કરનારો નીવડે છે પણ તેની પ્રાપ્તિથી કોઈ સુખ સાંપડતું નથી. તેથી આ પ્રજાને સુખનો અનુભવ કરવા માટે કિકની જરૂર પડે છે.

બિટનની આ બીજી બાજુ જાણ્યા પછી ગાંધીવિચાર અને ‘હિંદુ સ્વરાજ’નું સ્મરણ આપણને સહજ રીતે થઈ આવે. તેને અનુમોદન આપે એવું એક અવલોકન પણ

અહીં વાંચવા મળે છે. દુંગેનું પ્રેસ્ટન કોલેજનાં શ્રીમતી મૌરીન લોઈડ શૈક્ષણિક કાર્યક્ષમિત્ર માટે ગુજરાત આવેલાં. લેખકે તેમને પ્રશ્ન પૂછ્યો : કેવું લાગ્યું ભારત ? એમણે કહ્યું કે આઈ અમ ઓવરચેમ્બ – ભારત વિરોધાભાસનો મુલક છે – તમે ભારત વિશે જે કંઈ કહો તે સાચું, અને તેથી ઊંબદું પણ સાચું. મોટે ભાગે લોકો ગરીબ છે, પણ ખુશ દેખાય છે. જીવનની ગતિ ખાસ્કી તણાવમુક્ત છે. અહીંના જેવી હિયાદોટ કે હાયવલૂચા નથી. એકસઠની ઉમરે ભારતથી હું એ શીખીને આવી કે સુખી રહેવા માટે જાણ અસબાબાની જરૂર નથી. લોકો થોડામાં સુખચેનથી જીવતા હોય છે.

પરંતુ સામાજિક પરિવર્તનો કે સંસ્કૃતિનું સર્જન ડિઝાઇન બનાવીને કરી શકતું નથી. આપણા આદર્શોને નજર સમક્ષ રાખીને એ સામાજિક પરિવર્તનોનું મૂલ્યાંકન આપણો કરી શકીએ પણ એ આદર્શો પ્રમાણે સમાજને આકાર આપી શકીએ નહિ. બિટનના સમાજમાં લેખકને જે વલણો જોઈને અસમંજસ થઈ છે તેનો ખુલાસો નિરંકુશ રીતે થતાં સામાજિક પરિવર્તનોમાં રહેલો છે. ભારતના સમાજમાં જે વિરોધાભાસો મૌરીન લોઈડને જોવા મળ્યા તે કોઈ પણ દેશમાં હોય તે અપેક્ષિત છે.

આવી તાત્ત્વિક ચર્ચામાં જેમને રસ ન હોય એવા વાચકોને પણ રસ પડે એવી ઘણી સામગ્રી આ પુસ્તકમાં છે. અલબત્ત, લેખક બિટનમાં લાંબો સમય રહ્યા છે. અને અંગેજ ભાષાના અધ્યાપક છે તેની અસર તેમની શૈલી પર પડી છે. અંગેજ વક્યો અને શબ્દોનો તેમણે છૂટથી ઉપયોગ કર્યો છે. એ અંગેજ વક્યોના અનુવાદો સાથોસાથ જ આપવામાં આવેલા છે. તેથી અંગેજ વક્યો લખવાનું લેખકનું પ્રયોજન શું હશે એવો પ્રશ્ન સહજ રીતે ઉદ્ભબવે. વળી અંગેજ શબ્દો લાક્ષણિક બિટિશ ઉચ્ચારોમાં ગુજરાતી વિધિમાં લખવામાં આવ્યા હોવાથી અંગેજ શબ્દોના ગુજરાતમાં પ્રચલિત ઉચ્ચારોથી ટેવાયેલા વાચકોને અર્થબોધ પામવામાં અવરોધ ઊભો થાય તેવી શક્યતા હોય છે.

પ્રવાસપ્રીતિ જેમનો સ્થાયી ભાવ રહ્યો છે એવાં પ્રીતિ સેનગુપ્તાએ આ પુસ્તકમાં દક્ષિણ આહિકાનો પ્રવાસ વિગતે આવેખ્યો છે. દરેક સ્થાનને સમાનભાવે ચાહતાં-આગાધતાં લેખિકા પુસ્તકની પ્રસ્તાવનામાં પોતાના મનની વાત ઉઘાડતાં નોંધે છે : માર્ગને અંત નથી હોતો અને સ્થાનો પ્રત્યેના સ્નેહને સીમા નથી હોતી, તે જાણ મને થઈ ચૂકી છે. વિશ્વની અનેકવિધ વિશેષજ્ઞતાઓ અને સંમુંઘકર સુંદરતાને નીરખવામાં મારાં ઘણાં વર્ષો વિત્યાં છે, ને ધારે ધીરે કરતાં હું સમજી છું કે રણની રેતીનાં મસૂશ આકારોમાં, જંગલોની હરિત-શ્યામ ગીયતામાં અને સાગરની કોઈ પણ કિનારે પહોંચતી છાલકમાં એટલી જ દેવી ઉપસ્થિતિ છે જેટલી કે આપણે હિમાલયનાં ઊંચાં શિખરો પર આરોપીએ છીએ. (પ્રાસ્તાવિક પૃ. ૫)

સૌંદર્યનું આ પ્રકારે આવાહન કરતાં કરતાં અહીં લેખિકાએ કરાવ્યું છે દક્ષિણ આહિકાનું દર્શન. દક્ષિણ આહિકા પ્રત્યે લેખિકાને અજાણતાં જ એક પ્રકારનો વિશિષ્ટ લગાવ થઈ ગયો છે, જેના મૂળમાં મહાત્મા ગાંધી પ્રત્યેનો તેમનો આદરભાવ પડેલો છે. તો સાથોસાથ આહિકામાં સ્થાપિત થયેલી ‘એપાર્થેઇડ’ની નીતિએ તેમનામાં જગતેવા વિષાદને કારણે આહિકન પ્રજા પ્રત્યે જાગેલી ને વિકસેલી સહાનુભૂતિ પણ તેમને દક્ષિણ આહિકા જવા પેરે છે. આ બંને સંદર્ભોની જોડાજોડ ઉપસ્થિતિ પ્રસ્તુત પુસ્તકમાં સાચાંત જોવા મળે છે.

એવાંનું કથાનક બે ભાગમાં વિસ્તર્યું છે. દક્ષિણ આહિકાનો પ્રવાસ બે વાર કરનારાં લેખિકાએ જોહાનિસર્બર્ગ, ડર્બન અને ડેપટાઉનની મુલાકાત બંને વખત લીધી છે. પણ બંને સમયની પ્રવૃત્તિઓ અને પર્યટનો જુદા પ્રકારનાં હોઈ, બંને સફરને લેખિકાએ વિભક્ત કરીને મૂકી છે.

૧૯૮૫માં થયેલી દક્ષિણ આહિકાની પ્રથમ સફરનું પહેલું કન્દ્ર રહ્યું છે જોહાનિસર્બર્ગ, એ પછી ટાન્જાન્યા,

‘દાર’ યાપુનું જુથ એવું ‘ઝાંઝીબાર’, કરારે, નાતાલ, ડર્બન, ડેપટાઉન. આ દરેક સ્થળની પ્રવૃત્તિ, એનો ઇતિહાસ, એની સંસ્કૃતિને લેખિકા આવેખતાં રહ્યાં છે.

સવા ચાર કરોડની દક્ષિણ આહિકાની વસતીમાં દસેક લાખ જેટલા ઇન્ડિયનો છે, બાકીની ‘કલડ’ કહેવાતી મિશ્ર પ્રજા છે. વર્ષો પછી એપાર્થેઇડનો અંત આવતાં સ્વતંત્ર થયેલી બ્લેક પ્રજાના અનેક પ્રશ્નો છે. ઉંદંડ બની ગયેલા બ્લેક લોકો હિંસક ને ગુનાખોર પણ બન્યા છે ને જાણે તેનો લાભ લઈને આહિકામાં પેસી ગયેલી ઇન્ડિયન પ્રજાએ પગાંડો જમાયો છે. આહિકન પ્રજા પ્રત્યેની સહાનુભૂતિના વિપક્ષે ત્યાં રહેતી ભારતીય પ્રજામાં વિકસતો ગયેલો માલિકીભાવ લેખિકાને સતત કઠતો રહ્યો જણાય છે. અનેક જગાએ એમણે આ પ્રકારનો વિષાદ વ્યક્ત કર્યો છે : આ બ્લેક લોકો પાસે ભણતર નથી, અભ્યાસ નથી. ઇન્ડિયનો પાસે છે – આવડત, ભણતર, હોશિયારી, મહેનત, ધગશ, મહત્વાકંશા બધું જ. ઇન્ડિયનોની વસતી આટલી ઓછી છે, પણ દરેક ક્ષેત્રમાં એ લોકો મોખરાના સ્થાને છે... (પૃ. ૮-૧૦) ઝાંઝીબારના લાંબા ઇતિહાસને નિરીક્ષતાં-આવેખતાં લેખિકાનો ત્યાંના ભારતીયો વિશેનો અભિપ્રાય પણ ઊંચો નથી. ઝાંઝીબારના ઇતિહાસમાં ઇન્ડિયનોનો સંદર્ભ આવે (મોટે ભાગે ગેરકાયદેસર) રેપારને માટે. એમના કશા પ્રદાનનો કોઈ ઉત્સેખ મેં જોયો નથી... ઇન્ડિયનો ક્રાંતિકોઈનાં બની શકતાં નથી. એ પૈસાપાત્ર બને છે. સ્નેહાદરને પ્રાપ્ત બની શકતાં નથી. (પૃ. ૭૮) ઇચ્ચાનીઓ જેમ ભારતીયો દૂધમાં સાકરની પેટે ભણી ન શક્યાનો લેખિકાનો વસવસો સતત વિષાદમાં પરિણમતો રહ્યો છે. લેખિકાને વિસ્મય એ વાતનું છે કે એક બાજુ ભારતીયો બ્લેક પ્રજાથી ભય પામે છે. દરેક જગને મળતી વખતે કાળી પ્રજા તરફથી થયેલા ડરામણા અનુભવોની ચર્ચા થતી જ રહે. ચોરી, લુંટ, ખૂનના અનુભવોને સાંભળીને સાંભળનાર જીવ બાળે તો પાછો

એમાં ઊલટો પ્રતિભાવ આપતું લોક 'શું સરસ જિંદગી છે અહીં અમારી અને ખૂબ નસીબદાર છીએ અમે' એમ કહી બેસે ! લેખિકાને લાગે છે કે 'ભય અને ભાગ્ય - નરસાં અને સારાં બંને પ્રકારનાં સંવેદનો અહીંના ઈન્ડિયન લોકોના મનમાં સતત, શાશ્વત અને સમાંતર વર્સે છે.' જે દેશમાં મહાત્મા ગાંધીએ સમસંવેદનશીલતા અભિવ્યક્ત કરીને તે સમયની ભારતીય અને પછીથી કાળી પ્રજાને પણ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે પ્રેરી-દોરી તે જ દેશમાં પછીથી મહાત્માનાં જ સંતાનો જુદી દાખિથી રહેવા પ્રેરાયાં એની સખેદ નોંધ, પારકા પોતાનાના ભેદભાવ ભૂલીને, પારદર્શી દાખિથી લેખિકા લઈ શક્યાં છે. અહીં તેમની ઈતિહાસકાર તરીકેની છાયા સ્પષ્ટ થાય છે.

દક્ષિણ આષ્ટિકાની સંસ્કૃતિનો રસપૂર્જ ચિત્તાર લેખિકાએ અહીં સંપડાવ્યો છે. જોહાનિસબર્ગનું વિશાળ ભ્યુલ્યુમ જ્યાં 'દક્ષિણ આષ્ટિકા જે બધું છે - દક્ષિણ આષ્ટિકા જે બધું હતું' - તેનું દર્શન કરાવે છે. ગાંધીજીની સહી સાથે યાઠપ કરાયેલો પત્ર, સ્ત્રી કલાકારની કલા જેવી અનેક મહત્વની વિગતો લેખિકાએ ઝીકાં નિરીક્ષણોથી આવેલી છે. કરારે શહેરનું સુઘડ કેન્દ્ર, પ્રિસ્ટી દેવળનું સ્થાપન્ય, આર્ટ ગેલેરીઓ, ચ્યાપુન્ગ શિલ્પોદ્યાનની કલાકૃતિ, પીટરમારિન્ટબર્ગનું સ્ટેશન જ્યાં ૧૮૮૭ના જૂનની સાતમી તારીખે ગાંધીજી ટ્રેનની બહાર ફેંકાયા હતા તેમાં તે તેમની સ્મૃતિમાં ઊભું થયેલું હાઈટ શિલ્પીએ બનાવેલું મહાત્માનું આદરણીય શિલ્પ્ય.

લેખિકાને દક્ષિણ આષ્ટિકા જવા માટે જોણે પ્રેર્યા તે ડર્બનનો ફિનિક્સ આશ્રમ, બંને વખતના પ્રવાસમાં આકર્ષણનું ને આરાધનાનું કેન્દ્ર બને છે. પણ પહેલી વાર ત્યાં જવું જોખમી જણાતાં ન જઈ શકાયું. પણ ડર્બનના સાંસ્કૃતિક પરિવેશને સાચવતી ઈમારત જોઈ શકાઈ.

બીજી વારના પ્રવાસમાં લેખિકા જેને યાત્રાધામ તરીકે ઓળખાવે છે તે મહાત્માજીના એમના સમયના નિવાસસ્થાન જેનો 'ફિનિક્સ સેટલમેન્ટ' તરીકે પુનર્જીન થયેલો તે જગાની યાત્રા થઈ શકી.

દક્ષિણ આષ્ટિકાના આ સર્વોદય આશ્રમની ઝીકાં-મોટી વિગતોનું વિસ્તારથી બયાન આપ્યા પછી અંજલિબદ્ધ

બનતાં લેખિકા નોંધે છે : 'જો મનસા, વાચા, કર્મશા માનવતાવાદી મૂલ્યોનું પાલન તે સાચો ધર્મ છે, તો એ ધર્મનું સેવન જ્યાં થતું રહ્યું હોય તે સ્થાન યાત્રા-ધામ છે...' (પૃ. ૨૬૧)

દક્ષિણ આષ્ટિકાના ઈતિહાસ ને સંસ્કૃતિનાં વિગતે થયેલાં વર્ઝનો પુસ્તકનો મોટો ભાગ રોકે છે. લેખિકાની આ સફર વિશેષતાઃ સાંસ્કૃતિક સફર છે એવું સાધ્યત અનુભવાય છે. પણ દક્ષિણ આષ્ટિકાની કુદરતનો તાણો પણ ત્યાંના સંસ્કૃતિદર્શનની સાથે વણાતો રહ્યો છે. જોહાનિસબર્ગની પાછા ફરતાં કોતરો જેવા પર્વતાકારોનું દર્શન કરતાં લેખિકામાં રહેલો સહદ્ય જાગ્રત બને છે. પહેલી જ વાર આવું જોયું - બધી સળો ને બધી તરાડો લીલ જેવી હતી. રસ્તો ઢાળ ચઢતો ગયો.... દૂર પર્વતો ને પાસે મસૂષ ઢોળાવોની અવિરત આવતી જતી પંક્તિઓ.... એકદમ અભ્યાસ ભૂમિપટ - જાણે નિસર્ગ ચાસ લેવા પણ માગતી નહોતી. એવાં જ ધાનામાનાં ઝીકાં ઝરણાં જતાં હતાં. એમના પોતાનાં ઝીકાં કોતરો બનાવતાં. (પૃ. ૧૧૧)

પ્રકૃતિદર્શનથી ઉદ્વિપ્ત થતાં લેખિકા અવારનવાર પર્યુત્સુક બની બેસે છે ! પી.ઇ.ના સાગરતટે રહેલાં લેખિકા ઉતારા પર બેસ્ટોને વાંચતાં વાંચતાં અનુભવે છે કે, એમ થાય કરે, કે દરિયો જોવાય એમ રહું. એ તો સંમોહક ને સંવાદી હતો જ, પણ માતરિથા ઉંડ હતો... ઉતારાના ધરની અંદર ગઈ પછી કશું અસાધ ના રહ્યું. દરિયો યાદ આવતો રહ્યો - તે જ. (પૃ. ૨૨૮)

કુગરનો નેશનલ પાર્ક, તેમાં વિહરતાં ગ્રાણીઓ. કુદરતનું નોખું દર્શન કરાવે છે તો ભ્યુમાલાન્ગ વિસ્તારમાં ઉગાડેલાં આયાસી વનો ધ્યાનાકર્ષક બને છે. વાણીમાંથી મનના કેમેરામાં કેદ થાય છે ટેકરીઓ પછી ટેકરીઓ, લીલા ઢોળાવોના ઢોળાવો, એકાદું ઝરણું, થોડાં બદામી રંગેલાં ધર ને સુંદરતાનું સતત સંયોજન. વાહનની ગતિ સાથે દશ્યો છૂટતાં - વિશૂટતાં જાય. વર્ષોથી જેમને યાદ કરીને ઝૂરતાં રહેલાં તે સહજ સુંદર વિરચનો નેત્રોને ઘડીઓનું સુખ આપી જાય. (પૃ. ૨૮૦)

બીજી વારનો, ૨૦૦૭ના વર્ષનો દક્ષિણ આષ્ટિકાનો લેખિકાનો પ્રવાસ સતત સંતર્પક બની રહ્યો છે. એમાં

**વિશેષત:** આફિકાની કવા, તેનો વન્ય પ્રદેશ, મહાત્માની તપોભૂમિનું દર્શનનું વિગતે નિરૂપણ થયું છે. પ્રથમ જંડમાં આફિકાનો મધ્યભાગ જિલાયો છે તો બીજા જંડમાં તેના કિનારે કિનારે થયેલા પ્રવાસનું આવેખન છે.

પ્રસ્તુત પ્રવાસપુસ્તકમાં પ્રમાણમાં એક પડખે રહી ગયેલા દેશ પ્રત્યેનું સંવેદન કેન્દ્રમાં હોઈ, વેઝિકાની વ્યક્તિગત સહનુભૂતિ તેમાં વિશેષપણે મુખર બનતી જણાય છે. એ દેશની સંસ્કૃતિ ને ઇતિહાસ જ્યાં ગાંધીજીએ મહત્વનો ભાગ ભજવ્યો છે તેનાં વર્ણનો ક્યાંય અતિ વિસ્તાર પામ્યાં છે. પણ આખાય એક અજાણ્યા દેશની રસ પડે તેવી અનેક જીવી વિગતો જડપથી ન જેડી શકાય એવા દુર્ગમ પ્રવાસને અહીં સૌ માટે સુગમ બનાવી શકવામાં સમર્થ નીવડી છે.

દક્ષિણ આફિકામાં જે ભારતીયો મજૂર તરીકે

પ્રવેશેલા તે જ ભારતીયોની ચોથી પેઢી આજે અહીં આખી દુનિયાને સર કરવા નીકળી પડી છે એવા વિભિન્ન વિરોધાભાસોનું આવેખન આફિકાના સાંપ્રત પ્રત્યે આપણને જુદી રીતે જગ્યાત કરવા પ્રેરે એ રીતે વેઝિકા આવેખે છે.

બ્લેક લોકોથી એક સમયે અસ્પૃશ્ય બનેલો આ પ્રદેશ વેઝિકાનાં એ દેશ પ્રત્યેનાં સંવેદન સાથે સહદ્યોને જોડે છે તેમનાં આ અંતિમ વિધાનથી : બોલતાં બોલતાં મોહું ભરાઈ જાય તેવા નામવાળો દેશ - દક્ષિણ આફિકા... કેટલો મોટો ને કેવો સુંદર. એની સાથે મારો પરિચય ઘનિષ્ઠ થઈ ગયેલો છે... અનેકવિધ અનુભવો દ્વારા સ્નેહનાં સૂક્ષ્મ સૂતરથી માંનું હદ્ય એની સાથે જોડાઈ ગયું છે. એને કારણે દુનિયામાં માંનું એક ઘર વધ્યું છે. ઘેર તો વારંવાર જવાનું જ હોય ને ? (પૃ. ૩૧૬)

## ગઝલ - શકીલ કાદરી

ખોદ્યો કુંગાર...

પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, ૨૦૦૫, તૃ. ૧૪૨, રૂ. ૭૫

હેમંત ધોરડા

સાહિત્યસ્વરૂપની ઓળખ લક્ષણો દ્વારા થાય છે. આ પુસ્તકના પહેલા અને બીજા પ્રકરણમાં ગઝલસ્વરૂપનાં લક્ષણો વિશે કશી ચર્ચા નથી. પાંચમા પ્રકરણમાં અંતર્ગત લક્ષણોના નામે અભિવ્યક્તિરીતિ, વિચાર-સૌદર્ય, સંગીતમયતા મુખ્ય ગણાયાં છે. આ સર્વ સારી કે નબળી ગઝલના ગુણ કે દોષને લગતાં તત્ત્વ છે, ગઝલસ્વરૂપનાં લક્ષણો નથી. કોઈપણ ગઝલમાં જ્યારે આંનું કોઈ ને કોઈ તત્ત્વ હોતું નથી ત્યારે તે ગઝલને આપણે સામાન્ય, 'નબળી' કહીએ છીએ. પરંતુ આથી આવી કૃતિની ઓળખ 'ગઝલ' તરીકે કરવામાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. છણ પ્રકરણમાં ગઝલના 'મિઝાજ'ની ચર્ચા છે. 'મિઝાજ' પણ ગઝલના ગુણદોષ-સંબંધિત તત્ત્વ છે, ગઝલનું સ્વરૂપ-લક્ષણ નથી. સાતમા પ્રકરણમાં ગઝલના રંગોનું વિભાગીકરણ છે જે ગઝલસ્વરૂપના લક્ષણ સંદર્ભે અસંગત છે. નવમા પ્રકરણમાં ઉર્દૂ કાવ્યપરંપરાનાં અન્ય સ્વરૂપો

દર્શાવ્યાં છે જેનું ગઝલસ્વરૂપની ચર્ચામાં કોઈ સ્થાન નથી. સરવાળે, પુસ્તકનાં એકસો ચોવીસ પાનાં પૈકી પચાસ પાનાં ગઝલસ્વરૂપની ચર્ચા સંબંધે અપ્રસ્તુત છે.

શકીલ કાદરીના શોધનિબંધનાં બે પ્રકરણ આ દસ પ્રકરણના પુસ્તકરૂપે પ્રગત થયાં છે. શોધનિબંધ ઈ. ૧૯૮૮રાનું રજૂ થયો. ગુજરાતીમાં ગઝલસ્વરૂપ વિશે અનાવશ્યક માહિતી અરે ટેરટેર છે. જેમકે ગઝલ શબ્દની ઉત્પત્તિ, અરબી છિદ્માં પ્રયોજાતા સંભ પ્રમાણે શેરના વિભાગ, ગઝલ અંગે દાયકાઓ જૂની ખોટી, અપૂર્ણ, અસંગત વ્યાખ્યાઓ, માન્યતાઓ, રૂબાઈ અંગે હજાર વર્ષ કરતાં વધારે જૂની અરબી કથા, મરસિયાનાં આઈ અંગ, વગેરે. ગઝલસ્વરૂપનાં લક્ષણો વિશે માહિતી છે તે પ્રાથમિક કક્ષાની છે. વીસમી સર્દીના દસમા દાયકામાં મતલા, શેર, મકતા, તખલ્ખુસ વગેરે શું એ કહેવાની આવશ્યકતા હોય નહીં. વળી અરબી ભાષાના ત્રણ ડાનથી વધુ અનાવશ્યક

સંદર્ભોની અતે ભરમાર છે. અરબી શબ્દ, અરબી કિયાપદ, અરબી વ્યુત્પત્તિ, અરબી અર્થ, અરબી કથા, અરબી આ અરબી તે, વગેરે. જાણે અરબી ભાષા જાણી એટલે ગજલ જાણી. અરબી ભરમાર ઉપરાંત કારસી પિંગળમાં કાકિયા વિશે આમ કહેવાયું છે, ઉદ્ધૃત મુશાયરામાં તેમ દાદ અપાય છે એવાય અડધો ડન અનાવશ્યક ઉલ્લેખ છે. વળી ગુજરાતી ભાષામાં મત્લા, શેર, મકતા શબ્દો રૂઢ થઈ ચૂક્યા છે. પણ અહીં આ શબ્દોની જોડણી મત્લા શેરાર, શેરાર, મફક્તા કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં રૂઢ થયેલા શબ્દો પરભાષા પ્રમાણે ઉચ્ચારય, લખાય તેમાં ગુજરાતી ભાષાની અવહેલના છે. આવી અવહેલનાનું વલણ અન્યત્ર પણ જોઈ શકાય છે. મરસિયા વિશે આખો સંદર્ભ કરબલાનો ઉલ્લેખ સાંકળતાં કાવ્યોનો છે. ગુજરાતી ભાષામાં લખાયલા ઈતર મરસિયા વિશે એક વાક્ય પણ નથી. આ જ પ્રમાણે તત્ત્વવુદ્ધ વિશે આખો સંદર્ભ સૂઝીવાદનો છે. ભારતીય દર્શનશાસ્ત્ર વિશે એક વાક્ય પણ નથી.

માહિતી એટલે જાણકારી નહીં. જાણકારી એટલે સમજણ નહીં. સહીઓ પૂર્વે પરભાષામાં ગજલ વિશે જે કહેવાયું છે તે, જેમનું તેમ, અહીં રજૂ કરવામાં આવ્યું છે, કશી તપાસ વિના, કોઈ પ્રશ્ન વિના, ગુજરાતી ભાષાની જેવના વિના, ગુજરાતી ગજલની ગણના વિના, વીસમી સંદીના સ્પર્શ વિના. ગુજરાતીમાં ગજલના છંદની ઓળખ કઈ? પરભાષાના છંદથી તે કઈ રીતે બિન્ન છે? તેનું વર્ગિકરણ કયા આધારે થઈ શકે? પરભાષાના છંદ ઉપરાંત અન્ય વર્ગના છંદમાં ગજલ કહી શકાય? લગાત્મક રૂપ ન ધરાવતા છંદમાં ગજલ કહી શકાય? બિન્ન વર્ગમાં લખાયેલી ગજલનું છંદ-પઢન શી રીતે થઈ શકે? કાકિયાની સ્થાપનામાં પરભાષાની વાદીની વિભાવના સ્વીકાર્ય છે? અકારાન્ત કાકિયા શા માટે ન પ્રયોજ શકાય? વિશુંખલતા ગજલને ઉપકારક છે? બોલચાલની ભાષા એટલે શું? ગજલસ્વરૂપ વિશે આ અને આવા અનેક મુદ્દા બાબતે આમાં કોઈ ઉત્તર નથી. ઉત્તર નથી કેમ કે અહીં કોઈ પ્રશ્ન નથી. અહીં દસ પૈકી એકથી સાત અને નવમા પ્રકરણમાં ગજલ વિશે પ્રાથમિક કક્ષાની માહિતી છે, તે ય પૂર્વે ઉપલબ્ધ થઈ ચૂકેલી અથવા

અનાવશ્યક. તદ્દુપરાંત, રુચિગત અભિપ્રાય છે, મુંગધ માન્યતા છે, ઉત્સાહભર્યા આસ્વાદ છે, આમની-તેમની વાતો છે. મૌલિક મુદ્દાને નામે મીઠું છે. પાનાં ભરવા માટે આટલી સામગ્રી પૂરતી છે. પરભાષા તરફથી આપણને ગજલસ્વરૂપ મળ્યું છે. મૂળભૂત માળખું અખંડ રાખી ગજલસ્વરૂપને આપણી સરાણે ચડાવીએ, ચડાવીને તપાસીએ, તપાસીને અપનાવીએ. વાત કરીએ તો માત્ર ગજલની નહીં, ગુજરાતી ગજલની વાત કરીએ.

દ્ધ કાકિયાના ઉદાહરણ તરીકે મત્લામાં ‘વિભાકર’ અને ‘ઠોકર’, શેરમાં અને મકતામાં અનુકુમે ‘સાકર’ અને ‘ચક્કર’ કાકિયા દર્શાવ્યા છે (જુઓ, પૃ. ૩૬-૩૭). આ ‘ભા’, ‘ઠી’, ‘સા’ તથા ‘ચક્ક’, અક્ષરો દ્વારા કાકિયાની સ્થાપના થતી નથી. આ સર્વે કાકિયાદોષ છે. મત્લામાં ‘બાવન’ અને ‘પાવન’ કાકિયા બાદ શેરમાં ‘વાહન’ કાકિયા દર્શાવ્યો છે (પૃ. ૧૧૩) એથી કાકિયાદોષ થાય છે. “‘લાયક’નો કાકિયા ‘નાટક’ કે ‘સાધક’ હોય તે જરૂરી નથી. એના સ્થાને ‘બકબક’ કાકિયા પણ હોઈ શકે છે” (પૃ. ૧૧૨-૧૧૩). “મત્લાના બંને મિસરામાં ‘સાધન’ ‘બાવન’ જેવા કાકિયા હોય ત્યારે ‘વનવન’ કાકિયા આવી શકે નહીં” (પૃ. ૧૧૩) સંયોગી અંગેનાં ઉભય વિધાન પરસ્પર વિરોધી છે. ‘લાયક’ સાથે ‘બકબક’, ‘ગંધક’, ‘દોઝભ’, ‘બેશક’ જેવા કાકિયા હોઈ શકે એવું વિધાન છે (પૃ. ૧૧૩). આ વિધાન ભૂલભર્યું છે. ‘દોઝભ’ કાકિયાદોષ છે. ‘ગુલાબ’ અને ‘આબ’ મત્લામાં કાકિયા તરીકે પ્રયોગ્ય તો ગુપ્તદોષ થાય છે એવું વિધાન છે કેમકે ‘ગુલાબ’ શબ્દ ‘ગુલ’ અને ‘આબ’ શબ્દોની સંબંધ દ્વારા રચાયો છે જેથી બન્ને મિસરામાં ‘આબ’ ‘આબ’ આવે છે (પૃ. ૧૩૦). ગુજરાતી ભાષામાં સંધિ દ્વારા રચાયેલા અક્ષરની સ્થાપના એક અક્ષર પ્રમાણે થાય છે. સંધિ બાદ ‘ગુલ’ના ‘લ’ની અને ‘આબ’ના ‘આ’ની બિન્ન ઉપસ્થિતિ રહેતી નથી અને એક અક્ષર ‘લા’ ઉપસ્થિત થાય છે. આથી ગુજરાતી ગજલમાં મત્લામાં ‘ગુલાબ’ અને ‘આબ’ કાકિયા પ્રયોગ્ય તો તે કાકિયાદોષ નથી. અન્યત્ર ‘સળગાવી’ અને ‘પલટાવી’ શબ્દો કાકિયા તરીકે ન પ્રયોજ શકાય એવું વિધાન છે (પૃ. ૧૧૧). આ વિધાન

ભૂલભર્યું છે. ઉર્દૂમાં ‘વી’ લખવું હોય તો ‘વ’ અને ‘ઈ’ બન્ને અક્ષર મિન્ન રહે છે. આથી તેમાંથી ‘ઈ’ બાદ કરી શકાય છે. ગુજરાતી ભાષામાં ‘વ’ અને ‘ઈ’ની સંધિ બાદ ઉભય અક્ષરની મિન્ન ઉપસ્થિતિ રહેતી નથી અને એક અક્ષર ‘વી’ ઉપસ્થિત થાય છે જેમાંથી ‘ઈ’ બાદ કરી શકતો નથી. આ કારણસર ગુજરાતી ભાષામાં ‘સળગાવી’ અને ‘પલટાવી’ શબ્દો કાફિયા તરીકે પ્રયોજી શકાય છે. મત્તામાં ‘બાલી’ અને ‘લાલી’ કાફિયા હોય તો ગજલમાં વાદી દીર્ઘ ‘ઈ’ સમજવામાં આવશે એવું વિધાન છે (પૃ. ૧૩૦). આ વિધાન ભૂલભર્યું છે. ગુજરાતી ભાષામાં મત્તામાં ‘બાલી’ અને ‘લાલી’ કાફિયા હોય તો વાદી ‘લી’ સ્થપાશે, દીર્ઘ ‘ઈ’ નથી. શકીલ કાદરીએ અરબી ચશ્મા ચડાવીને ગુજરાતી ભાષા વાંચી છે.

તદ્વપરાંત અહીં ‘મત્તાનો શેર’, ‘મક્તાનો શેર’ શબ્દો પ્રયોજીયા છે (પૃ. ૩૧-૩૪). મત્તા, શેર, મક્તાનાં લક્ષણ તપાસીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે આ સર્વે રચના એકમેકથી મિન્ન સ્વરૂપની છે. આથી ‘મત્તાનો શેર’, ‘મક્તાનો શેર’ કહેવું એ ભૂલભર્યું છે. વળી છંદહેર રૂબાઈનું અનન્ય લક્ષણ છે. અર્થાત്, એક રૂબાઈમાં રૂબાઈના એકાવિક છંદ પ્રયોજી શકાય છે. આ લક્ષણ વિશે અહીં કશો ઉલ્લેખ નથી. વળી, ‘ગજલમાં રદીફ્ફાની ન હોય તો પણ ચાલી શકે, પરંતુ કાફિયા હોવા અનિવાર્ય છે’ એવું વિધાન પણ છે (પૃ. ૩૫).

ગૈરમુરદ્દફ (રદીફ વિનાની) ગજલનો ઉલ્લેખ ડેક્ટેકાણો થયો છે. આપણે તપાસાંતું જોઈએ કે રદીફ વિનાની ગજલ હોઈ શકે ખરી ? ગજલમાં કાફિયા અને રદીફ તરીકે મિન્ન શબ્દ પ્રયોજીયા હોય તો રદીફની તપાસનો પ્રશ્ન ઊભો થતો નથી. જેમકે મત્તાની એક પંક્તિમાં અંતે “જખમ છે” અને બીજી પંક્તિમાં અંતે “મલમ છે” શબ્દો હોય તો “જખમ” અને “મલમ” શબ્દોની ઓળખ કાફિયા તરીકે અને ‘છે’ શબ્દની ઓળખ રદીફ તરીકે થઈ શકે છે. પ્રશ્ન રહે છે એવી ગજલનો જેમાં કાફિયા પ્રયોજીયા હોય અને રદીફ તરીકે મિન્ન અક્ષર કે શબ્દ ન પ્રયોજીયો હોય. રદીફના સંદર્ભમાં કાફિયાનાં લક્ષણ તપાસીએ તો આ પ્રશ્નનો ઉત્તર મળી રહે છે :

ક્યાંકથી કૂટી તિમિરમાં રોશની

આગિયાએ આત્મ-પૂજા આદરી

- શૂન્ય પાલનપુરી (શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૧)

<sup>1</sup>

આંગણું જોયા વગર પણ નાચશું  
રચવા મળશે તો બેશક રચશું  
જેમ આવ્યા એમ સૌંસરવા જશું  
રોકશે મારગ બિચારા કાચ શું

- અમૃત ઘાયલ (આઠે જામ ખુમારી, પૃ. ૬૭૨)

રદીફ તેમ કાફિયા પણ સમવંજની કે સમસ્તવરી હોઈ શકે. અહીં “રોશની” અને “આદરી” શબ્દો કાફિયા હોવા ઉપરાંત સાથોસાથ રદીફ પણ છે, અંતે દીર્ઘ ‘ઈ’ કારાંત ધરાવતા સમસ્તવરી રદીફ. “નાચશું” અને “રચશું” શબ્દો કાફિયા હોવા ઉપરાંત સાથોસાથ રદીફ પણ છે, અંતે ‘શું’ અક્ષર ધરાવતા સમવંજની રદીફ. આ ‘શું’ શબ્દના ભાગરૂપે પણ હોઈ શકે, ને આવશ્યકતાનુસાર એને મિન્ન પણ પ્રયોજી શકાય. જેમકે ‘નાચશું’ – ‘રચશું’ છે એની સામે ‘જશું’ – ‘કાચ શું’ પણ પ્રયોજીયા છે. આમ કાફિયામાં પણ, રદીફ તરીકે સ્વતંત્ર શબ્દ / પદ ન પ્રયોજીયાં હોય ત્યારે સર્વત્ર રદીફનો સમાવેશ થયેલો હોય છે. કેમકે કાફિયા અને રદીફ તરીકે પ્રયોજીયેલા શબ્દો પર કાફિયા અને રદીફના અક્ષર પ્રાધાન્ય ભોગાવે છે. આથી કાફિયા અને રદીફ મિન્ન શબ્દો તરીકે પ્રયોજીય એવી અનિવાર્યતા રહેતી નથી. અર્થાત્, મિન્ન રદીફની અનુપસ્થિતિમાં, કાફિયા સ્વયમ્ભ રદીફ તરીકે પણ સ્થપાય છે. આવી ગજલને આપણે હમકાફિયા હમરદીફ ગજલ અથવા હમકાફિયા-રદીફ ગજલ કહીએ છીએ. ગુજરાતીમાં આને સહકાફિયા-રદીફ ગજલ કહી શકાય. આમ કોઈ ગજલ રદીફ વિનાની ન હોઈ શકે. પરભાષામાં જે કહેવાયું હોય તે ભવે કહેવાયું હોય, આપણી સરાણે તપાસીએ તો જોઈ શકીએ છીએ કે ગૈરમુરદ્દફ સંશો અર્થહીન છે.

જાર રાંદેરી કૃત ‘શાયરી ભાગ ૧-૨’ ઈ. ૧૯૭૬માં પ્રકાશિત થયું હતું. શકીલ કાદરી કૃત ‘ગજલ’ પર એની અસર જુઓ -

૧. શકીલ કાદરીકૃત ‘ગજલ’ પુસ્તકમાં કાફિયાના નવ અક્ષરો વિશે ચર્ચા છે (૧૧૧-૧૨૧)

- આર રાંદેરી કૃત ‘શાયરી’માં આ બાબતે ચર્ચા એ જ પર્યાયવાચી શબ્દો સાથે એ જ કમમાં છે (પૃ. ૫૧-૬૨)
૨. અતે સાત પ્રકારના કાફિયા નોંધ્યા છે (પૃ. ૧૨૩-૧૨૪).
  - આ સાત પ્રકારના કાફિયા એ જ પર્યાયવાચી શબ્દો સાથે, એ જ કમમાં ‘શાયરી’માં છે (પૃ. ૬૨-૬૪)
  ૩. અતે કાફિયાના સ્પષ્ટ દોષના ઉદાહરણાર્થે બે મતલા અને એક શેર ટંક્યાં છે (પૃ. ૧૨૭)
  - ‘શાયરી’માં આ દોષના સંદર્ભમાં આ જ રચનાઓ છે (પૃ. ૬૫-૬૬).
  ૪. અતે કાફિયાના ગુપ્તદોષના ઉદાહરણાર્થે ‘ગુલાબ’ અને ‘આબ’ તથા ‘બાલી’ અને ‘લાલી’ કાફિયા ટંક્યા છે (પૃ. ૧૩૦).
  - ‘શાયરી’માં આ દોષના સંદર્ભમાં આ જ રચનાઓ છે ! (પૃ. ૬૬-૬૭)
  ૫. અતે ‘આ તકે એક શંકા ઉત્પન્ન થાય છે’ શબ્દોથી શરૂ થતો અને ‘કાનૂન મુજબ વર્તતા નથી’ શબ્દોથી પૂરો થતો દસ પંક્તિનો ફકરો છે (પૃ. ૧૩૦)
  - આ આખો ફકરો, અક્ષરશ: ‘શાયરી’માં છે (પૃ. ૬૭).
  ૬. અતે ઉર્દૂ કાવ્યપરંપરાનાં અન્ય કાવ્યસ્વરૂપો દર્શાવ્યાં છે (પૃ. ૭૮-૮૭).
  - આ સર્વે કાવ્યસ્વરૂપોનું વિવરણ ‘શાયરી’માં છે (પૃ. ૭૨-૭૮).
- અમૃત ઘાયલના ગજલસંગ્રહ ‘શૂળ અને શમણાં’ (ઈ. ૧૮૫૪)ની પ્રસ્તાવના મકરન્દ દવેએ લખી છે. શકીલ કાદરીએ દર્શાવેલાં ગજલનાં ત્રણે અંતરંગ લક્ષણો (તત્ત્વો)

આ પ્રસ્તાવનામાં સંવિગત મળે છે. આ સર્વે બાબતે શકીલ કાદરીનું પ્રદાન શું ? શકીલ કાદરી લખે છે ‘આર રાંદેરીએ કરેલી અછિડતી ચર્ચા સિવાય અત્યાર સુધીમાં કોઈ વિદ્ધાને કાફિયાશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો નથી’ (પૃ. ૧૦૭). આ અછિડતી ચર્ચા ?

‘ગાલિબે પણ અલગ અલગ રીતે કાફિયા પ્રયોજ્યા છે. એમની સફળતાનો અડધો આધાર તો એના પર જ રહેલો છે’ (પા. ૩૭-૩૮). ગાલિબની સફળતાનો અડધો આધાર કાફિયાના પ્રયોજન પર ? ‘આજના યુગમાં સારી કવિતા એ જ ગણાય છે જે તરત જ સમજાય’ (પા. ૭૬). એટલે કે કવિતા ધીથી લચપચતા શીરા જેવી હોવી જોઈએ જે તરત જ ગળે ઉત્તરી જાય. “છેંદ વિનાની કવિતા ભાવકને આકર્ષી શકતી નથી” (પૃ. ૪૮). આ વિધાન પર લાભશાંકર ઠાકર, સિતાંશુ યશશંક, દિલીપ જેવેરી હસે કે રે ? અહીં આવાં અન્ય વિધાનો પણ છે. આવાં વિધાનો કરવાની હિંમત દેવહૂતો ન કરે. ‘ગજલના આ વિવિધ એકમો (શેરો)નો અલગ અલગ ‘મિઝાજ’ હોવા છતાં આખી ગજલનો એક ‘મૂડ’ હોય છે, એક ‘મિઝાજ’ હોય છે’ (પૃ. ૨૮). એટલે કે અલગ અલગ ‘મિઝાજ’ છતાં એક ‘મિઝાજ’. ‘રૂબાઈના પ્રથમ દ્વિતીય અને ચોથા મિસરામાં કાફિયા-રદીફ અનિવાર્ય ગણાયા છે. રદીફ ન હોય તો પણ કાફિયા તો હોવા જ જોઈએ’ (પા. ૭૮-૭૯). એટલે કે રદીફ અનિવાર્ય હોય અને ન પણ હોય. આવાં વિધાનો દ્વારા ગજલ-વિવેચનામાં અદ્વૈતવાદનો પ્રવેશ થાય છે. શકીલ કાદરીની ગજલ-વિવેચનાનું આ આગવું લક્ષણ છે.

આ પુસ્તક ઈ. ૨૦૦૫માં પ્રગટ થયું; ઈ. ૧૯૦૫માં પ્રગટ થયું હોત તો નોંધપાત્ર ગણી શકાયું હોત.

## અવલોકનો

બ્રોમબલ બુશ - પ્રકુલ્પ દેસાઈ

સાહિત્ય સંગમ, સુરત, ૨૦૦૬ કા. ૩. ૭૦

વચસાયે તથીબ એવા ડૉ. પ્રકુલ્પ દેસાઈના પ્રથમ વાર્તાસંગ્રહ ‘બ્રોમબલ બુશ’ની અઠાર વાર્તાઓમાંથી તેરની કથાવસ્તુ મુખ્યત્વે સ્ત્રી-પુરુષના સંબંધોની સંકુલ વાસ્તવિકતાને જ ચીતરે છે. વયના વળાંકે પહોંચતાં આ વાર્તામાંનાં પાત્રો માનવસહજ વિજ્ઞાય આકર્ષણ અનુભવે; એમાંનું કેટલુંક માત્ર આંઝોશી સંતોષાય, કેટલુંક ભાષ્ણિક સ્તરે ભોગવાતું લાગે, કોઈકમાં તે શારીરિક સંતોષ સુધી વિકસે તો ક્યાંક બળાત્કારે લુંટાતું કે મજબૂરીએ વેચાતું / ખરીદાતું નિરૂપાય. જ્યાં આ આકર્ષણ કેટલીક વિશેષતા ને વિશિષ્ટતા સાથે, ભાષાકર્મની લાક્ષ્ણિક નિરૂપણરીતિના ઊજણા પરિણામ રૂપે આવેખાયું છે ત્યાં સર્જકની વિષય-વસ્તુની રજૂઆત અને ભાષ્ણિક અભિવ્યક્તિની વિવિધ તરાહો ઉપરાંત, કથનપ્રયુક્તિનો સમુચ્ચિત વિનિયોગ કરવાની કલાસૂજુનો પરિચય કરવાનારું નીવડે છે.

‘માલધક્કો’માં આવેખાયેલું રેલવે વાર્ડનું જીવંત વાતાવરણ કથાપ્રવાહમાં એકરૂપ બની ગયું છે. સ્થળવિશાખને નીલાના જીવનની ગતિ-વિવિના સાક્ષીરૂપે આવેખતા લેખકે માલધક્કાની યાંત્રિકતા જેવી જ નીલાના જીવનની કરુણતાને પ્રતીકાત્મક રીતે નીરુપી છે. નીલાના પાત્ર દ્વારા આવેખાતો આશાસ્પદ પરિણીતાનાં અરમાનોનો કરુણ અંજામ સમાજની વરતી વાસ્તવિકતારૂપ રૂઢ રીતિ-રિવાજોના પરિણામ રૂપે કલાત્મક ઢબે આવેખાયો છે. તો, ‘વિશાલમ્ભનો ફૂલો’નું કરુણગર્ભ કથાનક ઘટનાની વ્યંજકતાને પ્રગટાવી પ્રતીકાત્મક પરિવેશ દ્વારા પાત્રના મનોગતને ખોલી આપે છે.

‘વહેલી સવારનું ઝકળ’માં યૌવનના ઉગમકાળની ક્ષણે થતા નિર્દોષ વિજ્ઞાય આકર્ષણનું અસરકારક આવેખન થયું છે. નાયિકા ‘પરથી’ સાથે જ વહેરીનો થતો સમાંતર ઉલ્લેખ સૂચક છે. જ્યારે ‘બ્રોમબલ બુશ’માં આ આકર્ષણ શરીરસંબંધો સુધી વિસ્તરે છે. એક જ સમયે

દેશ-વિદેશના બે જુદાં જુદાં સ્થળે, બે જુદાં જુદાં પાત્રોના જતીય આવેગોને સમાંતરે જ આવેખતા લેખકે, યોગ્ય પ્રિયતમના કે પિતાના પ્રેમથી વંચિત યુવતીઓની ઝંખના વેગ અને તીવ્રતાથી દર્શાવી છે.

વૃદ્ધોની વેદનાને આવેખતી બે વાર્તાઓ – ‘પિંજરું’ અને ‘અકલંધ ?’ – માંની પ્રથમ ચીલાચાલુ કથાનક ને સ્પષ્ટ સંવાદોને કારણે ખાસ ધ્યાન ખેંચતી નથી, પણ બીજમાં અનેક આશા-અરમાનોથી ઊભું કરેલું ઘર પોતાના જ સ્વજનોના દૂર જવાને કારણે તૂટું અનુભવતા વૃદ્ધ રમણલાલના ચિત્તભામની સ્થિતિ અસરકારક રીતે દિલાઈ છે.

‘કાંટો’માં નાની વયે પુરુષની શરીરભૂખનો ભોગ બનેલી ભવીના કિશોરમનમાં ઘર કરી ચૂકેલા પુરુષના વરવા રૂપની વિકૃત છાપ કાંટાની માફક ખૂંચતી દર્શાવતા લેખકે તેની વિરુદ્ધે તેની જ ગાઢ સખી સવિતાની શરીર-ભૂખની તીવ્રતાને બેહદપણે આવેખી છે. તો, ‘વિનિયાની ઉ તો વઉ’માં પુષ્ટ એવી કુશલીનું કિશોર વયના વિનિયા પ્રતિનું સહજકર્ષણ લાક્ષ્ણિક ઢબે, સ્થાનિક બોલીના તમામ લય-લહેકા સહિત આવેખાયું છે. ‘કૈતુક’ માત્ર કૈતુક બનીને રહી જતી, પરામનોવાસ્તવવાઈ વાર્તા છે. તો, ‘કંપ’ શોષિત મહિલાની વેદનાને ઘરતીકંપમાં દટાયેલી પીડિત વ્યક્તિના પ્રતીકાત્મક આવેખન દ્વારા અધ્યાહાર રહીને પણ સૂચક રીતે પ્રગટાવી આપે છે.

પ્રારંભે ઉલ્લેખેલી પાંચ વાર્તાઓને સંગ્રહની ઉત્તમ વાર્તાઓમાં મૂકી શકાય. તો પછીની ચારને બીજા કમે મૂકી શકો. બાકીની વાર્તાઓમાં સર્જકતા ઝંખીપાંખી જણાય છે.

પ્રકુલ્પ દેસાઈની વાર્તાઓમાં આવતો આસપાસનો પરિવેશ જ્યાં રચનાવિશેષરૂપે આવેખાયો છે ત્યાં કલા સ્ક્રિબ થતી અનુભવાય છે. એમાં આવેખાયેલું સૌંકેતિક પરિવેશનિર્માણ પરિસ્થિતિનું દશ્યાત્મક નિરૂપણ કરી, પાત્રના મનોગતને ખોલી આપે છે. તો, તળપદ બોલીનાં વેવિધ અને લઢણો એમની વાર્તાનું બીજું આકર્ષક અંગ છે.

પાત્રનિરૂપણમાં લેખકને આદર્શનું વળગણ નથી..

પાત્રોને યથાતથ આવેખતા લેખક માનવ-સ્વભાવની ખામીઓ ને ખૂબીઓને તાદ્દશ કરી આપે છે. પાત્રોના શારીરિક આવેગની સહજતાને લેખક વક્તા અને પરાકર્ષણ સમેત આવેખે છે. સામાજિક નૈતિકતાના પ્રશ્નનો અહીં છેદ ઉડી જાય છે.

ઘણી વાર્તાઓ અહીં કહેવતી નથી, સૂચવાય છે. પ્રસંગોનું સીધું જ બયાન નહીં, છૂટક-નૃટક સૂચનાત્મક આવેખન દ્વારા બધું જ સ્પષ્ટ ન કહી દેવાનું વાર્તાકવાનું લક્ષણ ત્યાં મૂર્ત થયું છે. જોકે, ક્યાંક આવી અટપી રચનારીતિ વાર્તાની થોડી વધુ પેચીદી બનાવે છે. ખાસ તો, ‘મહાબિનિઝમણ’, ‘કૌતુક’, ‘કુપ’માં સામાન્ય વાચકને પ્રત્યાયનની સમસ્યા ઊભી થાય. અલબત્ત, સરલીકરણની સમસ્યા ‘વાર્તા’ માટે ગૌણ પ્રશ્ન છે. સવાલ એ છે કે વસ્તુનું વાર્તામાં રૂપાંતરણ કરવામાં સર્જક-પુરુષાર્થ કેટલો ખપમાં લાગ્યો છે. અહીં આવો સર્જક-પુરુષાર્થ પ્રારંભે ઉત્સેધે પાંચેક વાર્તાઓમાં જરૂર દેખાય – એ જોતાં ભવિષ્યમાં આ સર્જક પાસેથી હજુ વધુ સર્ફણ વાર્તાઓ મળવાની અપેક્ષા જરૂર રહે.

— ગુજરાતી વાયસ

r

### માતૃ-પ્રદક્ષિણા – સંપા. દીપક મહેતા

ઇમેજ પબ્લિકેશન, મુંબઈ-અમદાવાદ, ૨૦૦૪ રી. ૧૯૮, રી. ૧૨૦

વિવિધ ક્ષેત્રોમાં જ્યાત વ્યક્તિઓએ પોતાની માતાને ભાવપૂર્વક યાદ કરતાં લખેલા લેખો ‘માતૃવંદના’ શીર્ષક ડેઢળ ઈ. ૧૯૮ તોં ૧૯૯૭ દરમાન પાંચ ભાગમાં પ્રગટ થયા હતા. દીપક મહેતાએ એમાંથી ઉ૧ લેખો પસંદ કરીને ‘માતૃપ્રદક્ષિણા’ શીર્ષક ડેઢળ સંકલિત કર્યા છે. આ પુસ્તકમાં માતા વિશે લખાયેલાં સ્વતંત્ર લખાણો તેમજ અન્ય લખાણોમાંથી લીધેલા અંશો – એમ બંને પ્રકારના લેખો છે.

સ્વરૂપની દસ્તિએ વિચાર કરીએ તો રેખાચિત્ર, સંસ્મરણો અને નિબંધો – એ ત્રણે સ્વરૂપમાં આ લેખો મળે છે. અચિની ભક્તનો લેખ ‘મા, મારી મા’ સંસ્મરણોરૂપે, ઉમાશંકર જોશીનો ‘આ’ રેખાચિત્ર સ્વરૂપે અને સુરેશ દલાલનો લેખ ‘માતાનું ઋણ’ નિબંધ સ્વરૂપે રજૂ થાય છે.

તો ચંદ્રકાન્ત શાહનો લેખ, ‘મારી કેટલી બધી માઓ’ (એમની જ શૈલીમાં કહું તો –) એમના જીવનમાં માના રિપેસમેન્ટ આર્ટિસ્ટ તરીકે રોલ ભજવનાર કલાકારોનો એક રેપિડ ફિસ્ટ રિવ્યુ છે. ‘તો હું લાડુ જ બોટું...’માં, માતૃપ્રેમની અભળખામાં બાળપણ અને ડિશોરાવસ્થાને ધખાવનાર જોસેફ મેકવાનના આકરા ને આકળા બાળપણનું દેરું નિરૂપણ છે. ‘દીવામાના ઓરતા આવશે’ (નીરવ પટેલ)માં ભૂતકાળની ભૂલોના ઊંડા પશ્ચાત્તાપનો સૂર તીવ્રતર બન્યો છે. નિપાતો ને કેવળપ્રયોગીઓના જવલ્યે જ ઉપયોગવાળો, સીધી-સાદી, જરણ ભાષા, ટૂકાં-વિધાનવાક્યોમાં લખાયેલો અને મધુ રાયનું નામ પડતાં જ કંઈક વિશિષ્ટ મળશે-ની ધારણાને સાચી ઠેરવતો – ‘બાનું નામ વીજ્યાબેન છે’ નિબંધ એની ભાષા શૈલી, ઉચ્ચારોને અનુસરતી લિપિ-જોડણી-વાક્યરચનાને કારણે વિશિષ્ટ બન્યો છે. એમાં સહજતા, સ્વાભાવિકતા છે; લાગણીવશતા કે વિવશતા નથી.

આ લેખોમાં તત્કાલીન સમાજનું ચિત્ર આવું રચાય છે – પુરુષપ્રધાન સમાજ, સંયુક્ત કુટુંબની પ્રથા. ઘરમાં સાસુ, નણંદનું વર્ચસ્વ ખરું જ, વળી ભાઈબહેનો વચ્ચે મોટે ભાગે સુમેળ કવચિત્ ખટરાગ, બહોળો કુટુંબ-કબીલો, વરતાર, કારભાર, સ્ત્રીઓનું ભણતર નહિયત્. તરલા મહેતા ‘મારી બા’માં નોંધે છે કે એમનાં બાને એમના સસરાજીએ ભણાવેલાં – એ પણ પૂરેપૂરો પડદો પાળીને. સ્ત્રીઓ આપબણે વાંચતાં-લખતાં શીખેલી. પ્રભાતિયાં, શ્વોકો, સ્તોત્રો, ગીતા, લોકગીતો, જોડકણાં વગેરે કંદસ્થ રહેતાં. હિસાબોમાં પણ સૂજ અને ચોકસાઈ રહેતાં. નાની વધ્યમાં લગ્ન, આણાં અને ઘરસંસાર શરૂ થઈ જતો. મહેમાનોની. અવરજવર વધુ રહેતી અને આગતાસ્વાગતામાં પણ મણા ન રહેતી. સ્ત્રીઓ ધાર્મિક હતી. નાત-જાતના જડ વાડાઓમાંથી બહાર નીકળેલી અથવા નીકળવાનો પ્રયત્ન કરતી હતી. ઘરનાં દરેક સભ્ય, નોકરચાકર કે ઠોરઢાંખર સુધ્યાંની પૂરતી દરકાર લેતી. સંયુક્ત કુટુંબના કારભારમાંથી બગેલો સમય બાળકો પાછળ ખર્યાતી. તક મળે અને સમય મળે ત્યારે નહું નહું શીખવાની ધગશવાળી, પ્રગતિની જેવના સેવનારી હતી. નિઃસ્વાર્થ, પ્રામાણિક, સંસ્કારી, ઉદ્ઘમી એવી આ સ્ત્રીઓએ સામાજિક, આર્થિક કે શારીરિક મુશ્કેલીઓના સમયે

ખુમારીથી ઘરને ટકાવ્યું છે તથા હિંમત અને હોશ પૂરાં  
પાડવ્યાં છે. પતિ કે સંતાનો તરફથી મળતાં અન્યાય કે  
અપમાનોને સહન કર્યા છે. કોઠાસૂર, સમજશ, દહાપણ,  
જીવન તરફનો હકારાત્મક દાખિકોણ એમના જીવનને  
ઉંનત બનાવે છે.

તરલા મહેતા, પન્ના નાયક, મધુ રાય, તારક મહેતા, ચંદ્રકાન્ત શાહ અને ક્ષેમુ ટિવેટિયાના લેખોમાં સુધરેલો, સમૃદ્ધ એવો સમાજ પ્રતિબંધિત થાય છે જેમાં સ્ત્રીઓ કુટુંબમાં સારી મોકળાશ અને માનમરતબો મેળવતી.

વિશ્વયુદ્ધ, અંગ્રેજ અમલ, અસહકારની ચળવળ,  
અંદોલનો, સ્વાતંત્ર્યનો તબક્કો, રમભાડો, દુકાણ,  
મહામારી, રોગચાળો જેવી ઐતિહાસિક અને સામાજિક  
ઘટનાઓ પણ નિરૂપાઈ છે. વનમાળા દેસાઈના લેખ  
“પારસમણિના સ્પર્શ”માં ગાંધી આશ્રમની પ્રવૃત્તિઓ વિગતે  
રજૂ થઈ છે.

આ દરેક લેખમાં છિલાયેલી માતા અલગ હોવા છતાંય અલગ નથી. આ બધાં જ માતૃચરિત્રોમાંથી એક જ પ્રમુખ સંસ્કારને તારવી આપવો હોય તો એ છે - ‘ભાતર થઈ જવાની વૃત્તિ.’ ઘર, પતિ, સંતાનો, સગાં, વહલાં, પડોશી, મિત્રો, નોકર, અજાણ્યા દરેકને માટે આ સ્ત્રીઓએ જતને ખરચી નાંખી છે. જવાબદારીઓ હસતા મોઢે બણબણાટ, ચણચણાટ વગર ઉપાડી છે અને નિભાવી છે. આ એક યુગ હેવ પૂરો થાય છે. નવો યુગ આવી રહ્યો છે, જેનાં ઈણિતો સુરેશ દલાલે આપ્યો છે. સમાજ બદલાયો છે. સ્ત્રીઓ ભણી-ગળીને આગળ આવી છે. પોતાના અસ્તિત્વને માટે સજાગ, સભાન બની છે. દિવસ આખાની તનતોડ મહેનત પછી પહેલાંની સ્ત્રીઓ ‘આભાર’નો એક શબ્દ પામતી ન હતી. આજે થોડક કલાકની નોકરીની સામે સ્વમાનથી જીવી શકાય એવું વેતન એ મેળવે છે. મૂલ્યો, જીવન-તરાહો, સંસ્કારિતાના માપડો બદલાયાં છે. મા-બાપ અને સંતાનો વર્યોના સંબંધોના તાણાવણાની ભાત જુદી વણાય છે. આજના સમયને એની જરૂરિયાતો, સિદ્ધાંતો, ધોરણો, અપેક્ષાઓ વગેરે જુદાં હશે પણ સંવેદનાના તાર જો કથળી ગયા તો નિષ્ઠાણ અને શુષ્ક સંબંધોનો ભાર સમાજને છિન્નવિચિછિન કરી નાખશે.

‘માતૃ-પ્રદક્ષિણા’ નિમિતે માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક વધુ મોકો દીપકભાઈએ મેળવી લીધો છે. આ પુસ્તકમાં લેખ પણ પૂર્તિ રૂપે મુકાયેલી માતૃવિષયક

કાયુકૃતિઓ પણ એટલી જ આસવાદ બને છે. બે-ત્રાણ લેખને બાદ કરતાં મોટા ભાગના લેખોમાં કરુણારસ ઘૂંઠાયો છે. ક્યાંક માતાને ખુશ કરી શક્યાનો સંનોષ છે, ક્યાંક માની દરકાર નહીં કર્યાનો કચવાટ છે, ક્યાંક માને અન્યાય કર્યાનો વલવલાટ છે, તો ક્યાંક ઉત્તરો ઠાલવીને જાલી થયાની હળવાશનો હાશકારો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભક્તનાં અને સ્થિતપ્રદૂષનાં લક્ષણો વર્ણવ્યાં છે : ઊંડુંડુંડુંડું કુદુરુંકુદુરુંકુદુરું એનુંદુરુંનુંદુરું કુદુરુંનુંદુરુંનું ગદુરુંગદુરુંગદુરું અંજુનાદુરુંઅંજુનાદુરું... આવી માણીઓનુંદુરુંગાયા અર્થમાં તર્પણ કર્યું છે, અંજલિ આપી છે.

- ઉર્ફી તેવાર

r

બાળઉલેરમાં બાળસાહિત્યનું સ્થાન - ઈશ્વર પરમાર  
પ્રવીષ પ્રકાશન, રાજકોટ, ૨૦૦૫. ૩. ૫૬, પ. ૩૫

ઈંદ્ર પરમાર ઉત્ત્યાશિક્ષણ ક્ષેત્રે બી.એડ.ની વિદ્યાશાખામાં વર્ષોથી સક્રિય છે. આ પુસ્તક એમણે દ્વારકા મુકામે ગુજરાતી સાહિત્ય પરિષ્ઠ અને શારદાપીઠ કોલેજ (દ્વારકા)ના સંયુક્ત ઉપકરે યોજાયેલ બાલકિશોર સાહિત્ય વ્યાખ્યાનમાળા-અંતર્ગત આપેલ વ્યાખ્યાનની પુસ્તકારૂપ આવત્તિ છે.

કુટુંબ અને સમાજમાં બાળકોનું મહત્વ સમજાવી  
બાળકોના સર્વાંગી વિકાસ ઉપર એમણે ભાર મૂક્યો છે.  
શારીરિક, માનસિક, ભાવાત્મક, સામૃદ્ધિક અને નૈતિક :  
આ પાંચ મુખ્ય પાસાંને પાંચ ખંડમાં વિભાજિત કરી  
બાળાનુષ્ઠેર માટે ઉપકારક બાલસાહિત્યની ઉદાહરણો સાથે  
ચર્ચા કરી છે. જોડકણાં, વાર્તા, ગોતો જેવા વિવિધ રૂપ બાળ-  
સાહિત્યની બાળક પર શી અસર પડશે, તેમાંથી એ શું  
શીખશે અથવા કઈ રીતે આ સાહિત્ય અને માટે  
વિકાસાત્મક કે પ્રેરક બનશે તે વિશે દાખાંતો આપીને  
પોતાનાં મંત્રાંદ્રો રજ કર્યા છે. જેમકે -

કિશોર જોશી અંકશિક્ષણ આપવાની સાથે બાળકોને ગેલ કરાવે છે : એક પછી બે આવે, રુચિભાઈને રોટલી આવે. (પૃ. ૧૮)

ભાષાક્રીશલ્ય અને ભાષાશિક્ષણની કેળવણી  
બાલસાહિત્ય દ્વારા નાનપણથી જ શક્ય બને છે.  
બાળગીતકાર રમેશ ક્રિવેટીનું સુંદર બાળગીત એમજો  
નોંધ્યું છે -

કાળી કાળી વાદળીઓ આ કેવી વરસી ગઈ !

અરણાંઓ સૌ એક થયાં ને નદી હસતી થઈ !

**બોન્સાઈ બધીકા, બિરીશ ગણાત્રા, રમણલાલ શાહ,**  
ત્રિભુવન વ્યાસ, રક્ષા દવે, દિનેશ ત્રિવેઠી, રમેશ પારેખ,  
નાનાભાઈ ભડ્ય, જ્યંત શુક્લ, આઈ. કે. વીજળીવાળા  
વગેરે... અનેક બાળસાહિત્યકારોનો એમણે ઉલ્લેખ કર્યો  
છે અને જરૂર જણાઈ ત્યાં તેમની કૃતિઓમાંથી અવતરણો  
યંક્યાં છે. એ એમની વિષય પ્રત્યેની નિસબતને અને બહોળા  
વાચનવ્યાપેન દર્શાવે છે. વાર્તા, કાલ્યાંપંક્ષિત્યાં, જોડકણાં,  
ઉખાણાં, નાટિકા વગેરેના અંશો દ્વારા લેખને વિગતસ્ભર  
બનાવ્યો છે. શિક્ષકો, માતા-પિતા, વગેરેને યોગ્ય માર્ગદર્શન  
પૂરું પાડી શકે એવી આ પુસ્તક છે.

પુસ્તકના પરિશીષ્ટમાં મુકાયેલી બાલસાહિત્યનાં  
(ગુજરાત સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદ  
દ્વારા) પુરસ્કૃત પુસ્તકોની યાદી, એ આ પુસ્તકનું  
જમાપાસું છે.

આજે જ્યારે મનોરંજનનાં સાધનો તરીકે થી.વી.,  
ફિલ્મ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ જેવાં માધ્યમોનો વપરાશ  
બાળકોમાં વધ્યો છે અને વધતો રહ્યો છે ત્યારે,  
બાલસાહિત્યની આવી જિકર અને ફિકર એ સર્વાંગી, સુધાર  
અને સુસંસ્કારી બાલઉછેરની તાતી જરૂરિયાતરૂપ ગણાશે.

- ઉર્વી રેવાર

r

**બોન્સાઈ (વામનવૃક્ષ) : બાલકૃષ્ણ જોશી, પ્રયોજક ઈશ્વર  
કૃષિકાર**

શ્રી લવર્ષ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, વડોદરા, ૨૦૦૪.  
૩. ૭૨, ૩. ૫૦

વનસ્પતિવિજ્ઞાન અને કૃષિવિજ્ઞાન જેવા વિષયો પર  
ગુજરાતી ભાષામાં તેની ઝીણી ઝીણી વિગતો વણી લેતાં  
ઘણાં પુસ્તકો મળી આવશે પણ ઉદ્યાનકળા વિશેની સ્પષ્ટ,  
બુધી વિગતોને ટૂંકમાં સમાવી લેતી માહિતીવાળાં ઘણાં  
ઓછાં પુસ્તકો હથવગાં થયેલાં છે.

‘બોન્સાઈ’ નામની આ પુસ્તકમાં એના લેખક ડૉ.  
બાલકૃષ્ણ જોશી તથા પ્રયોજક ઈશ્વર કૃષિકારે  
ઉદ્યાનકળામાં બોન્સાઈનું મહત્વનું સ્થાન બતાવીને તેના  
વિશેની ખૂબજ જીણવટભરી માહિતી પૂરી પાડી છે. એમના  
મતે બોન્સાઈ ખૂબજ ધીરજ તથા માવજત માંગી દે તેવી  
એક કળા પણ છે. કારણ કે એક મોટા વૃક્ષની આબેહૂબ  
નાની સંપૂર્ણ આવૃત્તિને પરિપક્વ થતાં ઘણાં વર્ષો નીકળી  
જતાં હોય છે.

આ પુસ્તકમાં બોન્સાઈકળામાં ઉપયોગી  
પરિભાષાનું ખૂબજ સરળ ભાષામાં નિરૂપણ કરેલું છે તથા  
બોન્સાઈની શરૂઆત ક્યાંથી કરવી, તથા તેના માટે કેવી  
માટી તથા ફૂંડાં ઉપયોગી થાય એની વિગતવાર છિણવટ  
કરેલી છે.

ઉપરાંત બોન્સાઈના ઉછેરની શૈલીઓ, વૃક્ષને  
આકાર આપવાની કળા, ખાતરના અલગ અલગ વૃક્ષને  
અનુરૂપ પ્રકારો વગેરે અગત્યની રસપ્રદ માહિતી પણ આ  
પુસ્તક પૂરી પાડે છે.

વૃક્ષને તો આપણે સૌ જાણીએ છીએ પણ તેના દરેક  
ભાગ એટલે કે પર્ણ, પ્રકંદ, મૂળ વગેરેનો માહિમા  
સમજાવીને વૃક્ષો અંગેની કેટલીક વૈજ્ઞાનિક વિગતોની પણ  
આ પુસ્તકમાં સરસ, સરળ ચર્ચા ચર્ચા ચર્ચા છે.

સમજૂતી સાચે, તે તે પાના પર ચિત્રો તથા રેખાંકનો  
આપેલાં છે તેમજ મુખપૃષ્ઠ પર તથા અંદર પણ એક આર્ટ  
પ્લેટમાં બોન્સાઈ વૃક્ષોના લગભગ પંદરેક જેટલા આર્કર્ડક  
ફોટોગ્રાફ્સ મૂક્યા છે. એ પણ આ પુસ્તકની ગુણવત્તામાં  
વધારો કરે છે. તથા તમારા બગીચાને અનુરૂપ કેવાં  
બોન્સાઈ વૃક્ષો કરવાં જોઈએ, એ પણ પુસ્તકમાં ટાંકવામાં  
આવ્યું છે. શાસ્ત્રીય સરળ સમજૂતી, ચિત્રો, ફોટોગ્રાફ્સ  
વગેરે દ્વારા આયોજિત કરાયેલું આ પુસ્તક વૃક્ષઉછેરમાં રસ  
લેનાર માટે આર્કર્ડક બની રહે તેવું છે. આવાં વૃક્ષોને તથા  
વિજ્ઞાનને લગતાં ઓછી અટપટી ભાષામાં લખાયેલાં  
પુસ્તકોની ગુજરાતી ભાષામાં ઘણી જ જરૂર છે.

- રૂપલ સોની

## ॥ વરેણ્ય ॥

ચંદ્રકાન્ત ટોપીવાળા

### જુદા જુદા સંદર્ભોથી બંધાતા પુદ્ગાલો

‘ઉપટેલા રંગોથી રિસાયેલી ભીતો’ – વિપાશા. સાહિત્ય અકાડમી, ન્યૂ હિલ્સી, ૨૦૦૪

મુંગો, બહેરો, લૂલો, લંગડો, છૂઠો, બાંડો, આંધળો, રતાંધળો, કાણો, ટાલિયો, બાંડો, બોડો, દાંતરો, ચીબો, ખૂંધો, ગાંડો, હીજડો, બોડડો, તોતડો, બાટડો, લંબુસ, કોઢિયો, કાળિયો – આ અને આવી કેટલીયે હીનતાવાચક સંજ્ઞાઓ આપણી ભાષામાં તેમજ અન્ય ભાષાઓમાં ઘર કરીને રહેલી છે. આની પાછળ પેઢીઓથી ગંધાયેલી સામાજિક ગ્રંથિ પડેલી છે. આ ગ્રંથિ પાછળ શરીરના સાધારણપણા (Normalcy)નો જ્યાલ કામ કરી રહ્યો છે. આ જ્યાલને કારણે વિકલાંગોને અત્યાર સુધી જે પ્રકારે જોવામાં આવ્યો છે, જે પ્રકારે એમની સાથે દુર્ઘાત્મક કરવામાં આવ્યો છે, જે પ્રકારે એમની ઉપેક્ષા કરવામાં આવી છે, એની સામે એમના અધિકારોને માગતો અવાજ પણ હવે બહાર આવી રહ્યો છે. અમેરિકામાં તો વિકલાંગો અંગેનો ચોક્કસ કાયદો, એમને અંગેની ચોક્કસ સગવડો વિકસયાં છે અને એમના તરફ જોવાનો તેમજ એમના પ્રતિ વર્તવાનો અભિગમ બદલાયો છે. વિકલાંગો, પહેલાં જે અશક્ત (disabled) કહેવાતા, તે હવે જુદી રીતે સશક્ત (differently able) તરીકે જોવાવા લાગ્યા છે.

ફોઈડ કહે છે તેવી શિશુવયના પૂર્વસંસ્કારમાં દઢ રીતે જડાયેલી વિભાજનવૃત્તિ (જર્મનઃ Spaltang, અંગ્રેજી : Splitting)ને કારણે સંશક્ત/અશક્ત; સકલાંગ/વિકલાંગ; સાધારણ શરીર/અસાધારણ શરીર; કણ્ણાગરું શરીર/અ-કણ્ણાગરું શરીર જેવાં દ્વંદ્વો હ્યાતીમાં રહ્યાં છે. અનુઆધુનિકતાવાદ નારીવાદ, દલિતવાદ, સજાતીયવાદ, અનુસંસ્થાનવાદ, અશૈત સાહિત્ય – જેવા ઉપેક્ષિત વર્ગોને લઘુવૃત્તાન્તોની વિભાવના હેઠળ સતર્ક કર્યા છે એમાં વિકલાંગવર્ગ પણ પોતાના અધિકાર માટે રાજકીય ઝુંબેશ સાથે સક્રિય થયો છે; અને એ વર્ગને લઈને કલાનુભવ પક્ષે એને અંગેની સિદ્ધાંતવિચારણાઓ પણ ઊભી થઈ રહી છે.

આવી જગતીક પારિસ્થિતિ વચ્ચે ગુજરાતી સાહિત્યમાં વિપાશાનો ‘ઉપટેલા રંગોથી રિસાયેલી ભીતો’ (૨૦૦૪) કાવ્યસંગ્રહ બહાર આવ્યો છે. સેરેબ્રલ પાલ્સીથી

શરીરનું સ્વૈચ્છિક હળનયલન મહદુંશે ગુમાવી બેઠેલી વ્યક્તિની ચેતનાનો સંવર્ષ અર્થી ભાષામાં કાવ્યરૂપે અવતરવા મથ્યો છે. આની વ્યવસ્થિત રીતે તપાસ કરવી જરૂરી છે અને આવી તપાસની ભૂમિકાને સખ્તિયારો આપવા અમેરિકી વિવેચક લેનાર્ડ ડેવિસ (Lennard Davis)ની વિકલાંગ-મીમાંસા (Disable studies)ના નિર્જર્ષો પણ ખપમાં લઈ શકાય.

લેનાર્ડ ડેવિસ યદ્વારી બધિર માત્યાપિતાનું સંતાન છે. સાથે સાથે એડવર્ક સૈદ્ધનો સંગી અને રોલાં બાર્થનો અભ્યાસી છે. પોતાના અંગત અનુભવને અને સંપ્રત સૈદ્ધાન્તિક તાલીમને સંયોજિત કરીને શિકાગોમાં યુલિનોઈ યુનિવર્સિટીના અંગ્રેજ વિભાગના અધ્યક્ષ રહ્યો રહ્યો રહ્યો ડેવિસે વિકલાંગમીમાંસા (Disable studies)ને અગ્રેસર કરી છે.

ડેવિસ શરીરના મૂલ્યને કેન્દ્રમાં મૂકી પહેલાં તો એનો ઐતિહાસિક પરિચય કરાવ્યો છે. બતાવ્યું છે કે ગ્રીક પરિપાટીમાં તો આદર્શ શરીરની કલ્યાણ હતી અને માટે વાસ્તવમાં બધાં શરીરને ઊંઘાં કે ઓછાં માનવામાં આવતાં હતાં પરંતુ અદ્ભરમી સદીમાં ઔદ્યોગિક કાંતિ થયા પછી ‘કામદાર’ તરીકે ધોરણસરનું શરીર જોઈએ અને એ સાથે એક સાધારણ શરીર (Normalcy)નો જ્યાલ વિકસિત થયો. આ જ કારણે વિકલાંગોને ‘અસાધારણ’નું લેબલ લાગ્યું, ડેવિસ હોલીવૂડને ખેંચી લાવીને કહે છે કે હોલીવૂડમાં તો ‘આદર્શ શરીર’ જ સાધારણ ગણાય છે બાકીનાં બધાં આદર્શથી ઉત્તરતાં ગણાય છે. ડેવિસે એ પણ બતાવ્યું કે વિકલાંગોને જોવાના માપદંડો પણ અલગ અલગ છે. આંખની ઓછાંપને કારણે પહેરાતાં ચશ્માંની સરખામજીમાં કાનની ઓછાંપમાં ધારણ કરાતાં યંત્રો વિકલાંગની વધુ માત્રામાં જોવાય છે, તો સ્તનની શસ્ત્રકિયાથી સ્ત્રીહાનિ જોતો સમાજ પુરુષની સુન્નતને પુરુષહાનિ તરીકે જોતો નથી. ઉપરાંત, વિકલાંગને જોતાં સાધારણ વ્યક્તિને થતી ભય અને અવગણનાની વૃત્તિને સમજાવવા ડેવિસે પહેલાં ફોઈડની અને પછી જાં લકાંની

સમજૂતીને ઉપયોગમાં લીધી છે.

ફોઈડનું માનવું છે કે વિકલાંગ શરીર આપણા આખા શરીર સાથેનો ઘરોબો ભાંગી નાંજે છે. આપણી ઘર જેવી નિરંત છીનવી લે છે. એટલે કે વિકલાંગનું શરીર અપરિચિતતા ઊભી કરી પરિચિતતાને ઝૂટવી લે છે. આથી જ કપાયેલું માથું, કપાયલા હાથપગ, કપાયેલાં અંગો ભય ઉત્પન્ન કરે છે. ફોઈડ આને માટે 'અન્ધરેલુ' (જર્મન : 'unheimlich અંગ્રેજ �unhomely) સંશ્બા વાપરે છે. લકાં ફોઈડના વિચારને આગળ વધારે છે અને ભયની ગ્રથિને વધુ સ્પષ્ટ કરી આપે છે. લકાં કહે છે કે શિશ્યવયના શરૂના સંસ્કારોમાં હાથપગ જ્યાં અંગોનો વિખંડિત શરીર (Fragmented body) રૂપે અનુભવ હોય છે. (જેને એ શિશ્ય પ્રતિરૂપ (imago) જેવી સંશ્બા આપે છે.) પરંતુ દર્શણ તબક્કે (mirror stage) દર્શણમાં જોતાં શિશ્યને પહેલીવાર આખા હોવાનો ભ્રમ મળે છે. અને આ ભ્રમ કદાચ એ જીવનભર ઓઢી રાખે છે. લકાને મન સકલાંગતા (wholeness) એ આભાસી ઘટના છે. જ્યારે જ્યારે કોઈક વિકલાંગ કે વિખંડિત શરીર સામે આવે, છે અને દમનના દબાવમાં ભ્રમનું કવચ ભાંગી જવાનો ભય ઊભો થાય છે ત્યારે ત્યારે વ્યક્તિ એની કલ્યનાથી પરિસૂર્તિ કરી લેતો હોય છે. ડેવિસ આ વાતને કલાવિવેચકના અનુભવ સાથે સાંકળે છે. કહે છે કે વાસ્તવમાં દૂઠી સ્ત્રી વૃદ્ધા જન્માવે છે પરંતુ વિનસ-એન્સ્નિલોની વિખંડિત પ્રતિમા કલ્યનાથી થતી ક્ષતિપૂર્તિને કારણે કલાવિવેચકને આનંદ આપે છે. ડેવિસ કલ્યનાથી થતી ક્ષતિપૂર્તિને ભૂતિયાં અંગ (Phantom limbs) સાથે સરખાવે છે. ચિકિત્સાક્ષેત્રે અનુભવ છે કે હાથપગ કપાયા છતાં દર્દી ભૂતિયા હાથપગ હોવાનો અને બામક વેદના (phantom pain)નો અનુભવ કરે છે. કલાવિવેચક બરાબર એ જ રીતે વિનસ-એન્સ્નિલોની વિખંડિત પ્રતિમાને કલ્યનાથી (મનોવિજ્ઞાનની પરિભાષામાં કહું હોય તો Closerથી) અખંડિત કરીને ક્ષતિપૂર્તિ (Compensation) કરી લેતો હોય છે, અને એ રીતે એના દર્શયક્ષેત્રમાં આવતા વિક્ષેપને નિવારતો હોય છે.

આનો અર્થ એ થયો કે શરીર સામાજિક રચના પણ છે. સમાજે સાધારણ શરીરને કેન્દ્રમાં મૂકી અન્ય શરીરોને હાંસિયામાં મૂક્યાં છે. આ સૌ હાંસિયામાં મુકાયેલાં વિકલાંગો અંગોના સમાજના ખ્યાલોને ડેવિસ બદલવા

ઇસ્ટે છે; અને મનોવિશ્લેષણ, નારીવાદ સંસ્કૃતિમીમાંસા, શરીરમાંસા વગેરેની સહાયે વિકલાંગતા (crippledom)ની પુનર્વ્યાખ્યા કરી એની ઓળખ સ્થાપવા મથે છે.

ડેવિસની ચર્ચા કલાઓમાં નિરૂપાતા વિકલાંગોના વિશ્લેષણને લક્ષ્ય કરે છે, તો સાથે સાથે, વિકલાંગો જગતને કઈ રીતે જુઓ છે, જગત વિકલાંગોને કઈ રીતે જુઓ છે, જગત વિકલાંગોને જે પ્રકારે જુઓ છે એને વિકલાંગો કઈ રીતે જુઓ છે, વિકલાંગ ચેતનાની કયા પ્રકારની પ્રતિક્ષિયાઓ હોઈ શકે, જુદી જુદી વિકલાંગતાની જુદી જુદી પ્રતિક્ષિયાઓ પણ હોઈ શકે – આ બધું જોવું પણ એટલું જ અગત્યનું બને છે. આનો સંદર્ભ વિપાશાના કાવ્યસંગ્રહ 'ઉપટેલા રંગોથી રિસાયેલી ભીતો'માં જરે છે.

એકબાજુ સેરેબ્રલ પાલ્સીને કારણે લગભગ અક્ષિય અકખ્યાગનું શરીર અને બીજી બાજુ અત્યંત સક્રિય એવું મગજ – આ બે વચ્ચેના તુમુલ ઘર્ષણની ભૂમિકા આ સંગ્રહમાં પડી છે. આ સંગ્રહથી ગુજરાતી ભાષામાં વિકલાંગ ચેતનાની અત્યંત જુદી કવિતા પ્રવેશ પામી છે.

કાવ્યસંગ્રહનું શીર્ષક પોતે જ એનું પ્રવેશદ્વાર બન્યું છે. એક તરફ 'ઉપટેલા રંગો' દ્વારા સૂચવાતી ચેતનાની વિવર્ણ અને એથી જ વિષણુ પરિસ્થિતિ તેમજ એની બીજી તરફ મુકાયેલી 'રિસાયેલી ભીતો' દ્વારા સૂચવાતી પ્રતિક્ષિયા – દુભાયેલી મનોવૃત્તિ – આ બે દ્વારા ક્ષીણચેતનાનું અવમાનિત જગત પ્રત્યક્ષ થાય છે. 'ભીતો' મારફતે ગુંગળાતી, મુંઝાતી, તરફડતી એક બંધ દુનિયામાં લઈ જવાનો સંકેત રચાય છે. રચનાઓ સાથે મુકાયેલી કવિની પોતાની નોંધો પણ ડોકાબારીઓનું કામ કરે છે. કહે છે : 'જો કોઈ શરીર, કોઈ એક અમુક શરીર, બધાં શરીરથી અલગ એવું એક જુદું શરીર રિસાઈ જાય, પોતાની અલગતાને કારણે તો ત્યારે શું થાય એની આ કવિતા છે.' અહીં 'અલગતા' સંશ્બા પોતાનો અન્યથી વિરસ્થેદ અને પોતાની પરિસ્થિતિગત વિશેષતા બને એક સાથે સૂચ્યવે છે. વિપાશાની તીવ્ર ચેતના એની ઐચ્છિકતાને ગાંઠે નહીં અને મગજના વિચારોને મોઢા સુધી પહોંચતાં મુંજવજ થાય, એનો પ્રસ્તાવનામાં થતો ઉલ્લેખ જોઈએ :

'વિચારો આવ્યા ત્યાં જ્યાં મોહું હોય, હંમેશાં.

પણ બહાર નીકળવું

અધ્યાતું લાગ્યું એ મોઢામાંથી

મોંએ પાછા ફેંક્યા, વારંવાર, એ તો અધરું મોં, એમ જ કરે. ‘અધરું મોં’ જેવા ઘનીભૂત કલ્પનમાં પ્રયત્ન અને નિષ્ફળતાની કિયાનો એકસાચે દાબ છે. વિપાશાએ ક્યારેક પોતાની ઊછળથી ચેતનાનો અવરોધ અને એની ગુંગળામણ સરલ કલ્પનમાં મૂક્યાં છે પણ એમાં ઉંડાશ પડાય છે :

આજે માતું મન ઉદાસ છે

જાણે કોઈએ દરિયાનાં મોઝાં આડે પથ્થરની લાઈન મૂકી એને રોકાં હોય (૫. ૧૧)

અહીં સુધી સરલ કલ્પન છે પણ આ કલ્પનને ઉંડાશ આપનાર છેલ્લી પંક્તિ છે : ‘દરિયાનાં મોઝાંની જેમ ઉદાસ છું’ ચેતનાની છલાંગ સાગરને અંકે કરી લે છે. ક્યાંક કાવ્યની નાવિકાને વિકલાંગતાનો થાક નથી એટલો વિકલાંગને જે રીતે જોવાય છે એનો થાક વિશેષ છે.

પણ એ વિચારથી

કે પોતે એક મોનાલિસાના પૂત્રાની જેમ પ્રદર્શિત થાય છે એને આજુભાજુ કામ કરતાં લોકોથી ઘણો વધારે થાક લાગે છે (૫. ૧૨)

‘મોનાલિસા’ ‘પૂત્રા’ ‘પ્રદર્શિત’ જેવા સંદર્ભમાંથી વક્ત વક્વેદના અર્થગઠિત છે. તો, આ રીતે ‘પ્રદર્શિત’ વસ્તુની જેમ જોઈ રહેતા જગત સામેનો રોષ પણ તીવ્રપણે વિપાશામાં પ્રગટ્યો છે. કહે છે :

મગજ બેઢું એકલા, રિસાયેલા

શરીર પાસે

જન્માવવા રાક્ષસો, ચહેરા વગરના

પૂજે છે લોકોનાં મોં

(૫. ૧૩)

‘પીંજે છે’ કિયાપદ દ્વારા અન્યને નહીંવત્તુ કે ચહેરા વગરના કરી દેતો આકોશ એની પોતાની રીતે આસ્વાદ્ય છે; તો જાત સાથે લડી લડીને હારી જતી, અલોપ થઈ જવા ઈચ્છતી વિકલાંગચેતનાનું આવિજ્ઞરણ પણ થયું છે.

શરીરે એને અધમૂળી કરી મારી નાખી (૫. ૧૪)

પણ વિપાશાએ આતું ‘પલાયન’ નાટ્યાત્મક રીતે અને જાણે કે અન્યજનની પાત્રોક્તિ રૂપે અંતર રાખીને તટસ્થપણે પણ કર્યું છે. આ તટસ્થતા વધુ વેધક બની છે. એક રચનામાં પાત્રને ઊછળતાં ફૂદતાં બાળકોને જોઈને

રમવાનું મન થતાં જોડાય છે, પણ પછી –

એના

શિશુપણાના વહાણમાંથી

વૃદ્ધપણાની હોડીમાં બેસીને

અંધારામાં અલોપ થઈ ગયો.

(૫. ૨૨)

ખૂટેલી અને કંયાળેલી જિજીવિષા અહીં કઈ રીતે શિશુપણાથી વૃદ્ધપણા સુધીનો સમયસંક્ષેપ (Time Condensation) કરે છે એ જોવું મહત્વાનું બને છે. આવી જ પાત્રોક્તિ અન્ય રચનામાં છે. એમાં ‘એ’ અને ‘અપંગ’ને વિપાશા જુદા કરે છે અને પછી હાથમાં હથ ભેરવીને દુનિયા ફેંદવા નીકળે છે. શું થાય છે ? :

એકવાર

ઘણીબધી

ના થોડી આંખે આ જોયું

એ આંખોથી ઘુંટણીયાં ઉપરનો લાલ ગરમ રંગ

ના ખમાયો

અને એ આંખોએ એ બંને પકડવા

અપંગતા મોકલી,

અને એ બંને અલોપ થઈ ગયા.

અહીં સામેથી આવતી અપંગતા દ્વારા સહ-અનુભૂતિ અને અન્તઃક્ષેપ(empathy)નું સૂચન છે.

આ ઉપરાંત ‘આડીઅવળી એક ડાળીમાં ભરાઈ ગયેલા તડકાઓ’ ‘મનના એક ખાંચયામાં કચકચ કર્યા કરતો અજોંઓ’ ‘ગુલાબની મીઠી સુંધમાંથી આવતી લોહીની મોળી સુગંધ’ જેવી તાજાં કલ્પનોથી યુક્ત પંક્તિઓ અહીં છે, તો વિકલાંગની વથા સાથે એના પુરુષાર્થને ઘનીભૂત કાવ્યરૂપ આપતી અંતિમ રચના પણ છે :

મેં મારા નખ વડે

મારી નસોમાંથી જીવનને ઉત્તરડી નાખ્યું

અને એમાં ભરી દીધો બરફ

હવે

હું સૂરજને થીજાવતી ચાલી નીકળી

મારી પાછળ અંધકાર કોતરતી...

ગુજરાતી ભાષામાં વિપાશાનો કાવ્યસંગ્રહ જુદી સામગ્રી અને જુદા સંદર્ભથી બંધાતાં પુદ્ગલોને કારણે પોતાનું અલગ સ્થાન રચે છે.

## પત્રચાર્ય

યોસેફ મેકવાન m સુરેશ જીવેરી m મનોજ શવલ

પ્રિય રમણભાઈ,  
 'પ્રત્યક્ષ'નો એપ્રિલ-જૂન ૨૦૦૬નો અંક મળ્યો.  
 'બાળસાહિત્ય ચિકિત્સાની આવશ્યકતા' - એ તમારો સંપાદકીય  
 લેખ ખૂબ આવશ્યક અને સમયસરનો લાગ્યો. નાનાં-નવાં-ગોટાં  
 બધાં સામયિકોમાં બાળકો માટેનાં વાર્તાઓ - કાચ્યો - લેખો  
 - છુનકથાઓ વગેરે પ્રગટ થતાં રહે છે. વળી છાપાંઓની  
 પૂર્તિઓ દ્વારા પણ બાળસાહિત્ય પીરસાનું રહે છે... એમાં એવું  
 જોવા મળે છે કે આ બધું બાળકોમાં કોઈ પ્રકારનો નવોનેષ કે  
 તેમનામાં આનંદકણ જગાડે એવું નથી. તમે કહો છો તેવું 'લથડતા  
 લયવાળાં, ઢંગધડા વિનાના કથાસંકલન અને કલ્યાનના વિતા  
 વિનાનાં...' એવું જ વધારે પરખાય છો. એવું મુખ્ય કારણ એ હોઈ  
 શકે કે જેને સામયિકના તંત્રી-સંપાદક પાસે બાલસૃષ્ટિ -  
 બાલકલ્યાના - બાલમાનસ વિશેનો કોઈ અછડતોય અભ્યાસ ન  
 હોઈ તેમનો જોક ઉપદેશાત્મક બાળસાહિત્ય તરફનો વિશેષ રહે  
 છે. બાળકોને કૃતિમાંથી જે આનંદ મળવો જોઈએ તે જોશ બની  
 જય છે. વળી બાળકો વિશે લખતા લેખકો-કવિઓ પાસે  
 પરંપરાથી ચાલી આવતી માન્યતાઓ - રૂઢિઓ - વાતોને ઘેનકેન  
 પ્રકારેણ વાર્તામાં મધી લેવાનું મનોવલશ અવરોધક બને છે.  
 પરિણામે બાળસાહિત્ય એકોરિયમમાં હરતીફરતી માછળીઓ  
 જેમ જ રહે છે ! આમાંથી ઊગરવા તમે વાપરેલો શબ્દ 'ચિકિત્સક  
 અભિગમ' જાગૃત લેખકોએ અપનાવવો જોઈએ એવું મને લાગે  
 છે. સુંદર દિશાસૂચન માટે તમોને અભિનંદન.

બીજી વાત. શ્રી યશવંત મહેતા એક સજાગ અને નિર્ભાક  
 બાલસાહિત્યકાર છે. 'બાલસાહિત્ય અકાદમી' માટે બધું જ કરી  
 છૂટવાની એમની તત્પરતા એક દિવસ રંગ લાવશે.  
 બાલસાહિત્યના અંગે જે જે કંઈ વિધાયક કામો કરવાનાં હોય  
 તેમાં તેઓ કંઈ પાછી પાણી કરતા નથી. બાળકોને માટે શું નનું  
 આપી શકાય... બાળકોને આનંદ પડે એવું સાહિત્ય શી રીતે  
 નિપાત્તી શકાય તેની વાતો તેમના મુખેથી 'બાલસાહિત્ય  
 અકાદમીના નેજા નીચે થતાં સંમેલનોમાં મેં સાંભળ્યો છે.  
 યુનિવર્સિટીના અભ્યાસકમમાં તેથી તો બાળસાહિત્યને પણ એક  
 વિષય તરીકે સમાવવાની તેમની મનોવાંધના છે. તમે એમનો પત્ર  
 છાપ્યો એ માટે અભિનંદન. પત્રને અંતે 'યશવંત મહેતા'ને બદલે  
 'યશવંત પંડ્યા' ભૂલથી છાપાયું છે એ પેલા બાળનાટકારના  
 નામની ગુજરાતી હશે... એમ માનું છું<sup>k</sup>

શ્રી કનુભાઈ જાની અને કવિશ્રી સિતાંશુના પત્રોની  
 માર્મિક્તા કેવી તો અસરકારક છે !

અમદાવાદ, ૨૩-૭-૦૬

- યોસેફ મેકવાન

\* પત્ર જ સીધો કંપોઝિમાં ગયેલો. છતાં કોઈ સરતચૂંક્યી નામનો  
 એ ગોટાળો રહી ગયો. એ માટે દિલગીર છીએ. - સંપા.

r

પ્રિય રમણભાઈ,

કુશળ હશો. 'પ્રત્યક્ષ' અંક ૨ એપ્રિલ-જૂન ૨૦૦૬માં મારા પુસ્તક  
 'નિતાંત'ના અવલોકન માટે આપનો તથા રશીદ મીરનો પ્રેમપૂર્વક  
 આભારી છું.

પરંતુ અવલોકનમાં રહેલા એક વિગતદીષ તરફ હું ધ્યાન  
 જેંચવા માગું છું. અવલોકનકાર લખે છે "ફાઈલાતુન્ર ફાઈલાતુન્ર  
 ફાઉલુન્ના વજનમાં રચાયેલા નીચેના શેરમાં બીજી પંક્તિનું  
 વજન બદલાઈને 'ફાઈલાતુન્ર મુસતફાઈલુન્ર મુસતફાઈલુન્ર' થઈ  
 ગયું છે.

કબરમાં પણ જખમ આપી જશે લોડો,  
 નજીકમાં જારને વાવી જશે લોડો.

મારે જણાવવાનું કે મારા આ શેરમાં નીચે મુજબ વજન  
 છે.

મફાઈલુન્ર મફાઈલુન્ર મફાઈલુન્ર : વજન

લગાગાગા લગાગાગા લગાગાગા : લગાત્મક ૩૫.

બંને પંક્તિઓનું વજન આ પ્રમાણો જ છે, એટલે કે  
 અવલોકનકાર નોંધે છે એમ વજન બદલાઈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત  
 થતો જ નથી. વળી આ શેરમાં ફાઈલાતુન્ર (જાલગાગા), ફાઉલુન્ર<sup>l</sup>  
 (જાલગાગા) કે મુસતફાઈલુન્ર (જાગાલગા) વજન અવલોકનાર કઈ  
 શીતે સાબિત કરે છે તે પણ કોઈ શીતે માન્યામાં આવી શકતું  
 નથી.

મુખાઈ, ૨૪-૭-૦૬

- સુરેશ જીવેરી 'બેઝિકર'

r

'બાલસાહિત્યની ચિકિત્સાની આવશ્યકતા - એ પ્રત્યક્ષીય  
 વાંચ્યું. પણ પ્રશ્ન રહે છે - ચિકિત્સા કોની ? બાલસાહિત્ય નિમિત્તે  
 મળતી વાચનસામગ્રીની કે બાલસાહિત્યના મહત્વાનું પ્રતિપાદન  
 કરતી વિચારણાઓની ? સાહિત્ય જો એક કલા હોય અને તેમાં  
 બાલસાહિત્ય એવું વિચારણીય - ભાવનગત તત્ત્વ હોય તો બાલ-  
 ચિત્રકલા, બાલસ્થાપન્યકલા, બાલ-સંગીતકલા અને  
 બાલશિલ્પકલા કેમ નહીં ?

આ સાહિત્ય એ કવાના અર્થમાં ન હોઈ શકે કારણ સર્જકપ્રતિભાને પામવા ભાવધિત્રી પ્રતિભા આવશ્યક છે. એ નિમિત્તે મળતી સામગ્રીને સાહિત્યનો દરજો આપવામાં ઉત્તાવળ છે. કારણ બાળકની જિજ્ઞાસાવૃત્તિ રસવૃત્તિમાં પરિવર્તન નથી પામતી.

આ સામગ્રીને એવી જ ગણવી જોઈએ કે જેમ શેરબજરના સાહિત્યની સામગ્રી.

બીજું, જો બાળસાહિત્ય એ આવશ્યક હોય તો પૂર્વસંસ્કૃત સાહિત્ય) અને પદ્ધિમ (ગ્રીક સાહિત્ય)ની પરંપરામાંના વિચારકોએ તેનો કેમ ઉત્સેખ નથી કર્યો ?

આવી વાત થાય એટલે સંસ્કૃતના ગ્રંથ મૂર્ખ બાલરાજકુમારોને ચતુર બનાવતા પંચતંત્રી દુષ્ટાઈ આપાય છે. પરંતુ તે ખરેખર બાળસાહિત્ય છે ?

બીજી એક દલીલ એવી પણ પેશ કરાય છે કે, ઘરોર, ગિજુભાઈ બિધિકા, દલપતરામ વગેરેએ આ બાળસાહિત્ય ગણાય તેવું આખ્યું છે. પરંતુ તેમાં પાયાની વાત કદાચ ઈરાદાપૂર્વક ભૂલાવી દેવામાં આવે છે કે એ સામગ્રી બાય-પ્રોડક્ટ છે. મૂળમાં તો હોપ વાચનમાળા, શાંતિનિકેતનની શિક્ષણપ્રક્રિયા કે ગિજુભાઈના શિક્ષણવિચાર-અંતર્ગત એ પેશ થતું હતું. ટૂંકમાં આજે આપણે જેને બાળસાહિત્યની સારી પરંપરા તરીકે ઓળખીએ છીએ તે શિક્ષણપ્રક્રિયાનું એક અંગ હતું; સ્વતંત્ર કલા-વિચાર નહીં. શિક્ષણની સામગ્રી તો અનેક વિષયની હોય. ફક્ત

ભાષા અને સાહિત્યગત જ થોડી હોય ?

ચાંદામામાથી રમકડું સુધીનાં સામયિકોમાં રહેલું વ્યાપારીકરણનું તત્ત્વ ઉવેખવાનું ભોગપણ કરીશું તો એ વ્યાપારીકરણ અર્થગત ચુંગાલથી શુદ્ધ કલા-વિચારને સાહિત્ય વિચારને કાળકે ગળી જશે. અથવા નવા ભમદાસ ઉત્પન્ન કરવામાં નિમિત્ત બનારો. તમે લખો છો પ્રત્યક્ષીય, પણ માણો છો સ્વખ ! ! યુનિવર્સિટી પોતે જ જ્યાં ઉકરડો સાબિત થતી હોય ત્યાં વળી આ કચરો ઉમેરવો છે ?<sup>k</sup>

અત્યારે આટલું પૂર્ણ છે. પરંતુ સાહિત્યકારના સાચા સંઘર્ષને નિર્બંધ બનાવવા, વિકર સેક્શન પરતે સંવેદનશીલતા પ્રગટાવવા નિમિત્ત સર્જતા-કહેવાતા દલિત સાહિત્ય કે નારીવાડી સાહિત્ય વિશે ક્યારેક....!

પ્રસન્ન ?

જામજોધપુર, ૧૦-૮-૦૬

- મનોજ રાવલ

\* મનોજભાઈ અ-રૂઢ રહીને વિચારે છે પરંતુ બાળસાહિત્યને નરી શિક્ષણસામગ્રી કહે છે ને બાળસાહિત્યના સર્જન-વિવેચનને 'કચરો' કહેવા સુધી જાય છે ત્યાં ડેવળ તર્કદોષ જ નહીં, સમજદોષ પણ થાય છે. એમના મુદ્રાઓમાં કંપાડ તથ્ય છે એટલે આ પત્ર પ્રગટ કર્યો છે પણ એમનાં અતિવ્યાપ્તિ અને સર્વસામાનીકરણ વિવાદસ્પદ બની શકે એવાં છે.

- સંપાદક.

### સંદ્રભ જ્યંત પંડ્યા (૮ ઓંગસ્ટ ૦૬)

જ્યંતભાઈ ગયાના સમાચાર અચ્યાનક કોઈએ ધક્કો માર્યો હોય એ રીતે આવ્યા. મન માનતું નહોતું એટલે એમનો છેલ્લો આવેલો પત્ર લઈન બેઠો. હજુ પણ એ આ રીતે શબ્દાક્ષર રૂપે તો રહેવાના જ છે. પણ મન વળી પાછું...

'મેઘદૂત' (અનુ.) નો મંદાકાન્તા, 'ઈલિયાડ' (અનુ.)નો અનુષ્ટુપ, હજુ હમણાં એમણે મોકલેતી 'આપ્રમંજરી'માંના વિવિધ છંદો; 'સ્મરણો ભીનાં ભીનાં'નાં વ્યક્તિચિત્રો; 'અક્ષરાયન' ને 'શબ્દવેધ'ના લેખો ને 'નિરીક્ષક'માંનાં લખાણો; એક વાર સાથે (કદાચ લોકભારતી સંઝોસરા) જતા હતા ત્યારે - પ્રત્યક્ષ પરિચય બહુ ઓછો હતો ત્યારે તો - રસ્તે કાર ઊભી રખાવી, બહાર નીકળી, સિગારેટ સળગાવતા જ્યંતભાઈ ગમેલા, તે દશ્ય; - એમ બધું ઊપસે-વિરમે છે. પરિષદ-પ્રમુખની ચુંટણીમાં ઊભા રહેલા એ પણી પરિચય વધીલો - એમનું નિષાભરેલું પ્રયોજન ગમેલું. અંગેજના અધ્યાપક તરીકેની કવિ, ચરિત્રકાર, અનુવાદક, વિવેચક, વિચારક તરીકેની તો પાકી ઓળખ હતી જ - એ ઘૂંઠાઈ.

'સ્વામી સાચ્યદાનંદ પુરકાર' આ સભાન-અભાન કશા દેખાડા વિનાના ખાદીધારી ને મરોડાર અક્ષરોવાળા સશક્ત લેખક-વિચારકને શોભતો હતો.

અંજલિ સ્વીકારજો, જ્યંતભાઈ

શ્રેષ્ઠાંજલિ

## સામયિક લેખસૂચિ - ૨૦૦૫

## કિશોર વ્યાસ

- વ ૨૦૦૫ના વર્ષમાં (જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન) ગુજરાતી સાહિત્યનાં સામયિકોમાં પ્રગટ થયેલાં સાહિત્યવિષયક આસ્વાદ, અવલોકન, સમીક્ષા, લેખો, સિદ્ધાંતવિચાર, ચર્ચા, ઊડાપોહ અંગેનાં લખાણોને સ્વરૂપ-અનુસાર અને તે સ્વરૂપ-અંતર્ગત સમીક્ષા, આસ્વાદ, અભ્યાસલેખ એવા પેચાચિભાગ-અનુસાર, અકારાદિકમે ગોઠવીને આ સૂચિ કરી છે.
- વ આસ્વાદ અને સમીક્ષાઓની સૂચિ કૃતિનામના કમે કરી છે – શીર્ષકનામ ને ત્યાં સમાવ્યું નથી. એ સિવાયનાં લખાણોની સૂચિ શીર્ષકનામથી કરી છે.
- વ કમ આ મુજબ છે : કૃતિનામ / લેખશીર્ષક – ( લેખક / અનુ. / સંપાદક નામ) – સમીક્ષક / આસ્વાદક / વિવેચક. સામયિકનામ, માસ, પૃષ્ઠ (-થી-)
- વ સમાવિષ્ટ સામયિકો (અકારાદિકમે) : અર્થાત્, એતદ્વારા, ઉદેશ, કવિ, કવિતા, કવિલોક, કક્કાવટી, કુમાર, ખેલના, તથાપિ, તાદર્થ્ય, ધબક, નવનીતસર્માર્પણ, નાટક, પરબ, પ્રત્યક્ષ, ફાર્બર્સ સભા ટ્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઇમેજ, વહી, વિ, શાખસૂચિ, સમીક્ષા, હ્યાતી.
- વ ગયા અંકમાં ‘નિબંધ’ સ્વરૂપ સુધીની સૂચિ હતી. આ અંકમાં ‘ચરિત્ર’ અને એ પછીનાં સ્વરૂપો અંગે.

– સંપાદક

### ૬.૧ ચરિત્ર : સમીક્ષા

અનિરૂપમાં ઊરેલું ગુલાબ (નારાયણ દેસાઈ) – મનસુખ સલ્લા, શાખસૂચિ, નવે. ૧૮૦-૧૮૪

અબોલ બોકે છે જગદીશનાં જીવનસંભારણાં (જયંત કોઠારી) – સમીર ભટ્ટ, પ્રત્યક્ષ, જુલાઈ-સાટે. ૨૮-૮

આ પણ તપ્ય (દિલીપ રાણપુરા) – બિપિન આશાર, શાખસૂચિ, જુલાઈ, ૬૮-૭૧

એચ. એમ. પટેલ (રમેશ નિરેટી) – પ્રકૃત્લ મહેતા, બુદ્ધિપ્રકાશ, ઓંગસ્ટ, ૩૨

એવા હતા મનેખ (રાધવજી માધવ) – પ્રકૃત્લ મહેતા, બુદ્ધિપ્રકાશ, ઓંગસ્ટ, ૩૩

ઈડલી, ઓર્કિડ અને હું (વિહુલ વંક્ષેશ કામત, અનુ. અરુણ જાડેજા) – સુરેશ મ. શાહ બુદ્ધિપ્રકાશ, ઓક્ટો. ૨૪-૨૫

ઉપરા (લક્ષ્મણ માને, અનુ. સંજય શ્રીપાદ ભાવે) – સુરેશ મ. શાહ, પરબ, જુલાઈ, ૭૦-૭૨

– રાજેશ મકવાણા, તાદર્થ્ય, જૂન, ૩૧-૩૪

કચ્છી કલાસંસ્કૃતિના વૈતાલિક : ચમણીહજી ચઠોડ (સં. જોચારસીહ જાદવ) – દર્શના ધોળકિયા, ખેલના, સાટે. ૫૫-૫૬

કુળકથાઓ (સ્વામી આંનદ) – જયંત મેઘાડી, શાખસૂચિ, નવે. ૬૮-૭૧

ખુલ્લી કિતાબ (અભુલ સત્તાર એધી) – નરોતમ પવાણ, પ્રત્યક્ષ, જાન્યુ.માર્ચ ૨૧-૨૩

ધડતર અને ચણતર (નાનાભાઈ ભણ) – મનસુખ સલ્લા, શાખસૂચિ, ઓક્ટો. ૬૨-૬૮

છલી (રલપાલાબહેન પરીખ) – રણજિત પટેલ, ‘અનામી’, ઉદેશ, માર્ચ, ૨૮૩-૨૮૫

જીવનપંચ (ધૂમકેતુ) – નીતિન વડગામા, બુદ્ધિપ્રકાશ, ઓંગસ્ટ, ૨૪-૨૬

તખ્યાના તેજસ્વી તારલા (સં. ભીજુ કવિ) – નરેશ શુક્લ, શાખસૂચિ, સાટે. ૮૮

દાદાનો ઊગોરો લીધો (એમ. એફ. હુસેન, અનુ. જગદીપ સ્માર્ત) સિલાસ પટેલિયા, નિ. ફેબ્રુ. ૨૭-૨૮

દીવાદંડીના તેજલિસોટ્ય (ઠિશર પરમાર) – નરેશ શુક્લ, શાખસૂચિ, ઓક્ટો. ૮૧-૮૨

દુર્ગાચામ ચરિત્ર (મહિપત્રામ નીલકંઠ, સં. રમેશ શુક્લા) – રમાશ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૩-૬

ધરતીનાં અજવાણી (ભગીરથ બ્રહ્મભણ) – નરેશ શુક્લ, શાખસૂચિ ડિસે. ૭૨

પાંડુરંગદાદા આઠવલે (ઉર્વા અધ્વર્ય, સં. પ્રકૃત્લ રાવલ) – પ્રકૃત્લ મહેતા, બુદ્ધિપ્રકાશ, ઓંગસ્ટ, ૩૨-૩૩

પ્રાચીન નારી રત્નો (ઉપા જોખી) – પ્રકૃત્લ મહેતા, બુદ્ધિપ્રકાશ, ડિસે. ૩૬

ભીત ફાડીને ઊગ્યો પીપળો (વિહુલ પંચા) – નરેશ શુક્લ, શાખસૂચિ, જૂન ૮૮

મનેખ નાનું મન મોટું (પ્રકૃત્લ શાહ) – સુરેશ મ. શાહ, પરબ, સાટે. ૭૮-૭૯

મરીજ (એસ. એસ. રાહી) - ફિલીપ કલાર્ક, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૩૪

મહાદેવભાઈની ડાયરી (મહાદેવભાઈ દેસાઈ) - જ્યંત પંચા, શબ્દસૃષ્ટિ, નવે. ૮-૧૧

માનવતાના ભેરુ (ભગીરથ બલભઙ્ગ) -  
 - ગુજરાત વ્યાસ, કુમાર, જુલાઈ, ૪૮૫-૮૬  
 - જયશ્રી જોખી, તાદર્થી, જુલાઈ, ૩૦-૩૪

માયાનગર (રજનીકુમાર પંચા) - જ્યંત ઉમરેઠિયા, પ્રત્યક્ષ, ઓક્ટો. ડિસે. ૨૫-૨૬

માર્ગ જીવન એ જ મારી વાળી (નંદ : ૧થી ૪) - (નારાયણ દેસાઈ)  
 - રમેશ ઓળા, એટાં, જાન્યુ.-માર્ચ ૫૨-૬૮  
 - મધુસૂદન કાપડિયા, પરબ, એપ્રિલ ૫૭-૭૧

મોહનલાલ પટેલ અધ્યયન ગ્રંથ (સં. મણિલાલ પ્રજાપતિ) - સોહન દવે, તાદર્થી, ફેબ્રુ. ૨૮-૩૨

રવીન્દ્ર પૂર્વચરિત (સં. ભોળભાઈ પટેલ) - અનિલ શાહ, શબ્દસૃષ્ટિ, જાન્યુ. ૩૪-૩૮

રૂપેરી પરદાના ચહેરાઓ (શિરીષ કષેકર, અનુ. જ્યા મહેતા) - હરીશ ખરી, શબ્દસૃષ્ટિ, માર્ચ ૭૦-૭૩

રેતીમાં પગલાંની લિપિ (હસમુખ પટેલ 'શૂન્યમ') - દિનેશ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૪૭-૪૮

ઝાંકિથા (રેશે આ. ઓળા) - દર્શિની દાદાવાલા, પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૨૪-૨૬

શતાયુવંદના (સં. પ્રકુલ્પ રાવલ, કિશોર મકવાણા) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૩૦

સત્યજિત રાય જીવન અને કલા (અભિજિત વ્યાસ) - દિનેશ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, નવે. ૨૮-૨૮

સમી સાંજે સરજકની સંવેદના (ચંદુલાલ સેલારકા) - સંધ્યા ભંડ, ઉદ્દેશ, નવે. ૧૨૭-૧૨૮

સ્વચ્છિદ્વા (લતા હિંચાણી) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, ઓક્ટો. ૩૫

સોનગઢનો કળાધર - સુરેશ જોખી (સં. ગીતા નાયક) - નરેશ શુક્લ, શબ્દસૃષ્ટિ, જાન્યુ. ૫૭-૫૮

## ૬.૨ ચરિત્ર : અભ્યાસ / પરિચય

અમૃતા શેરગિલ - હિરીશ વીઠીવોરા, નવનીત-સમર્પણ, જૂન ૮૫-૧૦૦  
 અલ હફિલની કલા - અભિજિત વ્યાસ, નવનીત-સમર્પણ, ઓગસ્ટ, ૮૧-૮૬  
 આર્થર ભિલર - કુમાર, માર્ચ ૨૦૧-૨૦૨  
 આર. કે. લક્ષ્મણ - સરોજ જોશી, નવનીત-સમર્પણ, ઓક્ટો. ૫૩-

૫૮  
 ઔંગણે રોંડા - અભિજિત વ્યાસ, જાન્યુ. નવનીત સમર્પણ ૮૮-૧૦૪  
 કે. કા. શાસ્ત્રી - પ્રકુલ્પ રાવલ, કુમાર, જુલાઈ, ૪૮૪  
 ગ્રીઝમાં મકરનનું ફળિયું - અનિલ જોશી, નવનીત-સમર્પણ, ફેબ્રુ., ૫૨-૫૬  
 ગ્રૂપ્યા પોલ સાર્ટ - ભરતકુમાર પ્રા. ઠકર, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૫૧-૫૫  
 અક દેરિદા - અમૃત ખરી, પરબ, જાન્યુ., ૬૨-૫૫  
 દીસ્પોયસ્કી - નટવરસૈંડ પરમાર, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ., ૪૫-૫૭  
 દુલા ભાયા કાગ - હસુ યાશીક, કુમાર, જાન્યુ. ૪૬-૪૭  
 પત્રરૂપે મકરનભાઈ - વિષ્ણુ પંચા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૫૪-૬૧  
 પાબ્લો નેરુદા - મૂકેશ વૈદ્ય, એટાં, એપ્રિલ-જૂન, ૫૦-૫૫  
 - રમણીક અગ્રાવત, શબ્દસૃષ્ટિ, જૂન, ૪૧-૪૪  
 પિકસો : એક નોંધ - જયટેવ શુક્લ, સમીપે, સપ્ટે., ૯૬-૧૦૧  
 પેટલીકરનાં રેખાચિત્રો - પ્રકુલ્પ રાવલ, વિ, ઓક્ટો. ૨૭-૨૮  
 ભૂપેન ખજાર સાથેની એ અંતિમ કાણો - બિહારી બારલૈયા,  
 કુમાર, મે, ૩૪૫-૩૪૬  
 મકરિમ ગોર્કાની નજરે ચેખોવ - પણા નિવેદી, શબ્દસૃષ્ટિ, સપ્ટે., ૫૮-૬૨  
 મનહર મોટી - ચિનુ મોટી, ધબક, જૂન, ૩૬-૩૭  
 મહાત્મા કૂલે - કાંતિ માલસતર, હયાતી, માર્ચ-જૂન, ૭૦-૭૫  
 માઈન્ડ ભંડ - જશવંત ઠકર, પ્રાગણ તોસા, મહેશ ચંપકલાલ,  
 હસમુખ બારાડી, નાટક, જાન્યુ.-માર્ચ, ૨-૭  
 મીરાં અને મહાત્મા - મંજુ ઝરેરી, ફાર્બસ ટ્રેમા, જુલાઈ-સપ્ટે., ૧-૫  
 મુકુન્દરાય પારાશર્ય - પંકજ જોશી, નવનીત-સમર્પણ, સપ્ટે., ૭૨-૭૭  
 મુલ્કરાજ આનંદ - પ્રકુલ્પ રાવલ, કુમાર, ઓક્ટો. ૬૫૬-૬૬૦  
 યુઠિન ઓનીલ - મહેન્દ્ર ન. પંચા, કુમાર, નવે. ૮૩૮-૮૪૦  
 લોહિયા અને ગાંધી - મંજુ ઝરેરી, ફાર્બસ ટ્રેમાસિક, જાન્યુ.-માર્ચ,  
 ૧-૪  
 વંચિતોના કરિ લેન્ગસ્ટન વૈજેજ - પ્રા. દેવરાજ નંદા, અનુ. અભય  
 પરમાર, હયાતી માર્ચ-જૂન, ૬૫-૬૬  
 હોલ ક્લિનેન - હર્ષલ શાહ, કવિ, ઔગસ્ટ, ૫-૭  
 શામળાસ ગાંધી - જયકુમાર શુક્લ, નવનીત-સમર્પણ, જૂન,  
 ૧૧૧-૧૧૫  
 સત્યના પ્રયોગો - મારી દણિએ - દણિ પટેલ, શબ્દસૃષ્ટિ,  
 ઓગસ્ટ, ૪૦-૪૫



## ૬.૧ હાસ્યસાહિત્ય : સમીક્ષા

તિલક કરતાં ત્રેસંહ થયાં (રતિલાલ બોરીસાગર) – નરેશ શુક્રલ,  
શબ્દસૃષ્ટિ, ઓગસ્ટ, ૬૮-૭૦  
થાવું તો શિક્ષક થાવું (વિનોદ જાની) – નરેશ શુક્રલ, શબ્દસૃષ્ટિ,  
મે, ૫૮-૬૦  
પહેલું સુખ તે માંદા પંડ્યા (વિનોદ ભણ)  
– ધીરુ પરીખ, કુમાર, મે, ૩૪૩  
– નિવ્યા પટેલ, પ્રત્યક્ષ, જુલાઈ-સાએ, ૩૧-૩૨  
મંગળ-અમંગળ (વિનોદ ભણ)  
– રતિલાલ બોરીસાગર, પરબ, માર્ચ, ૪૮-૫૨  
વંદ હાસ્યમૃ (મધુમન જોખાપુરા)  
– જયંત ઉમરેઠિયા, પ્રત્યક્ષ, ઓક્ટોભિસે., ૨૬-૨૭  
– દિનેશ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, મે, ૩૮-૪૦  
હસવું મરજિયાત છે (નિલની ગણાત્મા) – નરેશ શુક્રલ, શબ્દસૃષ્ટિ,  
જૂન, ૮૮  
હળવે હાથે (ભીનાક્ષી દીક્ષિત) – સુહાસ ઓઝા, ઉદેશ, ડિસે.  
૧૯૮-૨૦૦  
હાસ્યિર્થકમ્ (હરબંસ પટેલ) – અંજિત ઠાકોર, ખેવના, જૂન, ૩૬-  
૪૦  
હાસ્યયોગ (જનક નાયક) – પ્રકુળ મહેતા, બુદ્ધિપ્રકાશ, ઓક્ટો.  
૩૪-૩૫

## ૧૦.૧ લોકસાહિત્ય : સમીક્ષા

આસ્પેતા અને અનુસેધાન (અંબાદાન રોહિયા)  
– બલરામ ચાવડા, તાદર્થ્ય, ફેબ્રુ., ૨૫-૨૮  
ગુજરાતનાં લંગનગીતો (સં. વિનાયક રાવલ)  
– પ્રકાશ આર. પંડ્યા, તાદર્થ્ય, સાએ. ૨૬-૩૦  
– રાજેશ મકવાણા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ., ૭૦-૭૨  
દેશવિદેશની લોકકથાઓ (સં. રતિલાલ સથવારા) – પ્રકુળ મહેતા,  
બુદ્ધિપ્રકાશ, નવે. ૨૭  
કૂલડોં વેણી વેણી થાળ ભર્યો (સંપા. પ્રાગઞ્ચભાઈ ભાસ્થી) –  
દિનેશ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, નવે. ૨૮

## ૧૦.૨ લોકસાહિત્ય : અભ્યાસ

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રી બાહ્યરવિટ્યા કથાઓ – બિપિન  
આશર, શબ્દસૃષ્ટિ, મે, ૩૪-૪૪  
ખાયણાં : અલૂણાં પરંપરાનું સ્નીની દટ્ઠિઓ અવલોકન – બંકુલા  
ઘાસવાલા, વહી, જાન્યુ.-મે, ૭૮-૮૦

બે લોકમહાકાયો – મનોજ રવળ, સમીપે, સાએ. ૬૮-૭૪  
ભારતીય લોકચિત્રકલા – નિસર્જ આહિર, કુમાર, ઓક્ટો. ૭૧૭-  
૭૨૧

લોકગીત : લોકજીવનની જન્મોત્ત્રી – જગદીશચન્દ્ર પટેલ,  
બુદ્ધિપ્રકાશ, ડિસે. ૨૪-૨૬

લોકગીતોમાં ભારતીયતા – ઉત્તમ પટેલ, તાદર્થ્ય, એપ્રિલ, ૩૧-  
૩૭

## ૧૧.૧ વિયેચન-સંશોધન : સમીક્ષા

અનામી : વાજિ અને વાઙ્મય (પોવિંદભાઈ કાલિયા) – સતીશ  
દાલાક, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૮-૩૦

અનાર્યના અડપલાં અને બીજા લેખો (જહંગીર સંજાણા) –  
ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રત્યક્ષ, જુલાઈ-સાએ., ૩૪-૩૭

અનુનય (વિજય પંડ્યા) – મધુસૂદન વ્યાસ, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન,  
૨૪-૨૫

અપૂર્વ (નીતિન મહેતા) – કાન્તિ પટેલ, ફાર્બસ ટ્રેમા., એપ્રિલ-  
જૂન, ૧૨૪-૧૨૮

અભિનવનો રસવિચાર અને બીજા લેખો (નગીનદાસ પારેખ) –  
વિજય પંડ્યા, શબ્દસૃષ્ટિ, નવે. ૭૨-૭૫

અલંકૃતા (સંપા. હર્ષદ નિવેદી) – શિરીષ પંચાલ, સમીપે, ડિસે.  
૧૧૨-૧૨૮

અવલોકના (સુદુરમ્ભ) – રમશ સોની, શબ્દસૃષ્ટિ, નવે. ૬-૬૭

અસ્યા : સર્જિવિદી (સિતાંશુ યશશેંદ્ર) – હરીશ જવેરી, પરબ, જૂન,  
૪૭-૫૪

અક્ષરની આરાધના (જયાનાનદ દવે) – અસુણ કક્કડ, ઉદેશ, જૂન,  
૪૧૨-૪૧૪

એકવચન (હરીશ મંગલમ્ભ) – રાજેશ મકવાણા, તાદર્થ્ય, ડિસે.  
૩૫-૩૭

ઉપાયન (વિષ્ણુપ્રસાદ નિવેદી, સં. વિજય દેસાઈ, અન્ય) –  
વાભશંકર પુરોહિત, શબ્દસૃષ્ટિ, નવે., ૩૪-૩૮

કચણું સંસ્કૃતિદર્શન (રામસ્થિષ્ણ રાડીડ) – નરોત્તમ પવાણ,  
શબ્દસૃષ્ટિ, નવે., ૩૦-૩૭

કથાપર્વ : ૨ (બાબુ દાવલપુરા) – એમ. આઈ. પટેલ, તાદર્થ્ય, મે,  
૨૮-૩૧

કથાસિદ્ધાંત (સુમન શાહ) – જ્યેશ ભોગાયતા, ફાર્બસ ટ્રેમા.,  
જાન્યુ.-માર્ચ, ૧૬-૨૩

કવિની શ્રદ્ધા (ઉમાશંકર જોશી) – ભોગાભાઈ પટેલ, શબ્દસૃષ્ટિ,  
નવે. ૮૩-૮૨

કવિતાનો સૌદર્યલોક (જગદીશ ગુર્જર) – ઋજુતા ગાંધી, પ્રત્યક્ષ,

પ્રલ્યાણ

જીવનાભિસારે ૨૦૦૬

૧૧

- એપ્રિલ-જૂન, ૨૩  
**કાવ્યસાત્ર (બિપિન આશર)** – દીપક પ્ર. પટેલ, તાદર્થ, માર્ચ,  
 ૩૫-૩૮
- કિશોર જાદવ અધ્યયન ગ્રંથ (સં. કિશોર જાદવ)** – બાબુ  
 દાવલપુરા, ઉદેશ, ઓક્ટો. ૮૬-૯૭
- કિશોર જાદવનું કથાસાહિત્ય (યોગેન્ડ પારેખ)** – નરેશ શુક્લ,  
 શબ્દસૂચિ, ઓંગસ્ટ ૬-૭-૬૮
- ગ્રંથસૌરભ (માણિભાઈ પ્રજાપતિ)** – રમણ સોની, પ્રત્યક્ષ, ઓક્ટો.  
 ડિસે. ૨૩-૨૪
- ગ્રંથની કેરીએ (રમણલાલ જોશી)** – બિપિન આશર, શબ્દસૂચિ,  
 ઓંગસ્ટ, ૬-૩-૬૬
- ગ્રામજીવનની સાઠોતરી નવલકથા (કેસર મકવાણી)** – કૃપા ઠાકર,  
 પરબ, જાન્યુ., ૫૭-૫૮
- ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર (ભગીરથ બ્રહ્મભણ)**  
 – જ્યંત 'સંગીત', વિ. જાન્યુ., ૧૪-૧૫
- શિન્તયામિ મનસા (સુરેશ જોશી)** – સુમન શાહ, શબ્દસૂચિ, નવે.,  
 ૧૪૬-૧૫૧
- દૂંકી વર્ત્તા : આસ્વાદ (ભોહનલાલ પટેલ)** – બાબુ દાવલપુરા,  
 બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૨૫-૨૮
- તારતમ્ય (અનંતરાય રાવળ)** – અનિલા દલાલ, શબ્દસૂચિ, નવે.,  
 ૮૩-૮૮
- દશયાવલોકન (અમિતિં વ્યાસ)** – પુરુષ જોશી, બુદ્ધિપ્રકાશ,  
 જુલાઈ, ૩૧-૩૨
- નિર્જર્ઝ (ભગીરથ બ્રહ્મભણ)** – પ્રકુલ મહેતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે.  
 ૩૪
- નિમિત્ત (રાજેશ પંડ્યા)** – સિલાસ પેટેલિયા, પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટે.  
 ૨૬-૨૭
- નૈવેદ્ય (દેલરરાય માંકડ)** – રમેશ મ. શુક્લ, શબ્દસૂચિ, નવે. ૪૮-  
 ૫૩
- પ્રતિબોધ (ઉપેન્દ્ર છ. પંડ્યા)** – નીતિન વડગામા, ઉદેશ, સપ્ટે.,  
 ૪૮-૫૩
- પરિપ્રેક્ષણ (દક્ષા વ્યાસ)** – નીતિન વડગામા, પ્રત્યક્ષ, એપ્રિલ-  
 જૂન, ૧૫-૧૮
- પરોક્ષ-પ્રત્યક્ષે (રમણ સોની)**  
 – કાન્તિ પટેલ, ફાર્બર્સ ટ્રેમા., જાન્યુ-માર્ચ, ૫૭-૬૨  
 – કિશોર વ્યાસ, ખેવના, સપ્ટે., ૪૮-૫૦  
 – ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, નવે. ૬૮-૭૩  
 – હિનેશ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, ઓંગસ્ટ, ૩૪-૩૬  
 – રાજેન્ડ્ર મહેતા, શબ્દસૂચિ, મે, ૫૩-૫૭
- પ્રકોંડ પત્રકારો (સં. યાસીન દલાલ)** – અજય પાઠક, શબ્દસૂચિ,  
 જૂન, ૮૩-૮૪
- પુનર્વિનિ (કિશોર વ્યાસ)** – પ્રીતિ શાહ, પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટે.,  
 ૨૨-૨૪
- બાવનનો સંગ્રહ વિસ્તાર (વિજય શાસ્ત્રી)** – જગદીશ ગૂર્જર,  
 શબ્દસૂચિ, જાન્યુ., ૪૮-૫૧
- બે હજારની સાલનું ગ્રંથસથ વાક્યમય (મધુસૂદન પારેખ)** – નરેશ  
 શુક્લ, શબ્દસૂચિ, જાન્યુ., ૫૭
- ભરતવાક્ય (ભરત મહેતા)** – વિજય શાસ્ત્રી, શબ્દસૂચિ, એપ્રિલ,  
 ૬૫૬૮
- મેઘાશી અને શ્રીધરાણીની કવિતામાં રાધ્રભાડિત (મનોજ જોશી)**  
 – પ્રકુલ રાવલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૪૮-૫૦
- મેઘાશી વિમર્શ (બળવંત જાની)** – નૂતન જાની, ઉદેશ, નવે., ૧૪૭-  
 ૧૫૦
- રચના અને સંરચના (હરિવલભ ભાયાણી)** – અજય સરવૈયા,  
 શબ્દસૂચિ, નવે., ૧૩૬-૧૪૧
- રામાયણ : માનવતાનું મહાકાવ્ય (યુષાવંત શાહ)** – મધુસૂદન  
 કાપડિયા, ફાર્બર્સ ટ્રેમા., જાન્યુ.-માર્ચ, ૩-૧૦, એપ્રિલ-જૂન  
 ૭૩-૮૦
- વંકદેખાં વિવેચનો (જ્યંત કોકારી)** – ઉકેશ ઓળા, શબ્દસૂચિ,  
 નવે., ૨૧૮-૨૨૨
- વિવેચનની પ્રક્રિયા (રમણલાલ જોશી)** – ભરત મહેતા, શબ્દસૂચિ,  
 નવે., ૧૫૨-૧૫૪
- શબ્દંગધા (હર્ષદ ત્રિવેદી આસન્નેય)**  
 – જશંત શેખડીવાલા, તાદર્થ, જૂન, ૨૦-૨૪  
 – મધુ કોકારી, મોનો દિમેજ, ઓક્ટો. ૩૩-૩૪
- શબ્દોક્ષા (હીપક રાવલ)** – નરેશ શુક્લ, શબ્દસૂચિ, એપ્રિલ, ૭૮-
- શબ્દનગર (રજનીકુમાર પંડ્યા)** – શાંતિલાલ મેરાઈ, બુદ્ધિપ્રકાશ,  
 ઓક્ટો. ૨૬-૨૭
- શ્રેષ્ઠ ઉમાશંકર (રં. નિરંજન ભગત, અન્ય)**  
 – રમણ સોની, પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટે., ૩૩
- સમુલ્લાસ નિસબત (અનિલ શાહ)**  
 – જયન્ત પંડ્યા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે., ૧૦-૧૨,  
 – મનસુખ સલ્વા, બુદ્ધિપ્રકાશ, નવે., ૧૩-૧૭
- સહ-અનુભૂતિ (રમેશ એમ. ત્રિવેદી)** – સિલાસ પેટેલિયા, પ્રત્યક્ષ,  
 જુલાઈ-સપ્ટે., ૩૨
- સ્વાધ્યાયલોક : ગુજરાતી સાહિત્ય પૂર્વિધ, ઉત્તરાર્ધ (નિરંજન  
 ભગત)** – કિશોર વ્યાસ, શબ્દસૂચિ, નવેમ્બર, ૨૨૭-૨૨૭
- સંપ્રત્યય (શરીરક વીજળીવાળા)** – હરીશ ખની, શબ્દસૂચિ,

એપ્રિલ, ૭૦-૭૩

આહિત્ય અને સમાજ (વિવુઠ જોશી) - મધુકંત કાચિત, હયાતી,  
માર્ચ-જૂન, ૮૦-૮૮

સૌણાઈ (વિષ્ણુપ્રસાદ દ્વિવેદી, સં. રમેશ મ. શુક્રલ  
- દિનેશ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, ઓક્ટો. ૨૮-૨૮  
- નરોત્તમ પલાણ, શબ્દસૃષ્ટિ, જુલાઈ ૭૨-૭૩

હમારી સલામ (વા. ટા.) - રાહેશયામ શર્મા, પરબ, માર્ચ, ૫૩-  
૫૬

## ૧૧. ૨ વિવેચન-સંશોધન : અભ્યાસ

અદી દાયકાનું વિવેચન (૧૯૭૫થી ૨૦૦૦) : કેટવારું સ્થિતંત્તરો  
- ભરત મહેતા, ઉદેશ, એપ્રિલ, ૩૨૮-૩૩૮

અર્થ - અજ્ય સરવૈયા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ. ૫૪-૬૦

અનુનેથ, લઘુ અને વિકીદિત પૃથ્વી - ચન્દ્રકંત ટેપીવાળા,  
શબ્દસૃષ્ટિ, માર્ચ, ૪૩-૪૬

અનુવાદના સિદ્ધાતો અને તાલીમ - ફાધર વર્ગિસ પોલ, પરબ,  
જુલાઈ, ૮૦-૮૨

આકારવાદના પ્રતિવાદ અંગે - સુમન શાહ - એતદ્વ., જાન્યુ.-માર્ચ,  
૩૨-૪૫

આધુનિકતા અને અનુઆધુનિકતા વિશે થોડુંક - મધુકર પાડવી,  
વિ., જાન્યુ. ૧૨-૧૪

ઇતિહાસ ચેતના અને સાંસ્કૃતિક આત્મપૃષ્ઠા - ત્રિકીપ સૃદુદ,  
અર્થાત્, એપ્રિલ-જૂન, ૨૦-૨૪

ઉમાશંકર જોશીની વિવેચના - શિરીષ પંચાલ, સમીપે, ડિસે., ૬૦-  
૮૩

એકવીસમી સદી અને સાહિત્ય - યોરેફ મેકવાન, પરબ, ઓક્ટો.,  
૫૭-૬૫

ઓગાડીસ સો સિદ્ધેર પદ્ધીની ગુજરાતી કવિતા - પ્રવીજ દરજી,  
ફાર્બસ ટ્રેમાસિક, ઓક્ટો.-ડિસે.

[કથાસાહિત્ય] ડિક્ષણ - અજ્ય સરવૈયા, એતદ્વ., ઓક્ટો.-ડિસે.,  
૫૧-૫૮

કથાસાહિત્યમાં ઘટના - રમેશ ઓઝા, એતદ્વ., જુલાઈ-સપે. ૪૨-  
૬૨

કથાસાહિત્યમાં સૂર અને વાતાવરણ - સુમન શાહ, પરબ, જાન્યુ.,  
૪૩-૪૮

કવિ ઉમાશંકરની સંસ્કૃત પર્યાષ્ણા - ભોગાભાઈ પટેલ, શબ્દસૃષ્ટિ,  
એપ્રિલ, ૩૨-૩૧

કવિ નર્મદ - સાહિત્ય, ઐતિહાસિક સંદર્ભ અને જીવન - હરીશ  
નિવેદી, તાદર્થ, એપ્રિલ, ૨૧-૨૮

કળા - અજ્ય સરવૈયા, ખેવના, સપે., ૩૪-૩૮

કૃતિલક્ષી સાહિત્યશિક્ષણ - ભરત મહેતા, ખેવના, માર્ચ, ૩૫-  
૪૨

કાકસાહેબની જીવનગતિ - સર્જનગતિ - પ્રકુલ્પ રાવલ, ફાર્બસ  
ત્રેમાસિક., જાન્યુ.-માર્ચ, ૪૪-૫૪

ગદના વિભાવના - ચન્દ્રકંત ટેપીવાળા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૪૨-  
૪૪

ગુજરાતી કથાસાહિત્યના નવા અવાજો - શરીફ વીજળીવાળા,  
શબ્દસૃષ્ટિ, માર્ચ, ૬૫-૬૮

ગુજરાતી લઘુકથાનું સ્વરૂપ અને વિકાસ - રામજીભાઈ કરિયા,  
ઉદેશ, મે, ૩૮૬-૩૮૮

ગુજરાતી સર્જન વિવેચન સંદર્ભ થોડી મુનવર્યાના, થોડાક પ્રશ્નો  
- શરીફ વીજળીવાળા પરબ, ઓક્ટો. ૪૮-૫૬

ગુજરાતી સાહિત્ય પરિષેદ અને ગાંધીજી - મકરન્દ મહેતા, કુમાર,  
નવે., ૧૧૨-૧૧૫

છંદ વિશે થોડુંક પૌર્વત્ય કાવ્યના પરિશ્રેષ્ટ્યમાં - રશીદ મીર, ધબક,  
માર્ચ, ૧૭-૨૨

જનમેજયનો સર્વયોજન : સંરચનાની દસ્તિએ - શિરીષ પંચાલ,  
સમીપે, સપે. ૬૦-૬૭

જૈન પરંપરાનું મહાભારત (રાજેશ પંક્યા) - પરબ, માર્ચ, ૩૬-  
૪૨

તમિલ સાહિત્યમાં દલિત; અતિત અને સંપ્રત - મૂ. લે. વેકટર  
સ્વામીનાથન, અનુ. મનસુખ ગાયજન, હયાતી, માર્ચ-જૂન,  
૬૦-૧૦૭

દાહોદ વિસ્તપરની કથા-પુરાકથાઓ - નરોત્તમ પલાણ,  
બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૨૭-૨૮

દેશીવાદ વિશે - કાનજી પટેલ, ખેવના, માર્ચ, ૨૭-૩૨

નવલરામની રસવિચારણા - લાભશંકર પુરોહિત, ફાર્બસ  
ત્રેમાસિક, ઓક્ટો.-ડિસે., ૨૧૧-૨૧૮

નિર્વસનનું સાહિત્ય - નિરંજન ભગત, પરબ, ફેબ્રુ., ૩૧-૩૮

પ્રતિબિભા, પુરનિર્ભિત્ર, રૂપાંતરણ અને અર્થસૂચન - સુમન શાહ,  
ફાર્બસ, જાન્યુ.-માર્ચ ૧૧-૧૫

પાંડવકથા (મહાભારતની) વિભિત્ત પરંપરા - રાજેશ પંક્યા, ફાર્બસ  
ત્રેમા., જાન્યુ.-માર્ચ ૨૪-૨૪

પ્રેમાંદ : વાણીના બહુવિધ સ્વાદનો કવિ - ચન્દ્રકંત ટેપીવાળા,  
શબ્દસૃષ્ટિ, ઓક્ટો. ૩૧-૩૬

ભારતીય અંગ્રેજ સાહિત્યમાં ભારતીયતા - પૂર્ણિમા મહેતા,  
ખેવના, માર્ચ, ૩૩-૩૪

ભાવકતા - કલાસિકનો બીજો મૂળધાર - સુમન શાહ,  
શબ્દસૃષ્ટિ, જાન્યુ. ૩૮-૪૪

**ભાષાસહિત્યનું અધ્યાપન :** અપેક્ષિત કોશલ્યો - જશવંત શેખીવાલા, તાદર્થ્ય, જાન્યુ. ૨૦-૨૪

**મધ્યકાળીન ગુજરાતી મહાભારત પરંપરા - રાજેશ પંડ્યા,** શબ્દસૂચિ, જૂન, ૬૫-૭૮

**મેઘાણી : રાષ્ટ્રીય શાયર, સોરઠી શાયર કે બીજું કરીક ? - કિશોર વ્યાસ, બેવના, ડિસે. ૪૭-૫૦**

**રધુવંશ (સર્જી : ૧૪) પરની સંસ્કૃત ટીકા અને હિન્દી વ્યાખ્યાનું તુલનાત્મક અધ્યયન - મધુસૂદન વ્યાસ, ઉદેશ, મે, ૩૭૫-૩૭૭**

**રામનારાયણ પાઈકની વિવેચના - શિરીષ પંચાલ, તથાપિ, સપ્ટે-નવે. ૫૨-૫૬**

**લઘુકથા : સ્વરૂપ વિચાર - ગીતાબહેન શુક્રલ, તાદર્થ્ય, જાન્યુ., ૩૩-૩૭**

**લાજવાબ 'મનીષા' - કિશોર વ્યાસ, તથાપિ, સપ્ટે-નવેબ., ૮૬-૮૧**

**શિષ્ટ સામયિકના તંત્રી-સંપાદક હોવું એટલે - માવજી સાગવલા, બેવના, ડિસે., ૪૩-૪૬**

**સંદર્ભગ્રંથો સામે સાવચેતીનો સૂર - દિનકર જોશી, ઉદેશ, ડિસે., ૧૬૭-૧૭૦**

**સંરચના વિચાર : સર્જકતાના સંદર્ભો - હરીશ પંડિત, તાદર્થ્ય, જુલાઈ, ૨૧-૨૪**

**સાર્વ શતાબ્દીએ ગોવર્ધનગામ - રમેશ એમ. તિરેકી, વિ. આંકટો., ૧૮-૨૦**

**સાહિત્ય અને દુર્ભોધતા : સામાન્ય વાચકના સંદર્ભો ભૂમિકા - રચિક શાહ, ઉદેશ, જાન્યુ., ૨૧૫-૨૧૬,**  
\* ? પરબ, જાન્યુ., ૪૮-૫૦

**સાહિત્ય, સિદ્ધાંત અને સાહિત્યસિદ્ધાંત - નીતિન મહેતા, એતદ્દ, ઓંકટો.-ડિસે., ૨૮-૫૦**

**સાહિત્ય સ્વરૂપ - સિદ્ધાંત વિશે - સુમન શાહ, પરબ, ઓગસ્ટ, ૪૧-૪૬**

**સાહિત્યનું તત્ત્વજ્ઞાન - ચન્દ્રકાંત ટેપીવાળા, શબ્દસૂચિ, જૂન, ૩૭-૪૦**

**સાહિત્યમાં સાત્ત્વિકતા - ચન્દ્રકાંત શેર્ડ, પરબ, ફેબ્રુ., ૩૮-૪૪**

**સાહિત્યકલાની સાચી સામગ્રી : જીવનવિશ - સુમન શાહ, શબ્દસૂચિ, ઓંકટો., ૬૮-૭૪**

**સુધારક યુગ અને ગુજરાતી સાહિત્યના ઈતિહાસો - ચન્દ્રકાંત ટેપીવાળા, શબ્દસૂચિ, જાન્યુ., ૪૫-૪૮**

**સ્ત્રી : સમાજમાં અને સાહિત્યમાં - શરીરસ્થ વીજળીવાળા, અર્થાત્, જાન્યુ.-માર્ચ, ૪૧-૫૨**

**હાસ્યનવલ સ્વરૂપ :** થોડા સંકેત - પ્રવીષ દરજી, ઉદેશ, ડિસે., ૧૮૨-૧૮૪

**હિંદ સ્વરાજ પૂર્વની હિંદ-સ્વરાજ કથા ? ગોવર્ધન વાઙ્મયનો એક વાચના વિકલ્ય - સિતાંશુ યશશેંદ્ર, સમીપે, ડિસે., તર હુંમર - ઉમર એટલે ? રચના સંદર્ભો અર્થશોધનો પ્રયાસ - લાભશંકર પુરોહિત, પરબ, મે, ૪૪-૪૮**

## ૧૨૦. ૧ ભાષાવિજ્ઞાન, કોશ : સમીક્ષા

ગામીત કહેવત સંચય (દક્ષા વ્યાસ, નવીન મોદી) - નરોતમ પવાણ, પરબ, ઓંકટો., ૬૬-૬૭

ગુજરાતી ભાષાનું ધનિસ્વરૂપ અને ધનિપરિવર્તન - (બળોધ પંડિત) - યોગન્દ્ર વ્યાસ, શબ્દસૂચિ, નવે., ૫૮-૬૨

મધ્યકાળીન કૃતિ સ્થૂચિ (ગુજ. સા. કોશ-૧, મધ્યકાળ) સં : કીર્તિદ્ય શાહ - દાશની દાદાવાલા, પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૨૮ શબ્દકથા (હરિલલભ ભાયાણી) - રમશ ચૌણી, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૨૮-૨૮

## ૧૨૦. ૨ ભાષાવિજ્ઞાન, કોશ : અભ્યાસ

ભાષાઓનો અસ્ત બૌદ્ધિક વૈતિદ્ય ગુમાવવાની દિશામાં ? (મૂલે. માથાઓકા ઉશુહિતો) અનુ. દક્ષા વ્યાસ, શબ્દસૂચિ, સાએ., ૭૮-૮૦

ભાષા અને વર્ચસ્વ : ઔગણીસમી સહીના અંતભાગમાં ગુજરાતી ભાષા પરની ચર્ચાઓ - રિહો ઈશાકા, અર્થાત્, એપ્રિલ-જૂન, ૪-૧૭

## ૧૩૦. ૧ અન્ય : સમીક્ષા

અ સ્ટેપ બાય સ્ટેપ કોર્સ ટોવર્ડ્ઝ માસ્ટર્સિંગ ગુજરાતી (પ્રો. રેમન્ડ આર. પરમાર) - પોસેફ મેકવાન, ઉદેશ, જૂન, ૪૩૨-૪૩૩

અગવડોમાં આરાધના (સ્વામી સચ્ચિદાનંદ) - દિગ્ગજ શાહ, પરબ, એપ્રિલ, ૫૬

અગડંગડ (દિનેશ કોઠારી) - મુકુંદ પરીખ, પરબ, ડિસે., ૪૩-૪૫

અધ્યાત્મની અજિનશિખા (વિમલા ઠાકર) - ધર્મન્દ મ. માસ્તર, પરબ, જાન્યુ., ૫૮-૬૧

અપનો પારસ આપ (ઝોસેફ મેકવાન) - કેશુભાઈ દેસાઈ, પરબ, સાએ., ૬૪-૭૦

અમાસનો ઉજાસ (ધૂની મંડલિયા) - દિનેશ દેસાઈ, બુદ્ધિમંત્ર, નવે. ૨૬

અરધી સદીની વાચનયાત્રા-૨, (સં. મહેન્દ્ર મેઘાશી)

- ઉકેશ ઓઝા, પરબ, જાન્યુ. ૫૧-૫૪
- રમેશ બી. શાહ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૩૩-૩૫

અરધી સદીની વાચનયાત્રા-૩, (સં. મહેન્દ્ર મેઘાશી)

- રમણ સોની, પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટે., ૩-૪

અક્ષત (દુર્ગેશ ઓઝા) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૩૦ આજનો દિન મહાન (સંક. યશવંત કરીકર) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૩૨

આતંકવાદ (સ્વામી સચિયદાનંદ) - હિંગજ શાહ, પરબ, એપ્રિલ, ૫૫

એચ. એમ.નો અક્ષરદેહ (સં. હિલાવરસિંહ જાડેજા, અન્ય) - પ્રવીષ શેઠ, વિ. જાન્યુ., ૨૩-૨૫

'કલાધરી' જુઓ : 'તેજોમયી'

કામકાળા ગાંધીજી (જિતેન્દ્ર દવે) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે., ૩૧-૩૨

કુટુંબિત્ર (સં. હર્ષદ દેસાઈ) - ચન્દ્રકાંત ટોપીવાળા, ફાર્બસ, જાન્યુ.-માર્ચ, ૪૧-૪૩

કૃષને અનુસરો, મહાન બનો ! (પ્રકુલ્પભાઈ પટેલ) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, ઓક્ટો. ૩૩-૩૪

ખડ ખૂટ્યાં (પુષ્ય મહેતા) - ઈલા પાઠક, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૫-૨૦

ગમતાનો કરીએ ગુલાલ : ચ્રંચ ૧-૨ (સં. બળવંત કે. પારેન) - ગંભીરસિંહ ગોહિલ, શબ્દસૂચિ, માર્ચ, ૭૪-૭૭

ગતા રહે મેશ દિલ (સાલિલ દલાલ) - માવજી સાવલા, પ્રત્યક્ષ, ઓક્ટો.દિસે., ૧૯-૨૧

ગાંધીજનું ચિંતન (દક્ષા વિ. પદ્મશિલી) - અમિત ધોળકિયા, પ્રત્યક્ષ, ઓક્ટો.દિસે., ૨૪-૨૫

ગુજરાતી આધુનિક ગ્રંથોની વારી (સં. અચ્યુત વાણિક, કિરીટ ભાવસાર) - ચન્દ્રકાંત ટોપીવાળા, ફાર્બસ ટેમા., જુલાઈ-સપ્ટે. ૧૫૫-૧૫૭

ગીતાનું આચરણ (કે. સી. ભંડ) - જયન્ત પંડ્યા, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૩-૧૬

ગુજરાતની અસ્મિતા (રજની વ્યાસ)

- જયકુમાર શુક્લ, પરબ, જુલાઈ, ૬૮-૭૨
- રાહેશયામ શર્મા, કુમાર, માર્ચ, ૧૯૨-૧૯૮

ગુણદર્શન (અવિત્કા ગુણવંત) - પ્રકુલ્પ ચાવલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૪૮

જીવનનું ઉપવન (ધૂની મંડળિયા) - દિનેશ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, નવે., ૨૬

જીવનસફ્ર (ઝાધર વર્ગીસ પોલ)

- પ્રકાશ ચૌહાણ, ઉદ્ધશ, ફેબ્રુ., ૨૭૩-૨૭૪
- પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૩૫

જીવનસંકેત (કાન્તિવાલ કલાશી) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૩૦-૩૧

ટ્રેકિંગ (મનોહર પુરી) - અનુ. કુન્દન વ્યાસ - ઉકેશ ઓઝા, પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૨૮-૩૦

તેજોમયી (સં. વિનોદ મેઘાશી), કલાધરી (સં. એ જ) - ભરત મહેતા, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૨૫-૨૭

દીકરી એટ્ટે દીકરી (સં. કાન્તિ પટેલ) - રમણ સોની, પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૨૮-૨૮

નામમલવર (એ. શ્રી નિવાસ રાઘવન, અનુ. યશોધન જોશી) - ગોવિંદભાઈ ચાવલ, શબ્દસૂચિ, ઓગસ્ટ, ૧૮-૩૧

ન્યાયની કેરીએ (ચિન્મય જાની) - રવીન્દ્ર ઠકોર, ઉદેશ, ડિસે., ૧૯૬-૧૯૭

પાઠશાળા ગ્રંથ પ્રદ્યુમનસ્સુનિ)

- લોળાભાઈ પટેલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૨-૧૩
- રમણ સોની, પ્રત્યક્ષ, ઓક્ટો.દિસે., ૨૭-૨૮

પાંડે પાંડે મોતી (સં. મહેતા દવે) - સતીશ તણાક, બુદ્ધિપ્રકાશ, સપ્ટે., ૩૨

પિતા-પાપા-ડેડી (સંપા. રત્નિલાલ બોરીસાગર) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૨૭-૨૮

પીધો અમીરસ અક્ષરનો (સંપા. પ્રીતિ શાહ) - મધુસૂદન કાપડિયા, ફાર્બસ, ઓક્ટો.દિસે. ૨૫૪-૨૫૬

પ્રેમ અને સંબંધ (વિકાસ મહલકાણી) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૩૧-૩૨

વૃહત્ત સિંગળ (રા. વિ. પાઠક) - ચિમનલાલ નિરેદી, શબ્દસૂચિ, નવે. ૧૨-૧૮

બે હજાર ચારનું યાદગાર વાચન (સં. નરેશ કાપડિયા) - દિનેશ દેસાઈ, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૩૭-૩૮

બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો (રમેશ બી. શાહ) - હસમુખ શાહ, પરબ, ઓગસ્ટ, ૬-૧-૬૫

મબલખનો ખજાનો (સુરેશ દેસાઈ) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, નવે. ૨૬-૨૭

મરમ ગહેરા (સં. ચાજુ દવે) - પ્રકુલ્પ મહેતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે., ૩૨-૩૩

માણસને માણસ તરીકે જુઓ (ઝાધર વર્ગીસ પોલ) - પ્રકાશ

ચૌહાણ, પરબ, માર્ચ, ૬૦-૬૧  
મોતી અને માળ (શાંતિલાલ મેરાઈ) - નરેશ શુક્લ, શબ્દસૃષ્ટિ, મે, ૬૦  
વર્ગ સાથે વાત (રાજેન્ડ્રસિંહ વાંદેલા)  
- ગંગારસીંહ ગોહિલ, પરબ, નવે., ૭૭-૭૮  
- નરેશ શુક્લ, શબ્દસૃષ્ટિ, ઓગસ્ટ, ૬૮  
શબ્દ અને શૂત (સં. પ્રવીષ દરજા, બળવંત જાની) - દિનેશ કેસાઈ,  
બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૪-૧૫  
શ્રીમદ્ ભગવદ્ગીતા અને આધુનિક મેનેજમેન્ટ (બી. એન. દસ્તૂર) -  
ધર્મન્દ્ર માસ્તર 'મધુરમ', પરબ, નવે., ૭૫-૭૬  
સમય (નીનળ દીક્ષિત) - દિનેશ કેસાઈ, બુદ્ધિપ્રકાશ, મે, ૪૦  
સંપૂર્ણ અહેંસા શક્ય નથી (સ્વામી સચ્ચિદાનંદ) - દિંગજ શાહ,  
પરબ, એપ્રિલ, ૪૪-૪૫  
સાયયો મારો ગુલાબનો છોડ (કીર્તિભાઈ નાયક) - નરેશ શુક્લ,  
શબ્દસૃષ્ટિ, જૂન, ૮૮-૯૦  
સાયલન્સ પીઝ (આઈ. કે. વિજણીવાળા) - જ્યન્ત પંડ્યા, પરબ,  
ડિસે., ૪૫-૪૬  
સૌરે જહાં સે અચા (સ્રિમતા ભાગવત) - પ્રકુલ્લ મહેતા,  
બુદ્ધિપ્રકાશ, ફેબ્રૂ., ૩૧  
સ્ત્રી-સંભાષણ (દ્વાપત્રામ) - ચંદ્રકાંત ટોપીવાળા, કાર્બસ  
ત્રૈમાસિક, ઓક્ટો.-ડિસે., ૨૦૭-૨૧૦  
હું ઘર (સં. મનીષી જાની, વરદાંરાજ પંડિત, અન્ય) - નરેશ શુક્લ,  
શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૭૮-૭૯

કાર્ટૂન ચીતરતા પુત્રને પત્ર - જનક ત્રિવેદી, પરબ, સપ્ટે., ૫૧-  
૬૩

કૃજ્ઞા : શિલ્પ અને ચિત્રકલા સંદર્ભે - નિસર્જ આહિર, નવનીત-  
સમર્પણ, ઓંગસ્ટ, ૨૧-૨૮ સપ્ટે., ૧૮-૨૮

કૃજ્ઞાપંથ અને પૂતનામિથ - મંજુ જ્વરી, કાર્બસ ત્રૈમા.., એપ્રિલ-  
જૂન, ૧-૩

કેટલાંક ઠિલિલાસી શાપકોનાં અવલોકન - રસેશ જમીનદાર,  
કાર્બસ ત્રૈમાસિક., એપ્રિલ-જૂન, ૧૧૩-૧૨૩

ખામોશ પાની (ફિલ્મ) - ઉમા રંદેરિયા, પરબ, જૂન, ૬૨-૬૪  
ખૂલુ ઉપયોગી ગ્રંથો - બાબુ સુથાર, તથાપિ, સપ્ટે.-નવે., ૭૭-  
૮૫

ગામનામો અને કુટુંબનામોનો 'રા' - એક નોંધ - નરોતમ પવાણ,  
બુદ્ધિપ્રકાશ, જૂન ૨૫-૨૬

ગુજરાત વિદ્યાસભા - મધુસૂરન પારેખ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૩૦-  
૩૨, ફેબ્રૂ., ૮-૧૨ માર્ચ ૧૧-૧૪, એપ્રિલ ૮-૯, મે ૧૬-  
૧૮ જૂન ૧૦-૧૨, જુલાઈ ૧૦-૧૨, ઓગસ્ટ ૧૧-૧૪,  
સપ્ટે. ૬-૮, ઓક્ટો. ૧૧-૧૩, નવે. ૧૧-૧૨, ડિસે. ૧૪-  
૧૬

ગુજરાતાં સ્થાપાજિક સુધારણા : દુર્ગારામ મહેતાજ અને  
માનવધર્મ સભા - જયકુમાર ર. શુક્લ, બુદ્ધિપ્રકાશ, મે, ૩૨-  
૩૫

ઇંદ્રની અંતરેંગ લયવ્યવસ્થા - ચંદ્રકાંત ટોપીવાળા, શબ્દસૃષ્ટિ,  
ફેબ્રૂ., ૨૧-૨૫

જૈન કાષ્ટપટ ચિત્ર (સં. જગદીપ સ્માર્ત) - રાવેશ્યામ શર્મા, કુમાર,  
જૂન, ૪૧૭-૪૧૮

જૂપગૂમ જૂપગૂમ એકડ છગડ એકડ છગડ - જનાન્તિક શુક્લ,  
સમીપે, સપ્ટે., ૭૫-૮૮

દાવિતોની પાટ પર્યપરા - દ્વલપત ચૌહાણ, વડી, જાન્યુ.-મે ૮૧-  
૧૦૦, સપ્ટે. ૮૪-૮૮

નામપુણ્ય - શાંતિલાલ સિંહાંજિયા, કંકાવટી, જૂન, ૮-૧૩

પ્રકાશનપ્રવૃત્તિ - થોડુંક વિચાર ચંકમણ - નિર્જન ભગત, પરબ,  
જૂન, ૭૧-૭૩

પ્રત્યક્ષ-૨૦૦૪ વિશે - ડંકેશ ઓણા, પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૪૨-  
૪૩

પુસ્તક : આત્માનો આકાર - મિહિર ન. પારેખ, નવનીત-સમર્પણ,  
ફેબ્રૂ., ૧૧૮-૧૨૧

બિલિશ ગુજરાતીઓની ગૌરવગાથા - ચંદ્રકાંત પટેલ, વિ. જુલાઈ,  
૧૮-૨૫

ભારતીય સિનેમા અને જર્મનો - અમૃત ગંગાર, નવનીત-સમર્પણ,

### ૧૩.૨ અન્ય : અભ્યાસ

અનુઆધુનિકતા, કાળ, અવકાશની અનુભૂતિ અને સિનેમા -  
અમૃત ગંગાર, કાર્બસ ત્રૈમાસિક, ઓક્ટો.-ડિસે., ૨૦૨-૨૦૮  
અનોખા ભાવવિશ્ની સફર : સ્વદેશ (ફિલ્મ) - હરીશ ખર્તી,  
નવનીત-સમર્પણ, ફેબ્રૂ., ૧૦૮-૧૧૧  
અસ્મિતા અને જાતતપાસ : ગુજરાતના સંદર્ભો - પ્રકાશ ન. શાહ,  
કાર્બસ ત્રૈમાસિક, ઓક્ટો.-ડિસે., ૨૧૧-૨૧૮  
આપણાં ઘરમાં સહદ્ય પુસ્તકોને રાખવા માટે જગ્યા છે ખરી ?  
- જીયેશ ભોગાયત્તા, તથાપિ, સપ્ટે.-નવે., ૮૨-૮૪  
આવતી કાલનું ગુજરાતી સામનીક - ત્રિદીપ સૂહણ્ણ, પરબ, ફેબ્રૂ.,  
૪૭-૫૦  
ઇમાન્યુએલ કાન્ટના શૈક્ષણિક વિચારો - ડે. આર. નાવડિયા, વિ.  
જાન્યુ., ૨૦-૨૨, ફેબ્રૂ., ૨૦-૨૧  
કલાકારીએ યુક્ત મંહિર-માસ્કિફની કેટલીક છત (વિતાન) -  
પ્રિયબાળા શાહ, નવનીત-સમર્પણ, જૂન, ૩૩-૩૮

જાન્યુ., ૬૬-૭૫  
ભૂમ અને તરસની ઇન્ડિયો - ચન્દ્રકાંત ટોપીવાળા, શબ્દસૃષ્ટિ, ડિસે., ૫૦-૫૧  
મહાભારતનો મહાસંહાર : જવાબદાર કોણ ? - હિન્કર જોશી, ઉદ્દેશ, જુલાઈ, ૪૪૮-૪૫૪  
માનવવિકાસ વિશે શ્રી અરવિંદ - સ્વ. હરસિંહ જોશી, ઉદ્દેશ, કેદ્ભુ., ૨૪૫-૨૫૧  
મારો ભારતપ્રવાસ - પાછલો નેરુદા, અનુ. હરીશ જીવેરી, સમીપે, સાએ., ૮૦-૮૫  
મીડિયા (ફિલ્મ) - અમૃત ગંગર, નવનીત-સમર્પણ, ઓંગસ્ટ, ૧૦૫-૧૧૧  
ગમાયણ અને મહાભારત : પુરાણ કે ઇતિહાસ ? - હિન્કર જોશી, ઉદ્દેશ, કેદ્ભુ. ૨૫૨-૨૫૬  
લેખન એક વ્યવસાય ? - ડકેશ ઓણા, શબ્દસૃષ્ટિ, સાએ. ૮૮-૮૯  
લેખનનું રાજકોરણ - મૂલી. ડી. જ્યકાન્ટ, અનુ. મધુસૂદન વ્યાસ, પરબ, સાએ., ૭૧-૭૩  
વિચાર - અજય સરવૈયા, એતદ્દ, જુલાઈ-સાએ., ૩૫-૪૧  
શિક્ષણ, શૈક્ષણિક સામગ્રી અને ચારિત્ય ઘડતર - રત્નલાલ બોરીસાગર, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૩-૨૮  
સતત શિક્ષણ અને ભગવાન કૃષ્ણ - પ્રકાશ ઠાકર, વિ. જાન્યુ., ૧૯-૨૦  
સમૂહમાધ્યમો અને ભાષાના પ્રશ્નો - હસમુખ બારાડી, ખેવના, માર્ચ, ૪૩-૪૪  
સાઈટ : નામ અને પુરાવશોષો - હારિસાંદ શાસ્ત્રી, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૩૪-૩૫  
સીતા : મારી વેલેન્ટાઈન - મીરાં ભણ, ફાર્બર્સ ટ્રેમા., જાન્યુ.-માર્ચ, ૬૩-૬૫  
ક્લિનેમા : સ્વાદ, આસ્વાદ - અમૃત ગંગર, સમીપે, સાએ., ૨૪-૫૮  
ક્લિનેમાની સંરક્ષક દેવી તુલા - અમૃત ગંગર, ફાર્બર્સ ટ્રેમાસિક, જાન્યુ.-માર્ચ, ૫૫-૫૬  
હિંદુસ્તાની સંગીતમાં ગઝલ ગાયકી (લે. પ્રેમભંડારી. અનુ. આશીત હેંગબાધી) - મધુ કેઠારી, મોનોઇમેજ, જાન્યુ., ૧૧-૧૨

#### ૧૪. સાહિત્યચર્ચા, સંપાદકીય નોંધો, પ્રાસંગિક, આદિ...

અમૃતા પ્રીતમ - જ્યા મહેતા, શબ્દસૃષ્ટિ, ડિસે., ૬૬-૬૮ -  
મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, નવે., ૨

અલંકૃતા ગુજરાતી - હર્ષદ નિરેદી, શબ્દસૃષ્ટિ, નવે., ૬-૭  
એધ આજ્યુમેન્ટેટિવ ઇન્ડિયન' (અમર્ત્ય સેન) વિશે - મંજુ જીવેરી,  
ફાર્બર્સ ટ્રેમાસિક, ઓક્ટો.-ડિસે., ૧-૩  
ઠંડુ ગોસ્વામી - ઠંડુ પુવાર, કુમાર, જાન્યુ., ૪૭-૪૮  
ઉપદ્રવ કે ઉત્સવ ? - ચન્દ્રકાંત ટોપીવાળા, શબ્દસૃષ્ટિ, જુલાઈ,  
૫૬-૫૮  
કલાપી-નીર્થ લોકપર્ણા - હર્ષદ નિરેદી, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૪-૫  
કેન્દ્રીય સાહિત્ય અકાદમીની અર્ધશતાબ્દી - ભરતકુમાર ગ્રા.  
ઠાકર, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૪૭-૫૩  
કેળવે તે કેળવણીનું લોકપર્ણા - હર્ષદ નિરેદી, શબ્દસૃષ્ટિ, ડિસે.,  
૪-૫  
ખરં ઇલ્લી, ખરં શૂરં - અજય પાઠક, પરબ, ડિસે., ૪૮-૫૦  
ગઝલ પરિસંવાદ - રાજેશ મકવાળા, બુદ્ધિપ્રકાશ, ઓક્ટો., ૩  
ગમતાનો ગુલાલ - પ્રીતમ લખલાણી, પરબ, એપ્રિલ, ૪૬-૪૭  
ગુજરાતની અસ્તિત્વાની શું મરી પરવારી છે ? - રમણલાલ જોશી,  
ઉદ્દેશ, જૂન, ૪૦૧-૪૦૨  
ગુજરાતી સાહિત્ય પરિષદના યશસ્વી સો વર્ષ - મધુ કેઠારી, મોનો  
ઇમેજ, ઓંગસ્ટ, પ્રુ.  
(ગુજરાતી સાહિત્ય) પરિષદની આરપાર - રમણ સોની પ્રત્યક્ષ,  
ઓક્ટો.-ડિસે., ૩-૬  
(ગુજરાતી સાહિત્ય) પરિષદના પ્રાશપ્રશ્નો - પરેશ નાયક, ખેવના,  
સાએ. ૩૮-૪૪  
ગુજરાતી સાહિત્ય પરિષદનું નેવીસમું જ્ઞાનસત્ર - મુકુંદ પી. શાહ,  
બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૩૩  
(ગુજરાતી સાહિત્ય) નેવીસમાં જ્ઞાનસત્ર નિમિત્તે વિદ્યાનગરવંદના -  
નશેત્રમ પલાશ, પરબ, કેદ્ભુ., ૬૬-૬૮  
ગુજરાતીનો અધ્યાપક સંઘ : ચોપનામા અવિવેશનનો અહેવાલ -  
રાજેશ મકવાળા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૩૨  
ગોવર્ધનરામ : વિદ્ધજનનોની પાંખે - પાચુલ કંદર્પ દેસાઈ, પરબ,  
ડિસે., ૫૦-૫૨  
ગોવર્ધનરામ સાર્ધ શતાબ્દી પરિસંવાદ - જ્યેશ ભોગાયત્રા,  
તથાપિ, સાએ.-નવે., ૮૬  
ચન્દ્રકાંત શેઠને નરસિંહ મહેતા એવોઈ  
- શાદ્વા નિરેદી, પરબ, નવે., ૭૮-૮૦  
- મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, નવે. ૧  
- સુમન શાહ, ખેવના, ડિસે. ૧  
છંડ પ્ર-શિક્ષણ લેખન શિબિર - શબ્દસૃષ્ટિ, નવે., ૨૫૩  
જળ : સુભદ્રા ગાંધી - રમણલાલ સોની, પરબ, કેદ્ભુ., ૭૭-૭૮

- જીવનમર્મી મકરનંદ દવેના સાંનિધ્યમાં - હરેશ ધોળઠિયા,  
શબ્દસૃષ્ટિ, માર્ચ, ૧૫-૧૮
- તર્તીકાર્ય ને એવું બધું - સુમન શાહ, ખેવના, સાપે., ૧-૬
- દ્વિ દિવસીય હાસ્યસત્ર - જનક નાયક, પરબ, ડિસે., ૪૭-૪૮
- નર્મદાના સાંસ્કૃતિક સંવાદાનાને અકાદમી એવોર્ડ - હર્ષદ નિરેટી,  
શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૪-૫
- નવા કલેક્શન ધરો મકરનંદ - ચેતનાબેઠેન પાણેરી, ઉદ્દેશ, મે,  
૩૮૦-૩૮૩
- નાટ્યપર્વ અને આપડી નિસબ્ધત - રમણ સોની, પ્રત્યક્ષ, જાન્યુ.-  
માર્ચ, ૩-૫
- નીર્મલ વર્મા
- ભોળાભાઈ પટેલ, શબ્દસૃષ્ટિ, ડિસે. ૬૦-૬૫
  - યોગેશ જોશી, પરબ, ડિસે., ૪-૮
  - રંજના અરગે, કુમાર, ડિસે., ૮૨૮-૮૨૫
  - શરીરી વીજળીવાળા, ઉદ્દેશ, ડિસે., ૧૭૮-૧૮૧
- નેમિયંડ જૈનને અંજલિ - અંજનિ મજાઠિયા, નાટક, જુવાઈ-સાપે.  
૩૮
- પારિતોષિકી વિશે - યોગેશ જોશી, પરબ, માર્ચ, ૪-૫
- ભારતીય વિદ્યાભવનને આંગણે મકરનંદ દવે સ્મૃતિ પર્વ - સોનલ  
પરીખ, નવનીત-સમર્પણ, મે, ૧૨૧-૧૨૫
- મકરનંદ દવેને શ્રદ્ધાંજલિ - અશોક બાબુભાઈ વૈદ્ય, નવનીત-  
સમર્પણ, ફેબ્રૂ., ૬૦-૬૧ - કંકાવટી, ફેબ્રૂ., ૩૦-૩૧
- કુન્ઠનિકા કાપઠિયા, કવિતા, ફેબ્રૂ.-માર્ચ, ૨૭-૨૮
  - વિમલ વસ્તંભાઈ દવે, નવનીત-સમર્પણ, ફેબ્રૂ., ૫૮-૬૦
  - રમણલાલ જોશી, ઉદ્દેશ, ફેબ્રૂ., ૨૪૨-૨૪૩
  - ધીરુભાઈ મહેતા નવનીત-સમર્પણ, ફેબ્રૂત, ૫૭-૫૮
  - સુરેશ દલાલ, કવિતા, ફેબ્રૂ.-માર્ચ, ૧-૨
- મરમ જીજો મકરનંદ - નિરંજન ચચ્ચાગુરુ, નવનીત-સમર્પણ, મે,  
૬૦૬૧
- (સાંઈ કવિ) મકરનંદ દવેનો દેહોત્સર્ગ - ચન્દ્રકાંત શેઠ, પરબ, ફેબ્રૂ.,  
૭૩-૭૬ - રેખાબેઠેન ડી. ભણ, બુદ્ધિપ્રકાશ, ડિસે., ૩૦-  
૩૧
- મહાન મરમી કવિ : સ્વ. મકરનંદ દવે - મધુસૂદન પારેખ,  
બુદ્ધિપ્રકાશ, ફેબ્રૂ., ૧-૨
- (વિરલ સાધક અને શબ્દબ્રહ્મના ઉપાસક : સાંઈ) મકરનંદ દવે -  
નીતિન વડગામા, તાદર્થ, ફેબ્રૂ., ૧૮-૨૨
- મહુવામાં યોજાયેલું અસ્મિતાપર્વ : ૮ - મુકુન્દ પી. શાહ,  
બુદ્ધિપ્રકાશ, મે-૧
- મારાં પુસ્તકોની છાજલીની આરપાર - ઉકેશ ઓળા, શબ્દસૃષ્ટિ,  
ઓક્ટો., ૪૨-૪૪
- મૌહનલાલ પટેલને ધનજી કાનજી સુવર્ણચંદ્રક - મુકુન્દ પી. શાહ,  
બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧
- રાધીશયામ શમની રણજિતરામ સુવર્ણચંદ્રક  
- મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧
- યોગેશ જોશી, કુમાર, ફેબ્રૂ., ૧૨૮-૧૩૧
- ગમજાભાઈ વાણીયાના સન્માન સમાર્બંધ ટાંકે - હસમુખ બારાડી,  
નાટક, એપ્રિલ-જૂન, ૭
- લોકપ્રિયતાનો મેનિયા - ઉકેશ ઓળા, શબ્દસૃષ્ટિ, ઓગસ્ટ, ૭૧-  
૭૨
- વાર્તા-કથાક્ષેત્ર વિશિષ્ટ 'સંશ્લો' મૂડી જનારા જ્યોતિષ જાની -  
રાધીશયામ શર્મા, પરબ, મે, ૭૭-૭૮
- વિદ્ધાન વિશ્વનારાયણ શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ - મૂ. વે. માલિની  
ગોસ્વામી, અનુ. મધુસૂદન વ્યાસ, હેમત વાણીકર, ઉદ્દેશ, જૂન,  
૪૨૫-૪૨૮
- શ્રેષ્ઠ પુસ્તક માટે ૨૦૦૪ના વર્ષનું સરસ્વતી સન્માન - ભોળાભાઈ  
પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨
- સદ્ગત સર્જક જ્યોતિષ જાની - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ,  
એપ્રિલ, ૩
- 'અમીપે'ને આવકાર - જ્યોશ ભોગાયત્તા, તથાપિ, સાપે.-નવે., ૮૭-  
૮૮
- સરકારી માન-અકરામો - રમેશ શાહ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રૂ., ૨
- સંસ્કૃત સાહિત્ય અને ચોસં કળાઓ - જગ્યાતિ પંડ્યા, રવીન્દ્ર  
ખાંડવાળા, બુદ્ધિપ્રકાશ, ઓક્ટો., ૧
- સાહિત્ય અકાદમી હિલ્લીનો અનુવાદ એવોર્ડ - સુમન શાહ,  
ખેવના, જૂન, ૧-૩
- સાહિત્યકલાની પ્રવૃત્તિમાં રાજીઓ અને શ્રેષ્ઠીઓ - ઉકેશ ઓળા,  
શબ્દસૃષ્ટિ, મે, ૬૧-૬૨
- સાહિત્ય સંસ્થાઓ અને લોકશાસી - સુમન શાહ, ખેવના, માર્ચ,  
૧-૬
- હિપ્પ્રસાદ શિવપ્રસાદ જોશી વિશે - સુધીર મુખરજી, વિ. ફેબ્રૂ.,  
૨૫-૨૬
- 
- ૧૫. મુલાકાત, કેફિયત, વાર્તાલાપ**
- 
- આર. કે. નારાયણ (અનુ. હરીશ ખણી) બુદ્ધિપ્રકાશ, નવે. ૨૩-  
૨૪
- એવી ઉજાણી ક્યારે ? - પ્રતીષ્ણ દરજી, શબ્દસૃષ્ટિ, સાપે., ૮૧-  
૮૫
- ધારાસભા એકાંકી વિશે ચં. ચી.નો ઉમાશંકરને પત્ર, નાટક,  
જાન્યુ.-માર્ચ, ૩૩-૩૫

નટદોર પર ચાલવાની મથ્યમણ - સુમન શાહ, ખેવના, ડિસે.,  
૩૮૮-૪૨

પંખીને માળો આપો ને એને આપો આકાશ - પ્રીતિ સેનગુપ્તા,  
શબ્દસૂચિ, માર્ચ, ૪૦-૪૨

પ્રિયબાળા શાહ - શ્રીલેખા રમેશ મહેતા, નવનીત-સમર્પણ, ફેબ્રુ.,  
૧૦૪-૧૦૮

ભોગભાઈ પેટેલ - યજેશ દવે, નવનીત-સમર્પણ, જૂન, ૪૫-૫૨,  
જુલાઈ ૬૫-૮૦

મકરનંદ દવે - સુરેશ દવાલ, નવનીત-સમર્પણ, ફેબ્રુ., ૪૨-૪૬  
મધુ કોઠારી - હરેશ તથાગત, કવિ, એપ્રિલ, ૨૧-૨૪

મરતાંની સાથે જ નહીં મરું - અમૃતલાલ વેગડ, પરબ, એપ્રિલ,  
૭૨-૭૫

માર્કિન ભંડ - હરીશ વ્યાસ, નાટક, જાન્યુ.-માર્ચ ૮-૮

મારી ભીતર - ઘોરેશ જોશી, ખેવના, સપ્ટે., ૩૦-૩૩

મારો જીવનમંત્ર - મધુ કોઠારી, કવિ, એપ્રિલ, ૪-૫  
ભીટ થ ઓથરમાં કેદ્ધિયત - ચંદ્રકાંત ટોપીવાળા, પરબ, જૂન,  
૪૨-૪૬

ચામજુભાઈ વાણિયા - નાટક, એપ્રિલ-જૂન, ૩-૬  
વિધાન પરિષદ (ભોપાલ) પ્રવેશદ્વારાનું ચિત્ર - તુટક નોંધ - ગુલામ  
મોહમ્મદ શેખ, સમીપે, ડિસે., ૧૮-૧૧

આહિત્યકૃતિની અદ્વિતીયતા - રાહીશયામ શર્મા, બુદ્ધિપ્રકાશ,  
જાન્યુ., ૪૦-૪૨

#### ૧૬. વિશેષાંકો

કવિ (એપ્રિલ) - મધુ કોઠારી અંક

શબ્દસૂચિ (નવે.) - અકાદમી પુરસ્કૃત કૃતિ સમીક્ષા અંક  
(અલંકૃતા)

હયાતી (માર્ચ-જૂન) - સર્જન, વિવેચન અંક

### આ અંકના લેખકો

ધ્વનિલ પારેખ : ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા - ૩૮૦ ૦૦૨

ધીરેન્દ્ર મહેતા : જીવનધાયા, હોસ્પિટલ રોડ, ભુજ (કર્ણ) ૩૭૦ ૦૦૧

પ્રફુલ્લ દેસાઈ : ૭૬, સુરુચિ સોસાયટી, ઘોડ દોડ રોડ, સુરત ૩૮૫ ૦૦૧

મોહન પરમાર : એ-૨૫, ન્યૂ પરિમલ સોસાયટી, ચાંદલોડિયા, અમદાવાદ - ૩૮૨ ૪૨૪

રમેશ બી. શાહ : બી-૬ પૂર્ણાંશર, ગુલબાઈ ટેકરા, અમદાવાદ ૩૮૦ ૦૧૫

દર્શના ધોળકીયા : રીગલ ટાઈપ સામે, ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કર્ણ) ૩૭૦ ૦૦૧

હેમંત ધોરડા : ૫, યશવંતનગર, શોપર્સ સ્ટોપ સામે, અંધેરી (પદ્ધતિ), મુંબઈ - ૪૦૦ ૦૫૮

ગુજરાત વ્યાસ : ૨૧, શીતલતા સોસાયટી, કારેલીબાગ, વડોદરા ૩૮૦ ૦૧૮

ઉર્મી તેવાર : ગુજરાતી વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા ૩૮૦ ૦૦૨

રૂપલ સોની : ગુજરાત ઈકોલોજી સોસાયટી, સુભાનપુરા, વડોદરા ૩૮૦ ૦૦૩

ચંદ્રકાંત ટોપીવાળા : ડી-૬, પૂર્ણાંશર, ગુલબાઈ ટેકરા, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧૫

કિશોર વ્યાસ : ૬ મહેતા સોસાયટી, કાલોલ, પંચમહાલ ૩૮૮૮૩૦

પરિચय મિતાક્ષરી

સ્વીકાર-સમાલોચના માટે પ્રકાશકો અને લેખકો તરફથી મળેલાં પુસ્તકોની પરિચયનોંધ

સ્વીકાર-મિતાક્ષરી વિભાગને હવે પુસ્તકનો થોડોક વધુ પરિચય આપતા પરિચય-મિતાક્ષરી વિભાગનું રજૂ કરવાનું રાખ્યું છે. આ પરિચય પુસ્તકની પ્રકાશન-વિગતો ઉપરાંત વિષય-સામગ્રીના પણ વધુ નિર્દેશો આપશે. અલબાન્ટ, આ સંક્ષિપ્ત લખાણો મંત્રવ્યલક્ષી નહીં પણ વસ્તુ-વિગત-લક્ષી રહેશે. એ પછી અવલોકન-સમીક્ષા માટે આમાંથી જ પુસ્તકો પસેંદ થશે.

મળેલાં સર્વ પુસ્તકોને પ્રાથમિક પરિચયથી આવરી લેવાના જરૂરી પ્રયોજનથી આ ઉપકુમ કર્યો છે. -સંપદક

କବିତା

આકશર કેદે (જયતે દેસાઈ) – હર્ષતરૂ પ્રકાશન, વલસાડ, ૨૦૦૬.  
ક. કાઉન ૧૨૪, રૂ. ૩૦૦ ર અમેરિકા સ્થિત. કવિની ૧૧૦  
કવિતાઓનો સંગ્રહ

ગાજુલ મંથન (સં. બિપિન આશર) – વૈદિક ભિશન ટ્રસ્ટ, પ્રાંસલા,  
જિ. રાજકોટ, ૨૦૦૬. ૩. ૮૮, ૩. ૬૦ ર ૧ ગાજુલકાર વિજ્ય  
આશરના વિમિન્ સંજ્ઞા આધારિત ૭૪૧ શેરોનો સંગ્રહ  
બહિખૃત ફૂલો (નીરવ પટેલ) – પ્ર. લેખક, ૪ હેમાંગ પાડ્ક,  
વેજલપુર, અમદાવાદ ૨૦૦૫, ૩. ૧૪૭, ૩. ૧૦૦ ર ત્રણ  
પ્રવેશકો ધરાવતો ૬૦થી વધુ દલિત કવિતાઓનો સંગ્રહ  
મારા હિસ્સાનો સૂરજ (ગૌરાંગ ઠાકર) – પ્ર. ગૌરાંગ ઠાકર,  
સુરત, ૨૦૦૬. ૩. ૫૧, ૩. ૫૦ ર ૫૧ ગાજુલનો સંગ્રહ

၁၁၅

અમે ભાનવગરનાં (કિશોર રાવળ) – ગુર્જર ગ્રાંથરત્ન કાર્યાલય,  
અમદાવાદ, ૨૦૦૫ કા. ૨૨૦, રૂ. ૧૦૦ ર અમેરિકા સ્થિત  
સર્જકની તર ટૂંકીવાર્તાઓનો સંગ્રહ

પ્રસન્નતાની પાંખીઓ (શાધર વાલેસ) - ગુજરાત ગ્રંથરલ  
કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૬ (પુ. મુ.), કા. ૧૧૮, રૂ. ૫૦ ર  
બોધપ્રધાન ૧૧૩ લઘુકથાઓનો સંગ્રહ

વિદેશી વાર્તાવિભાગ (અનુ. પંકજ સોની) – ગુરૂર ગ્રંથરલ  
કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૫ કા. ૧૬૪, રૂ. ૭૫ ર ૧૬ વિદેશી  
ટૂકીવાર્તાઓનો અનુવાદ, જે તે વાર્તાકારનો ટૂકો પરિચય પણ  
અહીં આપવામાં આવ્યો છે.

ନାୟକ

૧૮૪, રૂ. ૭૫ ર શિક્ષણજગતના સઘણ આલખતી વચ્ચારેક  
નવલક્ષ્યા

પાતુમ્માની બકરી અને બાલ્યકાળ સખી - વૈકુમ મુહમ્મદ  
બશીર (અનુ. કમલ જ્યાપરા) - નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હી,  
૨૦૦૫ (ત્રીજ આવૃત્તિ), ૩. ૧૨૭, ૩. ૬૦ ર આધુનિક  
મલયાલમ સાહિત્યના જાણીતા વાર્તાકાર, નવલકથકારની બે  
લઘનવલોનો સંગ્રહ

**સેવાસંકણ (પ્રેમયંદ)** – નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હી, ૨૦૦૬. ૩, ૨૫૦ રૂ. ૭૫ ર આ જ નામ ધારાવતી કૃતિનો કેશુભાઈ દેસાઈએ કરેલો અનુવાદ

۱۷۲

ଓন্টেক্স প্রাইভেট লিমিটেড

ନାମକ୍ରିତ

અષાઢી રંગ (કનુ ભગદેવ) – સાહિત્યસંગમ, સુરત, ૨૦૦૬.  
 કા. ૧૪૪, રૂ. ૭૫ ર ૧૨ પ્રકરણોમાં વિભાજિત રહેશ્યકથા  
 અંગદનો પત્ર (હરેશ ધોળકિયા) – લેખક ભુજ, ૨૦૦૬, કા.

અ બ્રેથ ઓફ વ્યાસ (હિલીપ લવેરી અનુ. કમલ સન્યાલ) –  
સી. ગલ બુક્ઝ પ્રા. લિ., કલકત્તા, ૨૦૦૬. રે. ૭૫, રૂ. ૧૫૦  
૧ ‘વ્યાસોચ્છવાસ’નું અંગેજ રૂપાંતર

આકાશમંચ (ધીરુબહેન પટેલ) – ગુજરાત ગ્રંથરત્ન કાર્યાલય,  
અમદાવાદ, ૨૦૦૫. કા. ૨૨૪, રૂ. ૧૦૦ ર ૧૦ રેડિયો  
નાટકોનો સંગ્રહ

નવું ધાન (બિજન ભક્તિચાર્ય, અનુ. શિવકુમાર જોશી) – નેશનલ  
બુક ટ્રસ્ટ, નવી દિલ્હી, ૨૦૦૫ (નવી આવૃત્તિ), ૩. ૧૦૫, ૩.  
૫૫ ર મૂળ બંગાળી નાટક ‘નભાન્’નો અનુવાદ

**મહત્વયુગ (ચિનુ મોદી)** – અસાઈત સાહિત્ય સભા, ઊંઝા, ૨૦૦૫ રે. ૬૩ રે. ૭૦ ર સાત એકાંકી નાટકોનો સંગ્રહ. અહીં ‘કોલબેલ’ અને ‘ડાયલનાં પંખી’ જેવા અગાઉ પ્રગટ થયેલાં સંગ્રહોનાં એકાંકીઓ પડ્યા છે.

મોનો એક્ઝિટિંગ (જ્યોતિ વૈદ્ય) - સાહિત્ય સંગમ, સુરત, ૨૦૦૬  
 કો. ૮૦, રૂ. ૫૦ ર યુવક મહોત્સવ અંતર્ગત ભજવી શકાય  
 એવી એકપાત્રીય અભિનયની રડ કૃતિઓનો સંગ્રહ  
**સિદ્ધાર્થ** : નાટ્યરૂપાંતર (ભાવણ કે. સાવલા) - મીરિયા  
 પાલિકેશન, જૂનાગઢ, ૨૦૦૬. કો. ૭૦, રૂ. ૬૦ ર હરમાન  
 હેસની લદ્યનવલ સિદ્ધાર્થનું નાટ્યરૂપાંતર

નિબંધ	વિવેચન-સંપાદન
આજ ક્રિકેટ તમના હૈ (ભુરેશ દલાલ) – ઈમેજ પાલિકેશન્સ પ્રા. લિ., મુંબઈ, અમદાવાદ, ૨૦૦૬. રી. ૧૩૦, રૂ. ૭૦ રૂ ૪૨ લઘુનિબંધોનો સંગ્રહ	અભ્યસ્ત (બિપિન આશર) – પ્ર. બિપિન આશર, રાજકોટ, ૨૦૦૫. રી. ૧૧૨, રૂ. ૧૧૦ રૂ કૃતિલક્ષી, સર્જકલક્ષી અને સૈદ્ધાંતિક એવા ૧૪ લેખોનો સંગ્રહ
કા કથા (પ્રવીષા દરજી) – રનાદે પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૫. કા. ૧૬૮, રૂ. ૮૫ રૂ ૩૨ અંગત નિબંધોનો સંગ્રહ	આધુનિક ભવાઈવેશો અને તેનું શાસ્ત્ર (જનક દવે) – પ્ર. લેખક પોતે, ૨૦૦૪, રી. ૧૩૬, રૂ. ૧૦૦ રૂ આધુનિક ભવાઈના પાંચ વેશો તથા ભવાઈ સ્વરૂપની સમજ
ડાંડિયા ગુલ ! (ભગવતીકુમાર શર્મા) – સાહિત્યસંકુલ, સુરત, ૨૦૦૬. કા. ૨૪૪, રૂ. ૧૬૦ રૂ ૮૦ હાસ્યવિષયક નિબંધો પાંનું પંચાવનમું (અશોક દવે) – ગુર્જર ગ્રંથરલ કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૫ કા. ૨૭૦, રૂ. ૮૦ રૂ હાસ્યવિષયક ૬૦ નિબંધોનો સંગ્રહ	આવિભાવ (જ્યેશ ભોગાવતા) – પ્ર. લેખક વડોદરા, ૨૦૦૬ રી. ૧૩૦ રૂ. ૧૦૦ રૂ ૧૫ અભ્યાસલેખોનો સંગ્રહ
મનના મોરપીછા (દિનેશ પાંચાલ) – ઈમેજ પાલિકેશન્સ પ્રા. લિ. મુંબઈ, અમદાવાદ, ૨૦૦૬. રી. ૧૦૧, રૂ. ૭૦ રૂ 'ગુજરાત મિત્ર' દૈનિકની કોલમમાંથી પસંદ કરેલા તું નિબંધોનો સંગ્રહ માનવ-સંબંધો (સ્વામી સચ્ચિદાંદન) – ગુર્જર પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૫ (પુ. મુ.) કા. ૧૪૭, રૂ. ૪૫ રૂ વિવિધ માનવસંબંધો વિષયક ૧૪ લેખોનો સંગ્રહ	કવિતાના સાન્નિધ્યમાં (નવિની માડગાંવકર) – કિશોર ભીડે, મુંબઈ, ૨૦૦૫ રી. ૧૮૬, રૂ. ૧૨૦ રૂ ૩૬ જુદાં જુદાં શીર્ષક ડેઠણ કવિતાનો તુલનાત્મક આસ્વાદ કરાવતો સંગ્રહ
રાષ્ટ્રીય તીર્થ આંદામાન (સ્વામી સચ્ચિદાંદન) – ગુર્જર પ્રકાશન, અમદાવાદ, (પુ. મુ.) ૨૦૦૬ કા. ૧૬૨, રૂ. ૫૫ રૂ લેખકના આંદામાન પ્રવાસને વર્ણવાનું પુસ્તક.	કવિતાને ઉભારેથી (નવિની માડગાંવકર) – કિશોર ભીડે, મુંબઈ, ૨૦૦૫. રી. ૨૦૮, રૂ. ૧૩૦ રૂ ૩૬ ગુજરાતી કવિતાઓનો અન્ય ભાષાની કવિતા સાથેનો તુલનાત્મક આસ્વાદ
વાટે-ઘાટે (અનિરુદ્ધ બ્રહ્મભક્ત) – ગુર્જર ગ્રંથરલ કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૫. કા. ૧૭૬, રૂ. ૮૦ રૂ વિવિધ વિષયના ૫૪ નિબંધોનો સંગ્રહ	કાબ્યસંભબ (હેમન્ટ ડેસાઈ) – પ્ર. લેખક અમદાવાદ, ૨૦૦૫, રી. ૨૮૦, રૂ. ૧૭૦ રૂ કવિતા વિષયક ૪૫ લેખોનો સંગ્રહ ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રીકૃષ્ણ (ગુણવંત વ્યાસ) – પ્ર. લેખક વડોદરા, ૨૦૦૬, રી. ૨૪૮, રૂ. ૧૭૫ રૂ શ્રીકૃષ્ણ કેન્દ્રમાં હોય એવી નવલકથાઓનો દશ પ્રકરણોમાં અભ્યાસ ગુજરાતી બાળસાહિત્ય : દર્શન અને દિશા (સં. ઈશ્વર પરમાર, હંસાબહેન પટેલ) – ગુર્જર ગ્રંથરલ કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૪, કા. ૨૨૨, રૂ. ૧૦૦ રૂ મોહનભાઈ શં. પટેલના બાળસાહિત્યના વિષયક ૩૨ લેખોનો સંગ્રહ
સૂરાં સાફ ! (ભગવતીકુમાર શર્મા) – સાહિત્યસંકુલ, સુરત, ૨૦૦૬ કા. ૩૦૩, રૂ. ૧૬૦ રૂ ૧૨૧ હાસ્યવિષયક નિબંધો	ચારણી સાહિત્યના શિલ્પીઓનું વૃદ્ધાવન (શિવદાન ગઢવી) – પ્ર. લેખક ૨૦૦૬, કા. ૨૪૪, રૂ. ૧૨૦ રૂ ચારણી સાહિત્યના દસ સર્જકો વિરેનો અભ્યાસંશેષ

### બાળસાહિત્ય

અમથો રંગલો (રમણલાલ સોની) – ગુર્જર ગ્રંથરલ કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૪, કા. ૮૬, રૂ. ૪૦ રૂ કુલ ૬ દશ્યોમાં વિભાજિત દ્વિઅંગી બાળનાટક – દશ્યોને અનુરૂપ ચિત્રો સાથે. નાનુબાપાની વિજ્ઞાનવાર્તાઓ (જનક નાયક) – ભાક્તિ કાર્યાલય, સુરત, (ત્રી. આ.) ૨૦૦૫ દશ પુસ્તકના સેટના ૨૫૦ રૂપિયા રૂ આ સંપુટ ડેઠણ - વૃક્ષ વાવો ને સુરક્ષિત છીંબો, મેલેરિયાનો ઝુમલો, અવાજનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, રાતદિવસનું ચક્કર, સાહું યંત્ર એટલે શું ? આંખની સંભાળ, આવ રે વરસાદ !, ઓરાકનું પાચન, નાનુબાપા ટી. વી. પર દેખાયા - નો સમાવેશ. દરેક પુસ્તકામાં ત સચિત્ર વાર્તાઓ

મધ્યયુગીન ભારતીય કવિતા (નૂતન જાની) – પ્ર. કિશોર ભીડે, મુંબઈ, ૨૦૦૫. રી. ૧૨૦, રૂ. ૮૦ રૂ મધ્યયુગીન કવિયિત્રીઓ - મીરાં, લલેશ્વરી, હંસાબહેન અને અરણિમાલની સંશોધનાત્મક લેખોનો સંગ્રહ મૂળ રે વિનાનું કાચા ઝાડવું (ભજન સરિતા) (બળવંત જાની) – ઈમેજ પાલિકેશન્સ પ્રા. લિ., મુંબઈ, અમદાવાદ, ૨૦૦૬. રી. ૧૫૪, રૂ. ૧૦૦ રૂ ૫૧ ભજન રચનાઓનો મિતાક્ષરી આસ્વાદ રંગભૂમિ ૨૦૦૫ (ઉત્પલ ભાયાણી) – ઈમેજ પાલિકેશન્સ પ્રા. લિ. મુંબઈ, અમદાવાદ, ૨૦૦૬, રી. ૧૧૧, રૂ. ૭૦ રૂ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી રંગભૂમિનાં ૪૧ નાટકોની સમીક્ષા

[હરજ મુનિકૂત] વિનોદચોનીસી (સંપા. કાન્નિભાઈ બી. શાહ) – ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૫. રી. ૩૧૨, રૂ. ૧૬૦ ર હાસ્ય-વિનોદ-બુદ્ધિચાતુરીની ચોનીસ પદ્ધવાત્તાઓનો સંગ્રહ

વિશ્વકવિતા : કવિતા-તુલના (નૂતન જાની) – ડિશ્ટોર બી.ડે., મુખ્યારી, ૨૦૦૫. રી. ૧૪૪, રૂ. ૬૦ ર ભારતીય તથા વિદેશી ભાષાઓની કવિતાનું સંપાદન કવિઓના ટૂકા પરિચય સ્વૃતિભંશના પગવે પગવે (ગણેશ દેવી) – સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, ૨૦૦૬. રી. ૧૨૬, રૂ. ૮૦ ર ગણેશ દેવીના ‘After Amnesia’નો નિરીપ સુહંદે કરેલો અનુવાદ

## અન્ય

અમદાવાદ મેગાસિટી સુધીની સર્કર (મહેશ કે. શાહ) – હર્ષ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૬. રી. ૧૭૪, રૂ. ૧૦૦ ર અમદાવાદની સ્થાપનાથી લઈને આજ સુધીના ભૌગોળિક અને ભૌતિક તથા સંપર્કતિક રીતે થયેલા વિકસનું આવેખન અડધા આકાશનો રંગ (સં. ડિમાંશી શેલત) – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૫. રી. ૧૮૬, રૂ. ૧૨૫ ર ગુજરાતનાં સ્ત્રી સર્જકોની વિવિધ સાહિત્યકૃતિઓનું સંપાદિકાના રેખાંકનો સાચેનું ચયન ક્ષણોના અભક્તરમાં (માવજી કે. સાવલા) – મીડિયા પબ્લિકેશન, જૂનાગઢ, (બી. આ.) ૨૦૦૬ રી. ૮૦, રૂ. ૮૦ ર તત્ત્વજ્ઞન, મનોવિજ્ઞાન અને ધર્મસંબંધી ૬૪ આવેખોનો સંગ્રહ ગુજરાતની ગરિમા (ઘ્યંબકલાલ ઉ. મહેતા) – હર્ષ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૬. રી. ૨૦૬, રૂ. ૧૫૦ ર ૩૭ પ્રકરણોમાં ૨૪ કરેલો ગુજરાતનો ઈતિહાસ ગુજરાતમાં પ્રવાસન (મહેબૂબ દેસાઈ) – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, (પુ. મુ.) ૨૦૦૬ રી. ૧૧૪, રૂ. ૮૦ ર ગુજરાતનો ભૌગોળિક અને ઐતિહાસિક રીતે પરિચય કરાવતું પુસ્તક

જોડણી અંગે ન. પ્ર. બુચ (સં. રામજીભાઈ પટેલ) – પ્ર. ભીખુભાઈ સુરાણી, અમદાવાદ, ૨૦૦૬. કા. ૩૪, રૂ. ૨૦ ર ન. પ્ર. બુચના ભાષાસુધાર અને જોડણી પરિષદ સંદર્ભે લખાયેલા પત્રોનું સંકલન ઝેન માર્ગ સિદ્ધાંત અને સાધના (માવજી કે. સાવલા) – મીડિયા પબ્લિકેશન, જૂનાગઢ, (બી. આ.) ૨૦૦૬. રી. ૩૭, રૂ. ૫૦ ર ઝેન ધર્મ વિષયક ભિતાક્ષરી લેખોનો સંગ્રહ. પુસ્તકને અંતે ઝેન

વિષયક અન્ય પુસ્તકોની સૂચિ પણ આપવામાં આવી છે. બાલસાહિત્ય અકાદમી નવપ્રયાણ (સં. વશવંત મહેતા) – બાલસાહિત્ય અકાદમી, અમદાવાદ, ૨૦૦૬. રી. ૮૦ રૂ. ૪૦ ર બાળસાહિત્ય અકાદમીની ગતિવિધિનો પરિચય કરાવતી પુસ્તિકા

બોલતા પથ્થર (નરોત્તમ પલાણ) – પ્રવીજ પ્રકાશન પ્રા. લિ. રાજકોટ, ૨૦૦૬. રી. ૮૮, રૂ. ૫૦ ર પોરબંદરના શિલાલેખો વિશે ૨૪ અભ્યાસલેખોનો સંગ્રહ

ભારત પ્રવાસદર્શન (કવિતા દાસ) – હર્ષ પ્રકાશન, અમદાવાદ, ૨૦૦૫. રી. ૪૮૨, રૂ. ૨૫૦ ર ભારતનો ભૌગોળિક અને આભોહવાની રીતે પરિચય કરાવતો ગ્રંથ

રવીન્દ્ર-ઓકામ્પો પત્રાવલિ (સંકલન-અનુવાદ મહેશ દવે) – ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., મુખ્યારી, અમદાવાદ, ૨૦૦૬. રી. ૮૭, રૂ. ૪૦ ર વિક્ટોરિયા ઓકામ્પો અને રવીન્દ્રનાથ યાગોરે પરસ્પરને લખેલા પત્રોનો સંગ્રહ

વિર નર્મદ ફિલ્મની પટકથા (જોવિંદ સરૈયા, તારક મહેતા) – સાહિત્ય સંગમ, સુરત, ૨૦૦૬. કા. ૧૧૨, રૂ. ૭૫ ર કવિ નર્મદ વિશેની ફિલ્મની પટકથા. વિવિધ પ્રકારના શોટની સમજ પણ અહીં મળે છે.

વીજમી સદીનું ગુજરાતી નારીલેખન (સંપા. રઘુવીર ચૌધરી, અનિલા દલાલ) – સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, ૨૦૦૫. રી. ૩૬૩, રૂ. ૧૭૦ ર વિદ્યાજૌરી નીલકંઠથી મનીષા જોશી સુધીનાં ગુજરાતી સ્ત્રી સર્જકોની એક-એક મહત્વની કૃતિનું સંપાદન

શિક્ષણધર્મી અને શબ્દધર્મી આચાર્ય શ્રી મોહનભાઈ શં. પટેલ (સં. ચન્દ્રકન્ત શેઠ, ચિનુ મોટી, દલપત પઢીયાર) – પ્ર. હંસાદેન પટેલ, અમદાવાદ, ૨૦૦૩. કા. ૨૪૮, રૂ. ૧૫૦ ર મોહનભાઈ શં. પટેલના જીવન-અને સાહિત્યનો પરિચય કરાવતો ગ્રંથ

શ્રદ્ધા (સંપા. સુરેશ સોની) – સહયોગ કુષ્યક્ષણ ટ્રસ્ટ, દિલ્હીનગર, ૨૦૦૬. કા. ૬૫, રૂ. – ર વાંચતી વખતે સંપાદકને ગમી ગયેલી વાર્તા, કવિતાઓનું સારદૃપ સંકલન

સરદાર સાચો માણસ, સાચી વાત (ઉર્વીશ કોણારી) – સત્ય મીડિયા, અમદાવાદ, ૨૦૦૫. કા. ૧૫૦, રૂ. ૧૨૫ ર સરદાર વલ્લભભાઈ પટેલના વિવિધ પાસાંને ઉજાગર કરતું પુસ્તક



સાહિત્ય અકાડમી (પ્રાદેશિક કાર્યાલય)  
 ૧૭૨, મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય માર્ગ,  
 શારદા સિનેમા બિલ્ડિંગ, દાદર, મુંબઈ - ૪૦૦૦૧૪  
 ફોન: ૨૪૯૩૫૭૪૪૫૫ સ: ૮૧-૨૨-૨૪૯૪૭૬૫૦  
 ઈ-મેલ : sahitya@vsnl.net

## ગુજરાતી પ્રકાશનો

વીસમી સદીનું ગુજરાતી નારીલેખન	૧૭૦-	દુગરિયે દવ લાગ્યો	૧૦૦/-
સંપાદકો : રઘુવીર ચૌધરી		અનિતા ટેસાઈ	
અનિતા દલાલ		અનુવાદિકા : અનિતા દલાલ	
પુલક્ષિત (પુ. લ. દેશપાંડેની કેટલીક રચનાઓ)	૧૧૦-	ઉડાઉંગીર	૮૦/-
સંકલન અને અનુવાદ : અરુણા જાટેજા		લક્ષ્માણ ગાયકવાડ	
સ્મૃતિબંશના પગવે પગવે	૮૦/-	અનુવાદક : રવીન્દ્ર પારેખ	
ગણેશ દેવી		વસમી વેળા	૨૭૫/-
અનુવાદક : ત્રિદીપ સુહુદ		સમરેશ મજમુદાર	
નગર નિર્જન હાથ - જીવનાંદ દાસ	૧૨૦-	અનુવાદ : ચંદ્રકાન્ત મહેતા	
સંપાદન - અનુવાદ : ભોળાભાઈ પટેલ		તિસ્તાકાંદાનું વૃત્તાંત	૩૬૦/-
કલિ-કથા : વાચા બાયપાસ	૧૦૦-	દેવેશ રાય	
અલકા સરાવગી		અનુવાદિકા : અનિતા દલાલ	
અનુવાદિકા : ચંદ્રિકા વ્યાસ		આનંદશંકર ધૂવ : લોખસંચય	૮૦/-
રવિરાશિમ (ભાગ પહેલો)	૮૦/-	સંપાદક : ધીરુ પરીખ	
રવીન્દ્રનાથ ઠાકુર		અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓ	૧૨૦/-
અનુવાદ : બચ્યુભાઈ શુક્લ		સંપાદક : રતિલાલ બોરીસાગર	
રવિરાશિમ (ભાગ બીજો)	૧૦૦/-	ગુજરાતી આત્મકથાલેખન	૧૩૫/-
રવીન્દ્રનાથ ઠાકુર		સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા	
અનુવાદક : બચ્યુભાઈ શુક્લ		ગુજરાતી લખિત નિબંધ સંચયન	૧૦૦/-
હોમ્ડેટ	૭૦/-	સંપાદન : ભોળાભાઈ પટેલ	
વિલિયમ શેક્સપીઅર		કાગડા અને છૂટકારો	૮૦/-
અનુવાદક : મનસુખલાલ જીવેરી		નિર્મલ વર્મા	
વોલ્ફન	૧૨૦/-	અનુવાદક : વીનેશ અંતાણી	
હેન્રી ડેવિડ થોર્ને		દીવાલમાં એક બારી હતી	૮૦/-
અનુવાદક : સુંદરજી બેયર્ટ		વિનોદકુમાર શુક્લ	
ઉપાદેલા રંગોથી રિસાયેલી ભીતો	૬૦/-	અનુવાદિકા : સુનીતા ચૌધરી	
વિપાશા		નવા યુગનું પરોઢ	૩૨૫/-
ગામીત દંતકથાઓ	૭૦/-	સુનિલ ગંગોપાધ્યાય	
સંકલન અને ભાવાનુવાદ		અનુવાદિકા : ઉમા રંદેરિયા	
ઝાધર રેમંડ એ. ચૌહાણ			

Subscribe Akademi's Bi-monthly Journals (Rates from Jan. 2007)

કાર્યક્રમાનુસાર જીવનાંદ રચનાઓ Single Copy : Rs. 25, One year Subscription : Rs. 125,

Three Years Subscription : Rs. 350

Indian Literature Single Copy : Rs. 50, One Year Subscription :


Rs. 250, Three Years Subscription : Rs. 650

Subscription booked before 31 March 2007 - One Year Subscription : Rs. 125,

Three Years Subscription : Rs. 350

..દો- nuôth™ t rôEtu™ u yt™ kE{P f™ tðu , uôtk  
**3/4Z<sup>3</sup>/4ztx ntMÈhEÜte A÷tuA÷ ...wM, ftu**


પહેલું સુખ તે માંદાં પડ્યા  
 લે. વિનોદ ભવ્ટ  
 ■ કિંમત : ૫૦



બીમારી જેવી ઘટનાને પણ  
 હળવાશપૂર્વક લઈને, કશો બોધ  
 આચા વગર હાસ્યનો ધોધ વહાવતા  
 આ પુસ્તકનું વ્યક્તિત્વ જુદું જ છે.  
 લેખક પ્રારંભે જ કહે છે તેમ બીમારી  
 આપણા માટે ભલે સુખદ ન હોય,  
 ડૉક્ટર માટે તો એ સુખદ જ હોય છે  
 ન ! જુદી જુદી બીમારીઓ વખતના  
 લેખકના અનુભવોનું વર્ણન ખાસીઓ  
 હળવાશની આબોહવા પેદા કરે છે.


બીમાર વાચકો આ પુસ્તક  
 વાંચશો તો જરૂર સાજા થઈ જશો,  
 પરંતુ આ પુસ્તક વાંચવા માટે  
 વાચકોએ બીમાર પડવું અનિવાર્ય  
 નથી. માત્ર તંદુરસ્તી વધારવા માટે  
 પણ વાંચી શકાય...

ગુજરાત ગંથરલન કાર્યાલય  
**ગુજરાત સાહિત્યભવન**  
 રતનપીળનાકા સામે, ગાંધીમાર્ગ,  
 અમદાવાદ-૩૮૦૦૦૧  
 ફોન: ૨૨૧૪૪૬૬૬૩, ૨૨૧૪૪૬૬૦  
 ફેક્સ: ૨૨૧૪૪૬૬૩




પાનનાં બીડાં  
 જ્યોતીન્દ્ર દવે

રૂ. ૧૦૦




મંગાલ-અમંગાલ  
 વિનોદ ભવ્ટ

રૂ. ૮૫



પાનું પંચાયાનમું  
 અશોક દવે

રૂ. ૮૦



મરક-મરક  
 રતિલાલ બોરીસાગર

રૂ. ૫૦

જ્યોતીન્દ્રતરંગ	જ્યોતીન્દ્ર દવે	રૂ. ૧૦૫
રંગતરંગ પુ. ૬	જ્યોતીન્દ્ર દવે	રૂ. ૮૮
ભર્દેભર્દ	રમણભાઈ નીલકંઠ	રૂ. ૧૦
મગનું નામ મરી	વિનોદ ભવ્ટ	રૂ. ૮
વિનોદની નજરે	વિનોદ ભવ્ટ	રૂ. ૧૦
અંબ આડા કાન (ઠિનામી)	વિનોદ ભવ્ટ	રૂ. ૮
બુધવારની બપોરે	અશોક દવે	રૂ. ૮
એન્ઝોયગ્રાહી (ઠિનામી)	રતિલાલ બોરીસાગર	રૂ. ૧૦
‘શાંખી ‘કુ’ સુધી	રતિલાલ બોરીસાગર	રૂ. ૧૫
ઢાઈ અક્ષર હાસ્યકા (ઠિનામી)	નિરંજન ત્રિવેદી	રૂ. ૮
સરવાળે ભાગાકાર (ઠિનામી)	નિરંજન ત્રિવેદી	રૂ. ૫૫
પ્રિયદર્શની હાસ્યલીલા	ડૉ. મધુસૂદન પારેખ	રૂ. ૮
પ્રિયદર્શનો હાસ્યવિહાર	ડૉ. મધુસૂદન પારેખ	રૂ. ૮
સાંબેલાના સૂર	કૃષ્ણ પંડિત	રૂ. ૮૦
ગુજરાતી હાસ્ય – ગઈકાલ અને આજ	રાજેન્દ્ર જોધી	રૂ. ૧૦
અવળી-સાવળી વાતો	ચંદહાસ ત્રિવેદી	રૂ. ૮
પુષ્પો અને પતંગિયાં	ડૉ. રતન રુસ્તમજી માર્શલ	રૂ. ૮
હળવી કલમનાં ફૂલ	ચંદકાન્ત શેઠ	રૂ. ૬૦
હાસ્ય મધુરમ્	મુકુંદરાય પંડ્યા	રૂ. ૬૦

સંસ્કાર સાહિત્યમંડિર (બાધો ૧૧.૩૦થી સાંજે ૭.૦૦)

૫, N.B.C.C. હાઉસ, સહજાનંદ કોલેજની બાજુમાં,  
 અંબાવાડી, અમદાવાદ-૧૫ ફોન : ૨૬૩૦૪૨૫૮

દ્વારા પોર્ટર : ૪૧-૪૨-૪૩, શ્રીજી આર્કેડ,  
 આનંદમહેલ રોડ, અડાજણા, સુરત-૩૬૫૦૦૮  
 ફોન : ૦૨૬૧-૩૨૧૦૭૮૮